

Annual Accounts and Auditor's Report 2019 - 20



Gujarat Water Supply & Sewerage Board

"Jalseva Bhavan", Opp. Air Force Campus,
Sector-10/A, Gandhinagar - 382 010.

Phone : (079) 23222547, 23229162, 23225624, 23226336

Fax : 23225979 Website : www.gwssb.gujarat.gov.in

INDEPENDENT AUDITOR'S REPORT

To
Hon. Governorshri,
Government of Gujarat,
Gandhinagar.

1. In terms of our appointment under section 42(3) (a) of the Gujarat Water Supply and Sewerage Board Act, 1978, we have audited the attached Balance Sheet of the Gujarat Water Supply and Sewerage Board, Gandhinagar ("the Board"), as at 31st March 2020 and also the Income and Expenditure Account for the year ended on that date annexed thereto and the Cash Flow Statement for the year ended on that date (herein after referred to as Financial Statements). These financial statements are the responsibility of the management of the Board. Our responsibility is to express an opinion on these financial statements based on our audit.
2. We conducted our audit in accordance with Auditing Standards generally accepted in India. Those Standards require that we plan and perform the audit to obtain reasonable assurance about whether the financial statements are free from material misstatement. An audit includes examining, on a test basis, evidence supporting the amounts and disclosures in the financial statements. An audit also includes assessing the accounting principles used and significant estimates made by management, as well as evaluating the overall financial statement presentation. We believe that our audit provides a reasonable basis for our opinion.

On the basis of the audit indicated herein above, we report that,

3. **The Board has not complied with the following Accounting Standards prescribed by The Institute of Chartered Accountants of India as applicable to it:**
 - i) Inventories are valued at cost instead of at lower of cost or net realizable value which is contrary to the Accounting Standard (AS) 2 "Valuation of Inventories".
 - ii) Credit of proportionate grant equivalent to depreciation charged on the assets acquired out of grant is not taken to income and expenditure account which is contrary to Accounting Standard (AS) 12 "Accounting for Government Grants".
 - iii) Provision for long term employee benefits in the form of leave encashment is not made on the basis of actuarial valuation which is contrary to Accounting Standard (AS) 15 "Employee Benefits".
 - iv) The Board has not made disclosure relating to Fixed Assets in the financial statements as required by para 39 (i) of the Accounting Standard (AS) 10 "Accounting for Fixed Assets".
 - v) The Board has not conducted the test of impairment of assets and compiled the relevant information with regard to impaired assets. Consequently, it has not given effect of impairment of assets in current year loss and also not adjusted carrying value of assets impaired.



4. We draw attention to following Notes of Schedule 16 to the Financial Statements :

- a) Note no. 2.3(e)(iii), regarding amount of interest on short term deposit (including savings bank interest) invested out of deposits received for various deposit works, credited to concerned deposit accounts instead of income & Expenditure account.
- b) Note no. 2.5(a), of significant accounting policies, regarding charging of depreciation on fixed assets as per the rates prescribed under the Income Tax Rules as in force on 01.04.1981 which has undergone change from time to time.
- c) As per note 2.5 (b), of significant accounting policies, no depreciation is charged on the assets received as donation. We could not verify this accounting treatment in the absence of identification/ disclosure of those assets received by way of donation separately in the balance sheet.
- d) As per note 2.5 (c), of significant accounting policies, depreciation of assets purchased or sold during the year is provided for full year instead of on proportionate basis.
- e) Note no. 3.1, regarding preparation of accounts on the basis of "Going Concern", though the net worth of the Board has been substantially eroded for the reasons stated there in.
- f) Note no.3.3(b) and 3.3 (c) regarding depreciation charged on machineries and buildings purchased/constructed out of grant debited income and Expenditure Account .
- g) Note no. 3.4, regarding pending reconciliation of Cash Settlement Suspense Account of **Rs. 5,063.86** Lakh and not recognizing ETP charges on the same in the financial statements.
- h) Note no. 3.5, regarding pending receipt of acceptance of compliance and / or final report from office of Comptroller and Auditor General of India in respect of 916 paras raised during the course of audit of various offices of the Board. Accounting impacts on account of non compliance could not be ascertained.
- i) Note no. 3.6, regarding pending approval of Government of Gujarat, non provisions of arrears of salary for sixth pay commission payable to 714 Rojamdard employees for want of approval from Finance Department in Government of Gujarat in the financial statements.
- j) Note no. 3.7, regarding non provision of penalties/interest payable on less/non deduction/delayed payment of income tax deducted At Source/GST, non filing of prescribed returns of income tax/GST in time, interest on delayed payment of GEB bills, non provision of interest on Govt. of Gujarat loan, non provision of arrears of 7th pay Commission payable to employees and non provision of leave encashment liabilities for GWSSB employees on deputation to WASMO & GWIL.
- k) Note No. 3.8 regarding income of water charges accounted for on Cash basis.
- l) Note no. 3.10(a), regarding provision in respect of outstanding bills of water charges of **Rs.57,241.17** Lakh (net of amount paid) raised by Gujarat Water Infrastructure Limited and note no. 3.10(b), regarding non provision in respect of outstanding bill of water charges of **Rs. 66,809.91** Lakh raised by Narmada Water Resources, Water Supply and Kalpsar Department.
- m) Note no. 3.11, regarding assets worth Rs.768.35 crore created out of grant under Bulk Water Transmission pipeline Project to be transferred to Gujarat Water Infrastructure



- Limited, pending its identification and determination of consideration.
- n) Note no. 3.12(a), regarding difference of **Rs.878.36** Lakh (credit) between value of inventory as per method of valuation adopted and as per records, which is not adjusted in the financial statements pending its reconciliation, note no. 3.12(c), regarding difference of **Rs. 31.30** Lakh of inter division material transfer, which is not adjusted pending its reconciliation, note no. 3.12(d), regarding non provision of certain unserviceable, unusable, obsolete and scrap items of inventories, pending its identification, note no. 3.12(f), regarding non accounting of transfer of material at site from one scheme to other scheme.
- o) Note no. 3.14, regarding non provision for bad and doubtful debts for water charges dues Rs. 39,074.26 Lakh outstanding from local government bodies and government departments.
- p) Note no. 3.15, regarding non accounting of Rs. 246.22 Lakh receivable for reimbursement of expenditure under Apprentice Act, 1961 from Central and State government.
- q) Note no. 3.16, regarding non deduction of tax at source under income tax Act, 1961 on payment of leave encashment to employees on retirement.
- r) Note no. 3.18(a), regarding non provision of loss on account of misappropriation of cash of **Rs. 11.18** Lakh (Net), note no 3.18(b), regarding recovery to be made of advance payment made to contractors by P.H.W Division, Dahod of **Rs. 75.20** Lakh, note no. 3.18(c), regarding recovery to be made in case of suspected fraud being reported at Public Health Circle Amreli Office in respect of payment of **Rs. 3211.00** Lakh made to contractor and suppliers, note no 3.18(d), regarding outstanding recovery of **Rs. 600.00** Lakh from M/S Sanghi cement, the award for which is awaited from arbitrator, note no.3.18(e), regarding non-recovery of misappropriated amount of **Rs. 18.82** Lakh, note no. 3.18(h), regarding serious irregularities noticed in P.H. Works Division Botad for excess payments made to contractors for **Rs.4.09** Lakh, unauthorized purchase fo Tractor and Trailer of **Rs. 9.65** Lakh for Gram Panchyat and diversion of funds from contingency fund to project funds, note no.3.18(l), regarding unadjusted imprest **Rs.12.30** Lakh by P.H. sub Division Dayapar debited to MPW Advance account and note no.3.28, regarding inquires conducted by Enforcement Cell in relation to application / complaints regarding mal-practices, and corrupt prectices against various offices of the Board.
- s) Note no.3.20, regarding outstanding debit/credit balances are subject to confirmation, reconciliation and/ or adjustments.
- t) Note no. 3.25, regarding non compilation of requisite relevant information with regard to impairment of assets and non accounting or loss on account of impairment of assets in the financial statements.
- u) Note no. 3.26, regarding non identification of enterprises which have provided material and services to GWSSB and covered under the definition of Micro, Small and Medium Enterprises, as defined under Micro, Small and Medium Enterprises Development Act, 2006 and non-disclosure of information as required by the said Act.



- v) Note no. 3.27, regarding non adjustment of income out of the amount of recovery of loans to local bodies pending confirmation and reconciliation of balances.
- w) The cumulative impact of the matters narrated and described at points No.4(a) to 4 (c) and 4(e) to 4(v) above on the financial statements form the year under review is not ascertained.

5. We are unable to form an opinion :

- a) About the effect of adjustment that may arise, on reconciliation of difference of **Rs.878.36** Lakh(Credit) and **Rs.6,679.22** Lakh (Debit) between value of inventory as per financial records and as per physical verification conducted. [Note no. 3.12 (a) and 3.12 (b)]
 - b) About the realisability of Sundry Debtors of **Rs.39,074.26** Lakh as no payment is received since long time and the confirmation of balances have not been obtained from parties (Note no. 3.14) and about the balances of sundry creditors, Loans and advances and advances to employees are subject to confirmation by respective parties and reconciliation (note no. 3.19)
 - c) About inquires being conducted for irregularities noticed in expenditure of **Rs. 82.50** Lakh incurred from imprest by Nakhatrana division (Note No. 3.18 (f), regarding inquires being conducted for expenditure incurred in excess of delegation of powers given to field officers (Note No. 3.18 (g) and about serious irregularities of missing voucher of Rs. 1.60 Lakh (Note no. 3.18 (h).
 - d) About the effect of adjustment that may arise on reconciliation, of balances in accounts as listed in Note No. 3.20 of Schedule 16, which are subject to reconciliation and adjustments.
 - e) About the effect, of adjustment that may arise, on reconciliation of balance of **Rs.24,176.90** Lakh under the head Remittance in Transit and balance of **Rs. 16.57** Lakh under imprest account as per Note No. 3.21 of Schedule 16.
- 6.** The effect of the matters referred to in para 3, 4 and 5 above on relevant assets and liabilities as well as on income & expenditure account of the Board cannot be ascertained.
- 7.** Internal control system over various areas of operations is not adequate and needs to be strengthened on account of Inadequate staff, resulting into work not being carried out in effective manner and requiring necessary training to improve technical competence, non monitoring and review of accounts at divisional level at regular interval of time and Non compliance of observations / remarks of internal auditors.
- 8.**
- a) We have obtained all the information and explanations, which to the best of our knowledge and belief were necessary for the purpose of our audit.
 - b) In our opinion proper books of accounts and other records are kept in manner as suggested in the accounting manual and subsequent guidelines as issued and approved by the Board.
 - c) The Balance Sheet, Income & Expenditure Account and Cash Flow Statement dealt with by this report are in agreement with the financial statements.



9. Subject to the remarks in para 3, 4, 5, 6 and 7 above, in our opinion and to the best of our information and according to the explanations given to us, the said accounts give the information required by the Gujarat Water Supply and Sewerage Board Act, 1978, in the manner so required and give a true and fair view in conformity with the accounting principles generally accepted in India:

- i) In the case of Balance Sheet, the state of affairs of the Board as at 31st March 2020.
- ii) In the case of Income and Expenditure account, of the excess of expenditure over income (deficit) for the year ended on that date.
- iii) In case of Cash Flow statement, of the cash flows of the Board for the year ended on that date.

For, B.Upadhyay & Co.
Chartered Accountants
Firm Registration No: 111166w

(H.B. Upadhyay)
Partner
Membership No. : 038198
UDIN No. 21038198AAAB25733

Place : Gandhinagar
Date : 08/02/2021



BALANCE SHEET AS AT 31st MARCH 2020

(Rs. in lakh)

Particulars	Schedule	Amount	As at 31.03.20	As at 31.03.19
Sources of Funds :				
Board Funds				
Contribution from Govt. of Gujarat		125.00		125.00
Reserves & Surplus	1	<u>5,574.62</u>	5,699.62	<u>5,554.62</u>
			5,679.62	5,679.62
Unsecured Loans	2		14,377.58	14,377.58
Grants & Deposits for works (Net of Expenditure)	3		316,692.77	284,738.65
Total			336,769.97	304,795.85
Application of Funds :				
Fixed Assets (Net of depreciation)	4		5,023.57	5,080.66
Current Assets, Loans & Advances				
Inventories	5	32,999.85		30,279.62
Sundry Debtors	6	39,074.26		39,082.40
Cash & Bank Balances	7	84,273.31		2,31,012.98
Loans & Advances	8	1,86,534.83		20,132.54
Other Current Assets	9	<u>3,364.20</u>		<u>1,963.87</u>
		3,46,246.45		3,22,471.41
Current Liabilities & Provisions				
Current Liabilities	10	1,52,126.88		1,59,385.74
Provisions		<u>6061.00</u>		<u>5,805.88</u>
		1,58,187.88		1,65,191.62
Net Current Assets			1,88,058.57	1,57,279.79
Income & Expenditure Account			1,43,687.83	1,42,435.40
Total			3,36,769.97	3,04,795.85
Notes forming part of Accounts	16			

M. P. Pujara
Financial Controller

Mayur Mehta, IAS
Member Secretary

Dhananjay Dwivedi, IAS
Chairman

As per our report of even date attached

B. Upadhyay & Co.
Chartered Accountants
Firm Registration No. : 111166w

Sd/-
(H.B. Upadhyay)
Partner
Membership No. : 038198

Place : Gandhinagar
Date : 08/02/2021

Place : Gandhinagar
Date : 08/02/2021



INCOME AND EXPENDITURE ACCOUNT FOR THE YEAR ENDED 31st MARCH 2020
(Rs. in lakh)

Particulars	Schedule	For the year ended 31.03.20	For the year ended 31.03.19
INCOME :			
Income from Operations	11	27,440.38	31,766.38
Grant	12	74,394.31	80,901.86
Other Income	13	4,761.25	9,574.87
TOTAL		106,595.94	122,243.11
EXPENSES :			
Payments to & Provisions for Employees' Salary	14	19,298.81	30,316.40
Expenditure on Survey & Investigation		14.25	19.53
Operation & Maintenance of :			
a) Water Supply Schemes		83,679.34	1,15,774.04
b) Laboratory		3.99	0.22
Administrative and other Expenses	15	4,708.44	5,203.28
Depreciation		223.69	234.29
TOTAL		1,07,928.52	1,51,547.76
Surplus/(Deficit) for the year before tax and prior period adjustments		(1,332.58)	(29,304.65)
Add /Less :			
Prior Period Adjustments (Net Cr.)		80.15	758.13
		80.15	758.13
Surplus/ (Deficit) for the year		(1,252.43)	(28,546.52)
(Deficit) brought forward from Previous year		(142,435.40)	(114,820.88)
Balance Brought forward from General reserve (Cr.)		--	932.00
(Deficit) carried to Balance Sheet		(143,687.83)	(142,435.40)
Notes forming Part of Accounts	16		

M. P. Pujara
Financial Controller

Mayur Mehta, IAS
Member Secretary

Dhananjay Dwivedi, IAS
Chairman

As per our report of even date attached

B. Upadhyay & Co.
Chartered Accountants
Firm Registration No. : 111166w

Sd/-
(H.B. Upadhyay)
Partner
Membership No. : 038198

Place : Gandhinagar
Date : 08/02/2021

Place : Gandhinagar
Date : 08/02/2021



CASH FLOW STATEMENT FOR THE YEAR ENDED 31ST MARCH 2020
(Rs. In Lakh)

Sr. No.	Particulars	For the Year Ended 31.03.20 (Rs.)	For the Year Ended 31.03.19 (Rs.)
(A)	Cash Flow from Operating Activities		
	Surplus/ (deficit) before taxation and prior period adjustments.	(1,332.58)	(29,304.65)
	Adjustments for :		
(i)	Depreciation	223.69	234.29
(ii)	Provision for Gratuity	255.12	5,791.49
	Operating Profit before working Capital changes	(853.77)	(23,278.87)
	Movements in working capital:		
(i)	Decrease / (Increase) in Inventories	(2,720.23)	(3,044.03)
(ii)	Decrease / (Increase) in Trade receivables	8.14	(46.14)
(iii)	Decrease / (Increase) in Loans and Advances/ Other Current Assets	(1,67,746.78)	17,328.40
(iv)	(Decrease)/ Increase in Trade Payables	(7,258.86)	26,223.68
	Cash generated from operations.	(178,571.50)	17,183.04
	Direct Taxes Paid (TDS)	(55.84)	(8.61)
	Cash Flow from Prior Period Items	80.15	758.13
	Net Cash Flow from Operating Activities (A)	(1,78,547.19)	17,932.56
(B)	Cash Flow from Investing Activities		
(i)	Purchase of Fixed Assets	(166.60)	(626.33)
	Net cash from Investing Activities (B)	(166.60)	(626.33)
(C)	Cash Flow from Financing Activities.		
(I)	Proceeds for works	1,98,749.37	2,62,495.75
(ii)	Expenditure on works	(1,66,795.25)	(182,534.25)
(iii)	Capital Grant received	20.00	18.00
	Net Cash from financing activities (c)	31,974.12	79,979.50
	Net (Decrease)/Increase in Cash and Cash Equivalents (A+B+C)	(1,46,739.67)	97,285.73
	Cash and Cash Equivalents as at beginning of the Year	2,31,012.98	1,33,727.25
	Cash and Cash Equivalents as at end of the Year	84,273.31	231,012.98

Note : The above Cash Flow statement has been prepared under the 'Indirect Method' as set out in Accounting Standard-3 on Cash Flow Statement' Issued by the Institute of Chartered Accountants of India.

M. P. Pujara
Financial Controller

Mayur Mehta, IAS
Member Secretary

Dhananjay Dwivedi, IAS
Chairman

As per our report of even date attached

B. Upadhyay & Co.
Chartered Accountants
Firm Registration No. : 111166w

Sd/-
(H.B. Upadhyay)
Partner
Membership No. : 038198

Place : Gandhinagar
Date : 08/02/2021

Place : Gandhinagar
Date : 08/02/2021



SCHEDULES TO THE BALANCE SHEET AS AT 31-3-2020

SCHEDULE - 1 : RESERVES AND SURPLUS

(Rs. in lakh)

Particulars	Amount	As at 31.03.20	As at 31.03.19
(A) Capital Reserve :			
i) Excess of the amount of Liabilities over the amount of Assets Transferred from the erstwhile Public Health Engineering Wing (PHEW) to the Board on 01.04.1981 Balance as per last Balance Sheet		1,648.97	1,648.97
ii) Capital Grant from Government of Gujarat :			
a) For purchase of Tools and Plants			
Balance as per Last Balance Sheet	1,616.34		1,598.34
Add : Received During the Year	<u>20.00</u>		<u>18.00</u>
		1,636.34	1,616.34
b) For construction of Building :			
Balance as per last Balance Sheet		2,262.16	2,262.16
iii) Capital Equipments received from UNICEF by way of donation - value of rigs, handpumps, vehicles etc.			
Balance as per last Balance Sheet		27.15	27.15
(B) General Reserve			
Balance as per Last Balance Sheet		--	932.00
Less :			
Transferred to income and expenditure Account		--	932.00
TOTAL		5,574.62	5,554.62

SCHEDULE - 2 : UNSECURED LOANS

(Rs. inLakh)

Particulars	As at 31.03.20	As at 31.03.19
(A) Revolving fund from Government of Gujarat for repayment of loans and interest on such loans granted to local bodies by LIC of India.	14,377.58	14,377.58
TOTAL	14,377.58	14,377.58



Annual Accounts and Auditor's Report 2019-20

SCHEDULE - 3 : GRANTS / DEPOSITS FOR WORKS

(Rs. in lakh)

Particulars	Amount	As at 31.03.20	As at 31.03.19
(A) For Government Works :			
Balance As per Last Balance Sheet		22,69,515.55	20,86,276.71
Add : Received During the Year from :			
(a) Government of Gujarat (100% State Share)	1,31,851.00		2,04,909.84
(b) Government of Gujarat(50% State Share)	39,030.88		--
(c) Interest received on Grant Fund	5,144.89		--
(d) Received from GWIL	5,347.95		17,436.52
(e) Received from Wasmo	6,796.46		549.55
(f) Received from Panchayat Deptt.	100.00		--
Less :			
(i) Transferred to Income & Expenditure Account (Refer Schedule 12)	54,374.31		63,381.86
(ii) Transferred to WASMO	9,071.02		1,953.01
(iii) Transferred to GWIL	9,478.53		--
		1,15,347.32	1,57,561.04
(b) Government of India	39,030.88		22,227.04
Add :			
(i) Received from WASMO	4,474.03		549.55
(ii) Interest received on Grant	225.63		--
Less :			
(i) Transferred to GWIL	9,429.53		--
(ii) Grant return to GOI	612.44		--
(iii) Transferred to WASMO (Water and Sanitation Management Organization)	2,143.12		2,364.57
		31,545.45	20,412.02
(c) Other Deposit for Works		3,646.88	5,265.78
		24,20,055.20	22,69,515.55
(B) From Local Bodies & Other Works :			
Balance as per last Balance Sheet		5,15,604.01	4,36,347.10
Add : Received During the Year		48,209.72	79,256.91
		5,63,813.73	5,15,604.01
Total		29,83,868.93	27,85,119.56
Less : Expenditure on works (As stated in Schedule-3-1)		26,67,176.16	25,00,380.91
Net balance		3,16,692.77	2,84,738.65

SCHEDULE - 3-1 : STATEMENT OF SECTORWISE EXPENDITURE ON WORKS

(Rs. inLakh)

Particulars	As at 31.03.19	During the year	As at 31.03.20
(A) From Grants of Govt. of Gujarat			
(1) Non Tribal			
M.N.P. Non Ida/ Rural Water Supply Scheme	2,61,377.60	36,955.26	2,98,332.86
Special Repairs/ Rejuvenation of IVWSS	1,51,358.17	14,620.38	1,65,978.55
Basic Minimum Services	3,691.78	0.00	3,691.78
Lok Adalat Specified Work (Govt.)	204.61	0.00	204.61
Purchase of Dams/ Water Reservoirs	970.67	0.00	970.67
Canal Lining	452.72	0.00	452.72
HUDCO Project	72,148.34	7.30	72,155.64
Religious Places W.S.S.	1,690.09	114.81	1,804.90
Solar Mini	134.40	40.01	174.41
Narmada Based Mahi pipe line Water Supply Scheme	61,230.77	776.88	62,007.65
I.E.C. Activities & its Pertaining Expenses	401.39	(0.34)	401.05
H.R.D. GOG Funds	305.58	0.00	305.58
Research & Development	1,216.72	73.59	1,290.31
Advance Technology (Non Tribal)	497.24	0.00	497.24
NABARD Projects	29,053.03	(0.00)	29,053.03
G.S.F.S. Sahayak Yojana	1,611.59	0.00	1,611.59
Sardar Sarovar Canal based drinking W.S. Project	1,11,830.02	216.74	1,12,046.76
A.U.W.S.P., G.O.G. Share (Non Tribal)	4,160.25	0.00	4,160.25
Other Un Specified Scheme (Local Bodies/ Government)	256.75	0.00	256.75
10th Finance Commission Scheme	6,303.36	0.00	6,303.36
11th Finance Commission Scheme	6,596.05	0.00	6,596.05
12th Finance Commission Scheme	156.52	0.00	156.52
M.N.P. Special Component	25,315.61	1,166.69	26,482.30
Field Level Computerisation Project	787.67	(0.36)	787.31
Poverty Alleviation Programme (Salt Agariya)	4,718.69	0.00	4,718.69
Border Area Development Programme	4,163.67	793.61	4,957.28
Defluoridation Scheme (GOG Share)	19,023.60	24.81	19,048.41
Sujalam Suflam Yojana	1,56,734.17	0.00	1,56,734.17
SC Sub Plan Non Divi. S.S.Canal Based Drinking WS Scheme	2,181.58	0.00	2,181.58
Swarnim Gujarat	332.97	0.00	332.97
Sagar Khedu (MNP)	14.13	0.00	14.13
Scarcity Programme	1,02,659.56	4,940.92	1,07,600.48
Other Natural Calamities	26,931.73	1,119.65	28,051.38
M.N.P. Externally Aided Project	10,308.31	0.00	10,308.31
World Bank Sanitation Programme	10,643.22	0.00	10,643.22
Technology Mission	1,895.56	0.00	1,895.56
NRDWP Coverage tribal G.O.G. (ARP Incentive)	18,575.47	15,507.71	34,083.18
Sectoral Reform Scheme	3,504.51	0.00	3,504.51
Water Quality Monitoring Survey (GOG)	1,415.88	368.09	1,783.97
Desert Area Development Programme (GOG)	14,474.58	768.11	15,242.69
Desert Area Development Programme Tribale (GOG)	97.85	0.00	97.85
Desert Area Development Programme S.C (GOG)	119.35	0.00	119.35
Sustainability recharging Non Tribale (GOG)	27.85	0.00	27.85



SCHEDULE - 3-1 : STATEMENT OF SECTORWISE EXPENDITURE ON WORKS

(Rs. inLakh)

Particulars	As at 31.03.19	During the year	As at 31.03.20
ADB Project	33,468.57	0.00	33,468.57
As and when Urban Water Supply Scheme	49,188.49	177.65	49,366.14
Cash settlement Suspense	5,308.36	(244.50)	5,063.86
M.P.W.A.	814.85	16.38	831.23
(2) Tribal			
M.N.P. Non IDA	195,136.79	20,129.40	215,266.19
A.U.W.S.P.(G.O.G Share)	1,766.60	0.00	1,766.60
Defluoridation Scheme (GOG Share)	8,282.56	0.00	8,282.56
Hand pump Installation	56,155.83	3,551.48	59,707.31
Special Repairs to R.R.W.S.S.	4,944.82	708.03	5,652.85
Special Repairs to I.V.W.S.S.	6,323.53	1,515.21	7,838.74
GIA to Gram Panchayat for Ind. Pipeline WSS	762.69	0.00	762.69
Mini Pipe Line (GOG Portion)	11,979.52	1,641.91	13,621.43
Rural Water Supply (MNP) Except S.C.Area	37,319.89	8,813.23	46,133.12
O.G. Area (Out Growth Area)	2,189.37	3.35	2,192.72
Sujalam Suflam Yojana	4,636.36	4.17	4,640.53
Advance Technology	66.97	0.00	66.97
Tanker Water Supply	0.97	0.00	0.97
Sustainability recharging GoG (Tribal)	55.83	0.00	55.83
Rural Low Cost Sanitation	31.85	0.00	31.85
	15,38,007.45	1,13,810.17	16,51,817.62
(B) From Grant of Govt. of India			
National Rural Drinking Water Programme (w.e.f. 01.04.2009 formerly Accelerated Rural Water Supply Programme)	3,13,048.44	24,330.26	3,37,378.70
NRDWP Sustainability-Recharging	15,571.47	31.92	15,603.39
Mini Pipeline (Non Tribal)	719.66	0.00	719.66
Mini Pipeline (Tribal) GOI Portion	8,888.56	23.33	8,911.89
H.R.D.	35.54	0.65	36.19
NRDWP Coverage (Water Quality Problem)	68,504.38	21.17	68,525.55
Desert Area Development Programme (DDP)	82,920.89	3,950.97	86,871.86
Water Quality Monitoring & Surveillance	5,530.04	454.88	5,984.92
Computerisation	984.86	0.00	984.86
Laboratory Establishment	48.30	0.00	48.30
A.U.W.S.P.(G.O.I Share)	4,230.10	0.00	4,230.10
PM Programme	1,950.85	0.00	1,950.85
ARP (5 % ADD Central Grant)	248.98	0.00	248.98
Earmarked Fund (Chemical)	157.68	0.00	157.68
	5,02,839.75	28,813.18	5,31,652.93
(c) From Deposit (from Others)			
Deposit work Urban Water Supply Scheme	1,28,993.91	(268.20)	1,28,725.71
Deposit work W.S.	2,749.15	225.22	2,974.37
Deposit work Amrut Project	7,746.93	2,104.51	9,851.44
Deposit work Amrut Drainage Sheme	1,776.25	3,963.69	5,739.94
Amrut Project STP (Deposit Work)	-	1,512.26	1,512.26



SCHEDULE - 3-1 : STATEMENT OF SECTOR WISE EXPENDITURE ON WORKS

(Rs. inLakh)

Particulars	As at 31.03.19	During the year	As at 31.03.20
Treated waste water	-	2.75	2.75
Deposit work Urban Drainage Scheme	1,89,303.05	5,429.20	1,94,732.25
Rurban Drainage Programme	246.76	75.97	322.73
Deposit work Rurban Water Supply	-	129.43	129.43
Deposit work (Urban Cell)	-	3,799.66	3,799.66
As and when Urban Water Supply Scheme	1,043.09	0.00	1,043.09
Scarcity Programme	2,299.64	0.00	2,299.64
Emergency Water Supply Scheme	3,025.96	0.00	3,025.96
Ayojan Mandal works / Dist. Planning-Vivekadhin	1,01,436.87	5,924.08	1,07,360.95
A.T.V.T. Programme	4,159.26	395.04	4,554.30
Solar Mini	973.90	271.77	1,245.67
As and when Rural Drainage Scheme	10,129.37	606.52	10,735.89
IDA Urban Drainage	5,649.57	0.00	5,649.57
Total	4,59,533.71	24,171.90	4,83,705.61
Current Year TOTAL	25,00,380.91	1,66,795.25	26,67,176.16
Previous Year TOTAL	23,17,846.66	1,82,534.25	25,00,380.91

(Rs. in lakh)

SCHEDULE - 4 : FIXED ASSETS

Sr. No.	Description of Assets	WDV As at 01-04-2019	Additions/ adjustment during the year	Total As at 31-03-2020	Depreciation for the Year	WDVAs at 31-03-2020	WDVAS at 31-03-2019
1	Land	1,296.70	0.00	1,296.70	0.00	1,296.70	1,296.70
2	Buildings	2,715.40	3.90	2,719.30	67.98	2,651.32	2,715.40
3	Water Works Machinery	185.01	0.00	185.01	5.44	179.57	185.01
4	Rigs & Other Tools, Plant & Machinery	6.17	0.00	6.17	0.62	5.55	6.17
5	Furniture & Fixtures, Electrical Equipment & Appliances, Office & Other Equipment etc.	161.49	10.48	171.97	19.21	152.76	161.49
6	Vehicles	214.36	63.73	278.09	55.62	222.47	214.36
7	Library Books	0.34	0.00	0.34	0.04	0.30	0.34
8	Computer Hardware	478.00	20.55	498.55	74.78	423.77	478.00
	TOTAL	5,057.47	98.66	5,156.13	223.69	4,932.44	5,057.47
9	Building under Construction	23.19	67.94	91.13	0.00	91.13	23.19
	GRAND TOTAL	5,080.66	166.60	5,247.26	223.69	5,023.57	5,080.66
	Previous Year	4,688.62	626.33	5,314.95	234.29	5,080.66	4,688.62



(Rs. in lakh)		
Particulars	As at 31.03.20	As at 31.03.19
SCHEDULE - 5 : INVENTORIES		
Inventories of Material (Including Material at Site)	32,999.85	30,279.62
TOTAL	32,999.85	30,279.62
SCHEDULE - 6 : SUNDRY DEBTORS (UNSECURED)		
(i) Sundry Debtors for water charges (Considered Good)	38,481.90	38,481.90
(ii) Sundry Debtors for rent of water tanker	592.36	
Considered Doubtfull	15.00	615.50
	39,089.26	39,097.40
Less: Provision for Bad & Doubtful debts (Water Tankers)	15.00	15.00
TOTAL	39,074.26	39,082.40
SCHEDULE - 7 : CASH AND BANK BALANCES		
(A) Cash on hand	0.24	0.24
(B) Balance with Banks:		
(i) In Current/ Saving Accounts (Including Flexi Dposit)	53,052.99	143,474.20
(ii) In Term Deposit Accounts	7,026.61	61,562.56
(iii) Remittance in Transit	24,176.90	25,917.40
(iv) Imprest (including Temporary Advance)	16.57	58.58
TOTAL	84,273.31	2,31,012.98
SCHEDULE - 8 : LOANS AND ADVANCES		
(A) Advances Recoverable in Cash or kind or for value to be received	1,942.74	1,660.87
(B) Due from Government of Gujarat in respect of payments made to Employees on deputation.	103.08	103.08
(c) Loans to Municipalities (Guaranteed by Government of Gujarat)	2,938.41	2,938.41
(D) Due from Local Bodies for Repayment of L.I.C and Government Loans	10,291.25	10,722.82
(E) Deposit with Courts for pending cases	483.97	441.87
(F) Term Deposit with Financial Institutions	1,70,092.69	3,639.18
(G) Income Tax Deducted At Source	350.49	294.65
(H) Others	332.20	331.66
TOTAL	1,86,534.83	20,132.54
SCHEDULE - 9 : OTHER CURRENT ASSETS		
Interest Receivable on Term Deposits with Banks/ Financial Institutions and from staff	3,364.20	1,963.87
TOTAL	3,364.20	1,963.87



Annual Accounts and Auditor's Report 2019-20

(Rs. in lakh)

Particulars	As at 31.03.20	As at 31.03.19
SCHEDULE - 10 : CURRENT LIABILITIES AND PROVISIONS		
(A) Current Liabilities :		
(i) Creditors for Works	9,847.82	5,871.63
(ii) Creditors for Works (Deposits)	67,053.02	65,660.31
(iii) Creditors for Expenses	72,791.62	85,482.75
(iv) Due to Government (Including deductions made from payments to employees on deputation)	1,620.52	1,770.57
(V) Other	813.90	600.48
	1,52,126.88	1,59,385.74
(B) Provisions:		
(i) Gratuity	6,061.00	5,805.88
	6,061.00	5,805.88
TOTAL	1,58,187.88	1,65,191.62

Particulars	For the Year Ended 31.03.20	For the Year Ended 31.03.19
SCHEDULE - 11 : INCOME FROM OPERATIONS		
(A) Recovery of ETP Charges	17,297.49	20,415.29
(B) Sale of Water	10,142.89	11,351.09
TOTAL	27,440.38	31,766.38

SCHEDULE - 12 : GRANT

(A) From Government of Gujarat towards :

(i) Administrative Charges	10,000.00	7,500.00
(ii) Operation & Maintenance Charges (Includes amount of Rs. 54,374.31Lakh (Previous year 63,381.86 lakh) transferred from grants / Deposits for Works (GOG refer Schedule-3)	64,374.31	73,381.86
(iii) Survey and Investigation Charges	20.00	20.00
	74,394.31	80,901.86

(B) From Government of India towards :

NRDWP Operation & Maintenance (Transferred from Govt. of India Grant Refer Schedule - 3)	0.00	0.00
--	------	------

TOTAL	74,394.31	80,901.86
--------------	------------------	------------------

SCHEDULE - 13 : OTHER INCOME

(A) Tender fee	197.88	212.43
(B) Rent and Hire Charges	77.03	81.28
(c) Interest	3,060.68	6,875.43
(D) Stock Storage Charges	153.68	232.78
(E) Miscellaneous Income	1,271.98	2,172.95
TOTAL	4,761.25	9,574.87



(Rs. in lakh)

Particulars	For the Year Ended 31.03.20	For the Year Ended 31.03.19
SCHEDULE - 14 : PAYMENT TO & PROVISIONS FOR EMPLOYEES		
(A) Salaries, Wages and Allowances	14,037.69	14,576.73
(B) Leave salary, Pension, Gratuity & Provident Fund Contribution	5122.65	15,593.12
(C) Staff Welfare Expenses	138.47	146.55
TOTAL	19,298.81	30,316.40

Particulars	For the Year Ended 31.03.20	For the Year Ended 31.03.19
SCHEDULE - 15 : ADMINISTRATIVE AND OTHER EXPENSES		
(1) Rent, Rates and Taxes	195.85	168.16
(2) Printing & Stationary	312.25	309.97
(3) Postage & Telephone	81.37	95.94
(4) Advertisement and Publicity	180.30	230.32
(5) Electricity and Water Charges	120.70	113.73
(6) Books and Periodicals	2.66	4.56
(7) Travelling and Conveyance	4.17	3.16
(8) Statutory Audit Fees	5.82	5.82
(9) Internal Audit Fees & Out of Pocket Expenses	20.43	17.99
(10) Professional Fees	966.12	1,089.44
(11) Training and Seminar Expense	0.85	0.18
(12) Entertainment Expenses	22.16	21.27
(13) Miscellaneous Office Expenses	163.17	148.01
(14) Bank Charges	5.86	6.85
(15) Repairs & Maintenance to Building	623.37	748.99
(16) Maintenance & Repairs to Vehicle & Insurance	1,606.66	1,705.87
(17) Stores Expenses	316.53	363.05
(18) General Charges	80.17	169.97
TOTAL	4,708.44	5,203.28



SCHEDULE - 16
NOTES FORMING PART OF THE ACCOUNTS

1. INTRODUCTORY

Gujarat Water Supply and Sewerage Board (GWSSB) is an Undertaking of Government of Gujarat set up under the Gujarat Water Supply and Sewerage Board Act, 1978 (The Act) for the development and proper regulation of water supply and sewerage services in the State of Gujarat.

Section 42 (2) of The Act stipulates that GWSSB shall prepare the Balance Sheet in such form and manner as the regulations may require. As per Section 77 of the Act, the Board is empowered to make regulations with the previous approval of the Government of Gujarat for the administration of its affairs. No regulations have been made so far by the Board. However, GWSSB has got prepared a Manual of Commercial Accounting System. The Balance Sheet and Income and Expenditure Account of GWSSB have been drawn up mainly as per the format prescribed in the said manual with suitable modifications for reflecting the transactions on the basis of "Generally Accepted Accounting Principles" and applicable Accounting Standards unless otherwise stated in the notes forming part of the accounts.

2. SIGNIFICANT ACCOUNTING POLICIES:

2.1 Accounting Convention:

The accounts of GWSSB are prepared under the historic cost convention method. GWSSB has generally followed the accrual system of accounting except wherever stated otherwise.

2.2 Use of Estimates:

The preparation of the financial statements requires estimates and assumptions to be made that affect the reported amount of assets and liabilities on the date of the financial statements and the reported amount of revenues and expenses during the reporting period. Difference between the actual results and estimates are recognized in the period in which the results are known / materialized.

2.3 Revenue Recognition:

- a. Income of ETP (Establishment, Tools & Plant {etc.}) charges is recognized on the basis of expenditure incurred on identified schemes, as per the notifications issued by Government of Gujarat from time to time and as agreed to by concerned agencies, which assigned the works to GWSSB as Deposit Works.
- b. Income from sale of water and related income are recognized on cash basis considering uncertainty as to its realization.
- c. "Interest on mobilization advances", wherever it is recoverable, is recognized on accrual basis.
- d. Interest on Deposits with Banks / Financial Institutions or other Corporations is recognized on accrual basis.
- e. (i) Interest from short term bank deposits (including saving bank account interest), temporarily invested out of grant received from Government of India till its utilization for the

specific purpose, is initially included in Income & Expenditure Account and then transferred to Capital Grant Account as per the scheme guidelines. The same has been shown under “Grants / Deposit for Works” in Schedule 3 of the Balance Sheet.

- (ii) Interest from short term deposits, (including savings bank account), temporarily invested out of grant received from Government of Gujarat till its utilization for the specific purpose is initially included in Income & Expenditure Account and then transferred to Capital Grant Account as per the guidelines. The same has been shown under “ Grants/ Deposits Works in Schedule-3 of the Balance sheet.
- (iii) Interest from short term bank deposits (including savings bank interest) invested out of Deposits received for Urban, Rurban, Amrut and Urban STP Projects, till its utilization is credited to the concerned Deposits account and shown under “grants/Deposit Works” in Schedule-3 of the balance sheet.
- f. Interest earned on deposits with UGVCL/MGVCL/DGVCL/PGVCL has been adjusted against energy bills issued by Electricity Company and accordingly, expenditure of energy bills net of interest income is charged to M&R expenses.
- g. All other incomes are accounted on the basis of actual realization.

2.4 Fixed Assets:

- a. Fixed assets are stated at their written down value. In case of sale / disposal of assets where information about original cost or written down value is not available, the sale price is credited to Asset Account.
- b. Cost of fixed assets includes purchase cost and expenditure incurred for their acquisition as well as construction / installation and other related expenditure.
- c. Impairment of Assets:
An asset is treated as impaired when carrying amount of the asset exceeds its recoverable value. An impairment loss is charged to the Income and Expenditure Account in the year in which an asset is identified as impaired. The impairment loss recognized in prior accounting period is reversed if, there has been a change in estimates of recoverable amount.

2.5 Depreciation:

- a. Depreciation on fixed assets other than grantable assets (except buildings and machinery), has been provided for on written down value method at the rates prescribed under the Income Tax Rules as in force on 01.04.1981. Such rates are considered adequate by GWSSB for the purpose of depreciation.
- b. No depreciation is provided on those assets which have been received as donation from any entity / body.
- c. In respect of addition and sale of assets during the year, depreciation is provided for the full year.

2.6 Inventories:

- a. Materials with stores and at site have been valued at Cost. For this purpose, cost includes purchase cost, storage charges and other related expenditure.



- b. Materials purchased for specific works (schemes) are charged to the works (schemes) expenditure at the time of purchase.

2.7 Borrowing Cost:

Borrowing cost attributable to the acquisition and construction of assets are capitalized as part of the cost of such assets up to the date when such assets are ready for their intended use. Other borrowing costs are treated as revenue expenditure.

2.8 Expenditure on works :

Expenditure (including ETP wherever applicable) incurred towards specific schemes / projects are charged to the concerned projects / schemes.

2.9 Employee Benefits:

- a. Contributions to the provident and pension funds are charged to Income and Expenditure Account.
- b. Provision for leave encashment benefit payable at the time of retirement is made, based on the liability valued considering accumulated leave balance as at the end of financial year at the current applicable salary including dearness allowance and CLA paid to respective employees.
- c. GWSSB has taken a Group gratuity Life Assurance Policy from the Life Insurance Corporation of India (LIC). Provision has been made towards uncovered gratuity liabilities in the accounts, based upon the valuation certificate issued by LIC.

2.10 Taxes on Income:

- a. Current income tax is measured at the amount expected to be paid to tax authorities in accordance with the Income Tax Act, 1961.
- b. Deferred tax resulting from "timing difference" between book and taxable profit is accounted for using the tax rates and laws that have been enacted or substantively enacted as on the balance sheet date. Deferred tax asset is recognized and carried forward only to the extent of reasonable certainty that the assets will be realized in future.

2.11 Provisions, Contingent Liabilities and Contingent Assets:

- a. Provisions are made in respect of materials received / services obtained up to the end of the accounting year in relation to Scheme Expenditure on the basis of work completed and certified by approving authority.
- b. Provisions involving substantial degree of estimation in measurement are recognized when there is a present obligation as a result of past event and it is probable that there will be an outflow of resources. Contingent Liabilities are not recognized but are disclosed in the notes. Contingent Assets are neither recognized nor disclosed in the financial statements.

2.12 Grants and Contributions from Local Bodies:

- a. Grant for maintenance of schemes (including water and electricity charges) and administrative charges received under Plan and Non Plan heads from Government of Gujarat is considered as grant for revenue expenditure and is recognized and accounted for on its realization. The same is credited to Income and Expenditure Account.

- b. Capital grants towards expenditure on various schemes are recognized and accounted for on realization based on of Government Resolution(s).
- c. Contributions from Local Bodies towards expenditure on various schemes are accounted for on the basis of actual receipt.

2.13 Prior Period Income / Expenses:

All identifiable items of income and expenditure pertaining to prior period are accounted through net prior period Income / Expenditure.

2.14 General:

Accounting policies not specifically referred to are consistent with generally accepted accounting practice.

3. NOTES ON ACCOUNTS:

3.1 Though the net worth of GWSSB has been substantially eroded, taking into account the Budgetary Support of Government of Gujarat, the accounts have been prepared on the basis of "Going Concern".

3.2 Contingent Liabilities:

Particulars	2019-20	2018-19
I) Estimated liabilities on capital commitments	Not ascertained	Not ascertained
II) Estimated amount of compensation payable to		
a) Employees	Not ascertained	Not ascertained
b) Other than employees	Rs 41,028.13Lakh	Rs 21,737.02Lakh

Contingent Liabilities in respect of income tax:

(Rs. In Lakh)

Assessment Year	Assessed u/s 143(3) Tax payable	Tax paid	Remarks
2010-11	Rs.1705.21	-	CIT (A) deleted the entire addition and demand is consequently reduced to Nil. ITAT (Ahmedabad) upheld this order of CIT (A). Demand as per Income Tax portal is therefore NIL. However, the Department has filed appeal against the order of ITAT (Ahmedabad) with Hon. Gujarat High Court.
2012-13	Rs.1.26	-	Order U/S 143(3) received with demand of Rs.1.26 Lakh. A rectification application under section 154 of the I.T. Act,1961 has been filed by the board in the office of Deputy CIT, Gandhinagar, which is yet not finalized.



Assessment Year	Assessed u/s 143(3) Tax payable	Tax paid	Remarks
2013-14	Rs.976.56	-	CIT (A) deleted the entire addition and demand is consequently reduced to Nil. ITAT (Ahmedabad) upheld the order of CIT (A). Demand as per Income Tax portal is therefore NIL. However, the Department has filed appeal against the order of ITAT (Ahmedabad) with Hon. Gujarat High Court.
2019-20	Rs.3.67	-	Defaults is deduction of tax etc.

3.3 Change in Accounting Policy :

- a) Either to interest received by GWSSB on short term bank deposits (including saving bank interest) invested out of deposits received for Urban, Rurban, Amrut and Urban STP Projects for Deposit Works till its utilization has been credited to Income & Expenditure Account in the financial Statements. GWSSB has during the year, changed its accounting policy and accordingly, interest received on short term deposits (Including savings bank interest) invested out of deposits received for Urban, Rurban, Amrut and Urban STP Projects till its utilization amounting to Rs. 1113.91 lakh has been credited to concerned Deposit Account.
- b) Depreciation on Machinery Purchased out of Grant received from Govt. of Gujarat has been debited to Income & Expenditure account during the year 2019-20 (Amount not ascertained).
- c) GWSSB had received grant in earlier years for construction of buildings amounting to Rs.2262.16 lakh (Previous Year Rs.2262.16 lakh) Depreciation on Buildings constructed out of the said grant has been charged to Income & Expenditure account. (Amount not ascertained).

- 3.4 a) The amount of Rs 5,063.86 Lakh (previous year Rs 5,308.36 Lakh) under the head "Cash Settlement Suspense Account" included in the statement of "Sector-wise Expenditure" (Schedule-3-1) represents expenditure incurred on various schemes by way of services rendered / materials supplied by one division to other divisions, for which, the receiving divisions have not responded by way of corresponding entries in their accounts. This amount will have to be adjusted after reconciling the inter-divisional accounts of GWSSB. ETP on expenditure referred to above have not been accounted for in the books, pending identification of specific schemes by reconciling the inter divisional accounts of GWSSB.

- b) The statement of "Sector wise expenditure" (Schedule 3-1) shows amount of Rs.831.23 Lakh (Previous year Rs. 831.23 Lakh) being M.P.W advance given is subject to reconciliation and adjustments, if any.
- c) "Grants/Deposits for works" (Schedule-3) includes Government of Gujarat Loans of Rs. 5944.60 lakh and scarcity loans of Rs. 4121.13 Lakh received in earlier years.
- 3.5 Pending the receipt of acceptance of compliance and / or final report from C&AG Office up to 31.3.2020 in respect of 916 paras (Comments) (Previous year 916 paras) raised in the course of audit of various offices of GWSSB. The necessary accounting effect if any, will be given in the year of acceptances of replies by A.G. Office.
- 3.6 In respect of 714 Rojamdard employees taken on employment on or after 01.10.1988, GWSSB has not accepted the revision of pay as per the recommendations of 6th Pay Commission for want of approval from Finance Department in Government of Gujarat and hence, no provision has been made for arrears of salary payable to such employees for the period from 1st January, 2006 to 31st March, 2020.
- 3.7 No provision has been made in the financial statements for the year 2019-20 regrading :
- a) Interest on loans given by Government of Gujarat as the terms and conditions of loan are not prescribed in G.Rs.
- b) Penalties/ interest payable to Income Tax/GST authorities for less / non deduction/delayed payment of Income Tax at source, non filing of prescribed returns under Income Tax/GST Act, and penalties for delayed payments of electricity bills, as the payments for the same is made as and when demand is raised.
- c) Arrears of 7th pay Commission payable to employees as the approval from Government of Gujarat is awaited.
- d) Leave encachment liabilities for employees of GWSSB sent on deputation to WASMO and GWIL.
- 3.8 For the Financial year 2019-20, GWSSB has recognized the income of water charges on cash basis amounting to Rs.10142.89 Lakh (previous year Rs.11351.09 Lakh). Water charges receivable for the year 2019-20 amounting to Rs. 20562.06 Lakh (previous year Rs.10630.11 Lakh) have not been recognized and not shown in Income & Expenditure account since its ultimate realization is not certain
- 3.9 The amount of Rs.14377.58 lakh (Previous year Rs.14377.58 lakh) being loans received by GWSSB in earlier years from Government of Gujarat in the form of Revolving fund for repaying loans and interest thereon, granted by LIC of India to local bodies has been shown in Schedule-2 'Unsecured loans' of the financial statements. GWSSB has undertaken the responsibility of repayment of the said loans.
- 3.10 a) Gujarat Water Infrastructure Limited (GWIL) has raised bills of water charges amounting to Rs. 57241.17 Lakh (net of amount paid) (Previous year Rs.66,216.80 Lakh) for supply of water to GWSSB up to financial year 2019-20. GWSSB is of the opinion that outstanding amount of bills are payable subject to reconciliation and confirmation. However, GWSSB has made provision in respect of all outstanding bills of water charges payable to GWIL in the financial statements.



b) Narmada Water Resources, Water Supply and Kalpsar Department of Government of Gujarat has raised bills of water charges amounting to Rs 66,809.91 Lakh (including penalty of Rs. 20,457.02 Lakh and interest charges of Rs 36,598.85 Lakh) ((previous year Rs 66,318.32 lakh (including penalty of Rs. 19,642.67 lakh and interest charges of Rs. 36,416.77 lakh)) for supply of water to GWSSB till March 31, 2020. However, there is a dispute with regards to the bills raised (including penalty and interest charges levied on delay payment) by NWRWS and Kalpsar department. Pending finalization of dispute, the cumulative amount payable by GWSSB is not ascertained and hence provision in respect thereof is not made in the financial statements.

3.11 As per the order of Government of Gujarat, assets created by GWSSB, out of Government grant under following bulk Water Transmission pipe line project by GWSSB were to be transferred to Gujarat Water Infrastructure Limited (GWIL)

(Rs. In Crore)

Sr. No.	Scheme	Amount	Sr. No.	Scheme	Amount
1.	NC-6 (Maliya to Morbi)	100.86	5.	SPP-1 (Pariaj to Pipli)	89.04
2.	NC-7 (Morbi to Tankara)	120.29	6.	SPP-2 (Pipli to Navda)	89.04
3.	NC-9 (Maliya to Bhachau)	155.65	7.	SPP-3 (Navda- Botad-Gadhada)	57.00
4.	NC-12 (Tankara to Ratan)	104.47	8.	SPP-4 (Navda- Vallabhipur)	52.00
				TOTAL	768.35

However, in the absence of determination of consideration and completion of other formalities as of March 31, 2020, accounting adjustment being uncertain, has not been made in the financial statements. Necessary accounting adjustments will be made on completion of relevant formalities and determination of consideration.

3.12 a) The inventories have been valued and shown in the Balance Sheet at cost. Pending Reconciliation, the difference between the value so arrived at and the value as per financial records of Rs.878.36 Lakh (credit) (Previous Year Rs 878.36 Lakh (credit)) is not adjusted in the financial statements and the same is shown as store adjustment account in "Inventories" (schedule-5).

b) Physical verification of inventories has been partly conducted by Internal Auditors (The firms of Chartered Accountants) at the end of financial year 2019-20 due to covid pandemic. As per physical verification, Carried out the value of inventories was Rs.27,198.99 Lakh (previous year Rs.24,010.04 Lakh) and value of inventories as per financial records was Rs. 33,878.21 Lakh (previous year Rs.31,157.98 Lakh) (exclusive of Rs.878.36 Lakh as shown in note No.3.12(a) above).The difference of Rs.6679.22 Lakh (previous year Rs.7,147.94 Lakh (Debit) between the value of inventories as per physical verification and value as per financial records are not adjusted in the financial Statements, pending its reconciliation.



- c) Mechanical Store Division, Gandhinagar, issues requisite stores/ materials to different divisions of GWSSB and materials receiving divisions give accounting effects in their accounts on receipt of the same. As of 31/3/2020, accounting effects of materials amounting to Rs 31.30 Lakh (Previous year Rs 31.30 Lakh) issued by Mechanical store division to different divisions are not given in the books of respective division pending its reconciliation and acceptance.
- d) The inventory includes certain unserviceable, unusable, obsolete and scrap items, which are to be identified and disposed off. Provision in respect thereof is not made in the financial statements pending identification of such items.
- e) An amount of Rs 153.67 Lakh (Previous Year Rs 232.77 Lakh) as stock storage charges is credited in income and expenditure account being handling charges recovered by stores divisions from divisions to which the material have been issued at predetermined rates.
- f) On completion of different schemes, materials lying on the site (MAS) of completed scheme is transferred to the site of other ongoing Schemes. However, no accounting effect is given in the financial statement for such transfer of materials. Consequently, expenditure of completed scheme is overstated to that extent, whereas expenditure of schemes on which such materials have been transferred is understated (Amount not ascertained).
- 3.13 Hitherto gratuity liabilities up to 2018-19 has been worked out proportionately by GWSSB based on accrued gratuity Liability (as of 31st July) certificate issued by LIC of India. However, during the year 2019-20, LIC of India has first time worked out gratuity Liabilities as per actuarial valuation as of 31.03.2020 to comply with AS 15. Accordingly, provision for gratuity liabilities for the year 2019-20 of Rs.6061.00 lakh has been made in the financial statements based on actuarial valuation of Gratuity liabilities.
- 3.14 Sundry debtors of Rs. 39074.26 Lakh (previous year Rs. 39,082.26 Lakh) represents the amount outstanding on account of water charges, rent of water tankers and other miscellaneous rent billed/ charged to the concerned local Government Bodies and Government Departments up to March 31, 2020, which is subject to reconciliation. The recoveries of the dues are not forthcoming on their due dates. However, GWSSB is hopeful of recovery of outstanding from local Government Bodies and Government Departments. Hence, no provision for bad & doubtful debts (except for Rs.15 Lakh of water tanker debtors provided in earlier years) has been made in the financial statements.
- 3.15 As per Apprentice Act, 1961, GWSSB has employed apprentices. Reimbursement of expenditure is receivable under Central Government National Apprentice Promotion Scheme and State Government's Chief Minister Apprentice Scheme. GWSSB has lodged the claims for reimbursement up to 31.03.2020 amounting to Rs.41.35 lakh with Central Government and Rs.204.87 lakhs with State Government respectively. However, the said amount (Rs.246.22 lakh) receivable is not accounted for in the financial statements, as the same will be accounted for on receipt of actual amount of claims lodged.



- 3.16 No Tax has been deducted at source (TDS) under the Income tax Act on payment of leave encashment to employees on retirement by GWSSB on the ground that all the employees of GWSSB are State Govt. employees for which confirmation from Government of Gujarat is awaited.
- 3.17 a) In view of accumulated losses, GWSSB is not required to pay tax under the provisions of the Income Tax Act, 1961. Since GWSSB is not a company registered under Companies Act, 1956, no provision is made for Minimum Alternative Tax on Book Profit as per the provisions of Income Tax Act, 1961.
- b) In view of accumulated losses, deferred tax assets have not been recognized on consideration of prudence.
- 3.18 (a) GWSSB had determined six cases of misappropriation of cash amounting to Rs 29.59 Lakh Gross (Previous year of Rs 29.59 Lakh)(Gross) as against which Rs.18.41 Lakh (Previous year Rs.16.94 Lakh) have been recovered up to the year 2019-20. The administrative actions in this regard have been taken by the management to recover the misappropriated amount. Since the matter is sub-judice, provision for loss, if any, has not been made in the financial statements.
- (b) Executive Engineer of public health works division, Dahod, was transferred in earlier year to another division office, even though, he made advance Payments of Rs 402.55 lakh to the contractors and for popular contribution (Lok falo) of Rs 83.35 lakh which was to be collected by contractor from people as against which Rs 349.65 lakh (previous year Rs 349.65 lakh) and Rs 61.05 lakh (previous year Rs.61.05 lakh) respectively have been recovered upto 31-03-2020. Necessary administrative actions have been taken by the Board in the matter.
- (c) Out of Suspected fraud reported at Public Health Circle Office, Amreli during the financial year 2008-09 in respect of payments made to contractor and suppliers, Rs 3211.00 lakh (Previous year Rs. 3211.00 Lakh) has been identified till date by GWSSB. Necessary administrative actions have been taken by GWSSB including criminal case filed against 6 employees in Principal District and Sessions Court, Amreli and filing suits against 7 contractors to recover Rs.3211.00 Lakh. The case is dismissed by the Hon. Senior Civil Judge on date 04.03.2020. However, actions are being taken by GWSSB to file the case again in the Hon. Court.
- (d) GWSSB has given advance of Rs 1,500.00 lakh to M/s. Sanghi cement for supply of water to certain villages. Out of the same, Rs 600.00 lakh (Previous year Rs.600.00 lakh) is remaining outstanding to be recovered. Matter of recovery is under dispute and the said matter is referred to arbitrator. Award from arbitrator is yet awaited.
- e) During the year 2014-15, it was observed that Income from Water charges and drainage connection deposit of Rs 18.82 lakh received from the users were misappropriated in Public Health Sub division, Ahwa-Dang. GWSSB has initiated administrative action against the concerned officers/employees. However, misappropriated amount is yet to be recovered.



- f) Internal Auditors of Public Health Works Division, Nakhatrana have found serious irregularities in expenditure of Rs.82.50 Lakh incurred out of Rs.124.98 Lakh imprest given to the sub division offices and opined to conduct detailed inquiry. Based on the report of Internal Auditors, GWSSB has initiated preliminary inquiry. Reports of the same are awaited.
- g) Based on the Internal Auditors report of Public Health Works Division, Dev Bhumi Dwarka, sub division offices have incurred M&R expenditure in excess of powers delegated to the concerned officers (splitting of expenditure) during the year 2018-19, Internal Auditors have opined to conduct departmental investigation. Accordingly, primary enquiry is initiated by GWSSB. Reports are yet to be received. The same practice of utilizing excess power by sub division offices is observed by the Internal Auditor during the course of Internal Audit for the year 2019-20. Actions in the matter are being taken. Likewise, while carrying out internal audit for the year 2018-19, Internal Auditors of Public Health Works Division, Rajpipla have observed that Executive Engineer has incurred expenditure on purchase of chairs beyond the powers delegated to him. Primary enquiry was initiated by GWSSB. Reports of the same are awaited.
- h) during the course of Internal Audit for the year 2019-20, Internal Auditors of Public Health Works Division, Botad have found serious irregularities of excess payment to contractor (Rs.4.09 Lakh), unauthorized purchase of Tractor and Trailer for Gram Panchayat (Rs.9.65 Lakh), missing of vouchers of contractor (Rs.1.60 Lakh) and diversion of fund from contingency fund to project funds. On the basis of this internal audit report, GWSSB has initiated preliminary inquiry. Reports of the same are awaited.
- l) Imprest given in earlier years to Public Health Sub Division, Dayapar (working under Public Health Works Division, Nakhatrana) remained unadjusted amounting to Rs.12.30 Lakh which has been debited to MPW Advance account during the year 2019-20.
- 3.19 Balances of Sundry Debtors, Sundry Creditors, Current liabilities, Deposits, Loans & Advances and Advances to employees are subject to confirmation by respective parties and reconciliation.
- 3.20 Balances outstanding (debit/ credit) as on March 31, 2020 in the following accounts are subject to confirmation, reconciliations and / or adjustment, if any.
- 3.20.1 Funds for Scarcity (Credit) Rs 38719.45 Lakh (Previous Year (Credit) Rs. 35719.45 Lakh)
- 3.20.2 Other Capital Receipts (Credit) Rs 8.45 Lakh (Previous Year (Credit) Rs. 8.45 Lakh)
- 3.20.3 Deposits from Supplier (Credit) Rs 5389.84 Lakh (Previous Year (Credit) Rs. 5488.40 Lakh)
- 3.20.4 Deposits from Work Contract (Credit) Rs 30073.81 Lakh (Previous Year (Credit) Rs.37258.53 Lakh)
- 3.20.5 Deposits from Others (Credit) Rs 19477.64 Lakh (Previous Year (Credit) Rs. 19303.99 Lakh)
- 3.20.6 Kirloskar Constant Figures (Credit) Rs 5051.14 Lakh (Previous Year (Credit) Rs.5051.14 Lakh)
- 3.20.7 Kirloskar Constant Figure (Debit) Rs 2630.51 Lakh (Previous Year (Debit) Rs. 2630.51 Lakh)
- 3.20.8 Sundry Creditors for Purchase Suspense (Debit) Rs 133.33Lakh. (Previous Year (Dedit) Rs.133.33 Lakh)
- 3.20.9 C.S.S. Responded outside Circle (Credit) Rs 1108.01Lakh. (Previous Year (Credit) Rs. 1108.01 Lakh)
- 3.20.10 C.S.S. Responded within Circle (Credit) Rs 161.81Lakh. (Previous Year (Credit) Rs.161.81 Lakh)
- 3.20.11 Deposits from Local Bodies (GIA Portion) (Credit) Rs 2175.93Lakh (Previous Year (Credit) Rs. 2172.34 Lakh)



- 3.20.12 Deposits Loan Portion (Credit) Rs 3750.31 Lakh. (Previous Year (Credit) Rs. 3750.31 Lakh)
- 3.20.13 GIA to Local Bodies (Credit) Rs 1596.49 Lakh. (Previous Year (Credit) Rs. 1596.49 Lakh)
- 3.20.14 Deposit Suspense (Credit) Rs 40.61 Lakh. (Previous Year (Credit) Rs. 52.71 Lakh)
- 3.20.15 Employer's contribution to Provident Fund (Debit) Rs 0.08 Lakh. (Previous Year (Debit) Rs. 0.08 Lakh)
- 3.20.16 Recovery of P.F. Loans from employees (Credit) Rs 37.41 Lakh. (Previous Year (Credit) Rs. 37.41 Lakh)
- 3.20.17 Amount Received from Local Authority (Credit) Rs 209920.97 Lakh. (Previous Year (Credit) Rs. 205327.17 Lakh)
- 3.20.18 Loans to Local Bodies (Debit) Rs 2938.41 Lakh. (Previous Year (Debit) Rs. 2938.41 Lakh)
- 3.20.19 From LIC Loans (Debit) Rs 2013.44 Lakh. (Previous Year (Debit) Rs. 2013.44 Lakh)
- 3.20.20 From Government Loans (Debit) Rs 981.26 Lakh. (Previous Year (Debit) Rs. 981.26 Lakh)
- 3.20.21 For IDA Projects (Debit) Rs 100.52 Lakh. (Previous Year (Debit) Rs. 100.52 Lakh)
- 3.20.22 GIA to Local Bodies (Debit) Rs 1011.02 Lakh. (Previous Year (Debit) Rs. 1011.02 Lakh)
- 3.20.23 H.B.A. Advance Principal (Board) (Debit) Rs 3.44 Lakh. (Previous Year (Debit) Rs. 3.49 Lakh)
- 3.20.24 Housing Building Advance (Credit) Rs 7.49 Lakh. (Previous Year (Credit) Rs. 7.49 Lakh)
- 3.20.25 Conveyance Advance (Credit) Rs 90.38 Lakh. (Previous Year (Credit) Rs. 89.85 Lakh)
- 3.20.26 Festival Advance (Credit) Rs 51.29 Lakh. (Previous Year (Credit) Rs. 50.71 Lakh)
- 3.20.27 Food grain Advance (Credit) Rs 77.60 Lakh. (Previous Year (Credit) Rs. 77.29 Lakh)
- 3.20.28 Other Advance (Credit) Rs 1.54 Lakh. (Previous Year (Credit) Rs. 1.54 Lakh)
- 3.20.29 Loans /Advances to department employees (Debit) Rs 7.57 Lakh. (Previous Year (Debit) Rs. 7.57 Lakh)
- 3.20.30 Claims Recoverable from others (Debit) Rs 46.34 Lakh. (Previous Year (Debit) Rs. 45.85 Lakh)
- 3.20.31 Claims Recoverable from suppliers and contractors (Debit) Rs 198.07 Lakh. (Previous Year (Debit) Rs. 203.99 Lakh)
- 3.20.32 Claims Recoverable (Debit) Rs 264.93 Lakh. (Previous Year (Debit) Rs. 60.06 Lakh)
- 3.20.33 Claims Recoverable from GOG (Debit) Rs 50.74 Lakh. (Previous Year (Debit) Rs. 50.74 Lakh)
- 3.20.34 Local Bodies Deposits recoverable from Government of Gujarat (Debit) Rs 135.30 Lakh. (Previous Year (Debit) Rs. 135.30 Lakh)
- 3.20.35 Other items adjusted (Debit) Rs 0.43 Lakh. (Previous Year (Debit) Rs. 0.43 Lakh)
- 3.20.36 Group Insurance scheme (Debit) Rs 104.57 Lakh. (Previous Year (Debit) Rs. 58.37 Lakh)
- 3.21 Balance of Rs. 24,176.90 Lakh (previous year Rs. 25,917.40 Lakh) under the head Remittance in Transit and imprest account Rs. 16.57 Lakh (previous year Rs. 58.58 Lakh) included under Cash and bank balances (Schedule-7) are subject to reconciliation and adjustment.
- 3.22 GWSSB being a Government undertaking, is a state controlled enterprise. No disclosure is required as per Para 9 of the Accounting Standard (AS) 18 "Related Parties Disclosure" as regards related party relationships with other state controlled enterprises and transactions with such enterprises. There were no transactions with Key Management Personnel and therefore, no disclosure is made for the same.
- 3.23 GWSSB, being a Government Undertaking set up under the GWSSB, Act, 1978, does not have share capital. Hence earning per share is not calculated.
- 3.24 GWSSB is managed as a single entity in the field of water supply and sewerage. As such there are no separate reportable segments.
- 3.25 GWSSB has not compiled the requisite relevant information with regard to impairment of assets and therefore, Board has not given any effect in respect thereof in the Financial Statements.



- 3.26 GWSSB has yet to identify enterprises which have provided material and services to GWSSB and which qualify under the definition of micro, small and medium enterprises, as defined under Micro, Small and Medium Enterprises Development Act, 2006. In the absence of relevant information, the requisite disclosures are not made in the financial statement.
- 3.27 GWSSB had obtained loans aggregating to Rs 17,694.27 Lakh (Previous Year Rs. 17694.27) from Life Insurance Corporation of India (LIC) in earlier years for and on behalf of various local bodies. GWSSB has repaid the loans along with interest to LIC in spite of non / short re-payment of loans by local bodies. Amount remaining outstanding from local bodies (subject to reconciliation) is included under the head Loans and Advances. (Shedule-8) (The amount being recovered as principal, interest and delayed payment charges are credited to this account.) The adjustment for income of GWSSB out of the amount of recovery is not made for want of requisite details.
- 3.28 Enforcement cell is set-up at head office of GWSSB from 9.5.1997 which functions under control of Chief Administrative Officer, Vigilance Cell, Gandhinagar. Applications / complaints regarding mal-practices and corrupt practices against various offices of GWSSB are received continuously. In pursuance of which Vigilance Cell conduct inquiry and work of preparing inquiry report is entrusted to Enforcement Cell. Pending receipt of final report / final outcome in respect of inquiries conducted during financial year 2019-20 and earlier years, from Vigilance Cell of various offices of GWSSB. The necessary accounting effect if any will be given in the year of receipt of final report / final outcome from the said office.
- 3.29 Prior Period Adjustments includes:

Particulars	(Rs. InLakh)	
	2019-20	2018-19
Prior Period Transactions (Net)	80.15	758.13

- 3.30 The previous year's figures have been regrouped / rearranged where ever necessary. The amount shown in brackets denotes previous year's figures.

Signature to Schedules 1 to 16

M.P. Pujara
Financial Controller

Mayur Mehta, IAS
Member Secretary

Dhananjay Dwivedi, IAS
Chairman

As per our report of even date attached

For B.Upadhyay & Co.
Chartered Accountants
Firm Registration No. : 111166w

Sd/-
(H. B. Upadhyay)
Partner
Membership No. : 038198

Place : Gandhinagar
Date : 08/02/2021

Place : Gandhinagar
Date : 08/02/2021

વાર્ષિક હિસાબો અને ઓડીટરશ્રીનો અહેવાલ ૨૦૧૯ - ૨૦



ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ

જલસેવા ભવન, સેક્ટર-૧૦/એ, ગાંધીનગર - ૩૮૨૦૧૦.

ફોન : (૦૭૯) ૨૩૨૨૨૫૪૭, ૨૩૨૨૯૧૬૨, ૨૩૨૨૫૬૨૪, ૨૩૨૨૬૩૩૬

ફેક્સ : ૨૩૨૨૫૯૭૯ Website : www.gwssb.gujarat.gov.in

બી. ઉપાધ્યાય એન્ડ કું.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ

ઓડિટરનો સ્વતંત્ર અહેવાલ

પ્રતિ
માનનીય રાજ્યપાલશ્રી,
ગુજરાત સરકાર,
ગાંધીનગર

૧. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ અધિનિયમ-૧૯૭૮ની કલમ ૪૨(૩) (ક) હેઠળ અમારી ઓડિટર તરીકેની ફરવામાં આવેલી નિમણુંકની શરતો ના અનુસંધાને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, ગાંધીનગરનું તા.૩૧મી માર્ચ ૨૦૨૦ ના રોજ પૂરા થતા વર્ષનું આ સાથે જોડેલ સરવૈયું, આવક અને ખર્ચના હિસાબો તથા રોકડ પ્રવાહ પત્રકોનું અમે ઓડિટ કર્યું છે. (જેનો હવે પછી નાણાંકીય પત્રકો તરીકે ઉલ્લેખ થયેલ છે.) આ નાણાંકીય પત્રકો તૈયાર કરવાની જવાબદારી ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના વ્યવસ્થાપકોની છે. અમારી જવાબદારી, આ નાણાંકીય પત્રકો પર અમારા ઓડિટના આધારે અભિપ્રાય વ્યક્ત કરવાની છે.
૨. અમે અમારું ઓડિટ સામાન્ય રીતે ભારતમાં સ્વીકૃત ઓડિટના ધોરણો અનુસાર કર્યું છે. નાણાંકીય પત્રકો તાત્વિક ખોટા કથનોથી મુક્ત છે, તે અંગે ઉચિત ખાત્રી મેળવવા માટે અમે ઓડિટનું આયોજન કરીએ છીએ અને ઓડિટ કામગીરી કરીએ છીએ. રકમોનું સમર્થન કરતાં પુરાવા તથા નાણાંકીય પત્રકોમાં જાહેર કરેલી બાબતોનું કસોટીના ધોરણે પરિક્ષણ કરવાનો ઓડિટમાં સમાવેશ થાય છે. ઓડિટમાં, વ્યવસ્થાપકોએ ઉપયોગ કરેલ હિસાબી સિદ્ધાંતો અને વ્યવસ્થાપન માટે કરેલા મહત્વના અંદાજોનું મૂલ્યાંકન તેમજ સમગ્ર નાણાંકીય પત્રકની રજૂઆતનો પણ સમાવેશ થાય છે. અમે માનીએ છીએ કે અમારું ઓડિટ અમારા અભિપ્રાય માટે ઉચિત આધાર પુરો પાડે છે.

ઉપર દર્શાવ્યા પ્રમાણે અમારા ઓડિટના આધારે અમે અહેવાલ આપીએ છીએ કે,

૩. ભારતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની સંસ્થાએ નિયત કરેલાં, બોર્ડને લાગુ પડતા નીચે મુજબના હિસાબી ધોરણોનું બોર્ડે પાલન કર્યું નથી.
 - (૧) માલ સામાનનું મુલ્ય નિર્ધારણ ન્યૂનતમ પડતર કિંમત અથવા ચોખ્ખી પ્રાપ્ય કિંમત, બેમાંથી જે ઓછી હોય તે કિંમતે કરવું જોઈએ. જે પડતર કિંમતે કર્યું છે. આ બાબત “માલ સામાનની કિંમત નિર્ધારણ” ને લગત, હિસાબી ધોરણ (હિ.ધો.) ૨ થી વિપરિત છે.
 - (૨) અનુદાન માંથી પ્રાપ્ત કરેલ અસ્કયામતો પર ચાર્જ કરેલ ઘસારાને પ્રમાણસર અનુદાનની રકમ, આવક અને ખર્ચ હિસાબમાં જમા લેવામાં આવેલ નથી. જે “સરકારી અનુદાનોનો હિસાબ” ને લગત હિસાબી ધોરણ (હિ.ધો.) ૧૨ થી વિપરિત છે.
 - (૩) સરકારી કર્મચારીઓને રજાના રોકડમાં રૂપાંતર સ્વરૂપમાં મળતા લાંબાગાળાના લાભ, એકચ્યુઅરિયલ મૂલ્યાંકનના આધારે ફરવામાં આવેલ નથી. જે “કર્મચારી લાભ” ને લગત હિસાબી ધોરણ (હિ.ધો.) ૧૫ થી વિપરિત છે.



વાર્ષિક હિસાબો અને ઓડિટરશ્રીનો અહેવાલ ૨૦૧૯-૨૦

- (૪) હિસાબી ધોરણ (હિ.ધો.) ૧૦ “સ્થાયી અસ્કયામતો” માટેના હિસાબી ધોરણોના ફક્ત ૩૯ (૧)ની જરૂરીયાત પ્રમાણે બોર્ડ દ્વારા નાણાંકીય પત્રકોમાં, સ્થાયી અસ્કયામત સંબંધિત વિગતો દર્શાવી નથી.
- (૫) બોર્ડે તેની અસ્કયામતોને થયેલ ક્ષતિ (ઈમ્પ્રોવમેન્ટ) નું પરિક્ષણ હાથ ધર્યું નથી અને ક્ષતિ પામેલ અસ્કયામતો બાબતે સંબંધિત જાણકારી સંકલિત કરી નથી. પરિણામે, અસ્કયામતોને ક્ષતિના કારણે થયેલ નુકસાનની ચાલુ વર્ષના હિસાબોમાં અસર આપેલ નથી તથા ક્ષતિ થયેલ અસ્કયામતોની હાલની કિંમતનું પણ સમાયોજન કરેલ નથી.

૪. અમે નાણાંકીય પત્રકો સાથેની અનુસૂચિ-૧૬ ની નીચેની નોંધો તરફ ધ્યાન દોરીએ છીએ.

- (એ) જુદા જુદા ડિપોઝીટ પરના કામોની ટુંકા ગાળાની થાપણો પરનું વ્યાજ (બચત ખાતાના વ્યાજ સહિત) ની રકમ આવક ખર્ચ ખાતે જમા ન કરતા સંબંધિત ડિપોઝીટ ખાતે જમા કરવા બાબતેની નોંધ ક્ર.૨.૩(ઈ) (iii)
- (બી) મહત્વની નાણાકીય નીતિઓ ઉપરની નોંધ ક્રમાંક ૨.૫ (ક), તા.૦૧.૦૪.૧૯૮૧ થી અમલી અને વખતો વખત સુધારેલા આવક વેરાના નિયમો હેઠળ નિયત કરાયેલા દર પ્રમાણે સ્થાયી અસ્કયામતો પર ઘસારો લાગુ કરવા અંગેની છે.
- (સી) મહત્વની નાણાકીય નીતિઓ ઉપરની મુદ્દા નં. ૨.૫ (ખ) દાન તરીકે મળેલ અસ્કયામતો ઉપર ઘસારો ગણવામાં આવતો નથી. દાન તરીકે મળેલ અસ્કયામતોની અલગ ઓળખ ન થઈ શકવાને/ અલગ ન દર્શાવવાને કારણે અમે તેની હિસાબી અસરો સરવૈયામાં ચકાસી શક્યા નથી.
- (ડી) મહત્વની નાણાકીય નીતિઓ ઉપરની મુદ્દા નં. ૨.૫ (ગ) મુજબ વર્ષ દરમિયાન ખરીદેલી અથવા વેચેલી અસ્કયામતો ઉપર પ્રમાણસરનો ઘસારો ગણવાને બદલે આખા વર્ષનો ઘસારો ગણવામાં આવે છે.
- (ઈ) મહત્વની નાણાકીય નીતિઓ ઉપરની મુદ્દા નં. ૩.૧ “ચાલુ ઉપક્રમ”ના ધોરણે હિસાબ તૈયાર કરવા અંગેની છે. જે કે તેમાં જણાવેલ કારણોસર બોર્ડની ચોખ્ખી સંપત્તિ નોંધપાત્ર રીતે ઘટવા પામી છે.
- (એફ) મહત્વની નાણાકીય નીતિઓ ઉપરની મુદ્દા નં. ૩.૩ (બી) તથા ૩.૩ (સી) અનુક્રમે ગ્રાન્ટમાંથી ખરીદેલ/ બાંધકામ કરેલ મશીનરી તથા મકાનોના ઘસારો સંબંધિત મૂડી અનુદાન સામે ઉદાર ન કરતાં આવક અને ખર્ચ ખાતે ઉદારેલ છે તે સંબંધિત છે.
- (જી) નોંધ નં. ૩.૪, રૂ. ૫૦૬૩.૮૬ લાખના રોકડ પતાવટ ઉપલક્ષ હિસાબના હિસાબમેળ બાકી હોવા સંબંધિત તથા તે ઉપર ઈટીપી ચાર્જ્સની નાણાંકીય પત્રકોમાં ન અપાયેલ નોંધના સંદર્ભમાં આપવામાં આવી છે.
- (એચ) નોંધ ક્રમાંક ૩.૫, ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ દ્વારા બોર્ડની વિવિધ કચેરીઓના ઓડિટ દરમિયાન લેવાયેલા ૯૧૬ ફક્તરો અંગે કરવામાં આવેલ પુર્તતાની સ્વીકૃતિ અથવા આખરી અહેવાલ પ્રાપ્ત થવા સંબંધિત છે. પુર્તતાના સ્વીકારની જાણ કરવા અંગેની પ્રક્રિયા ન થવાને કારણે હિસાબો ઉપર થતી અસર નક્કી કરી શકાઈ નથી.
- (આઈ) નોંધ ક્રમાંક ૩.૬, રોજમદારને દુહા પગાર પંચના પગાર તફાવતના નાણાં ચુકવવા માટે સરકારશ્રીની અનિર્ણિત મંજુરી સરકારશ્રીના નાણાં વિભાગની બાકી મંજુરીને કારણે ૭૧૪ રોજમદારોને દુહા પગારપંચ પ્રમાણેના ચૂકવવા પાત્ર અને ન ચૂકવાયેલ પગાર તફાવતની રકમની જોગવાઈ નાણાંકીય પત્રકોમાં ન કરવા સંબંધિત છે.
- (જે) નોંધ ક્રમાંક ૩.૭ મૂળ સ્થાનેથી આવકવેરાની/ જીએસટીની ઓછી ચૂકવણી/ વસૂલાત ન થવી/ વિલંબિત ચૂકવણાને કારણે ચૂકવવા પાત્ર થતા દંડ/ વ્યાજની જોગવાઈ ન કરવી, આવકવેરા અને જીએસટીના

નિયત પત્રકો સમયસર ન ભરવા, ગુજરાત વિદ્યુત બોર્ડના બીલોના વિલંબિત ચૂકવણા બદલ વ્યાજ, ગુજરાત સરકારની લોન ઉપરના વ્યાજ, કર્મચારીઓને સાતમા પગાર પંચના ચૂકવવા પાત્ર તફાવતની જોગવાઈ ન કરવા તથા બોર્ડના વાસ્તો તથા જીડબલ્યુઆઈએલ ખાતે પ્રતિનિયુક્તિ પરના કર્મચારીઓના રજા પગારના રોકડમાં રૂપાંતરની રકમની જોગવાઈ ન કરવા સંબંધિત છે.

- (કે) નોંધ ક્રમાંક ૩.૮ રોકડના ઘોરણે પાણીની આવકના હિસાબો રાખવા સંબંધિત છે.
- (એલ) નોંધ ક્રમાંક ૩.૧૦ (એ) ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા પાણી ચાર્જની આકારવામાં આવેલ અને ચુકવણા બાકી બીલોને રકમ રૂ. ૫૭૨૪૧.૧૭ લાખ (ચોખ્ખી ચૂકવવા પાત્ર) ની જોગવાઈ સંબંધિત અને નોંધ ક્રમાંક ૩.૧૦ (બી) નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા આકારવામાં આવેલ અને ચૂકવણા બાકી બીલોની રકમ રૂ. ૬૬૮૦૯.૮૧ લાખની જોગવાઈ ન કરવા સંબંધિત છે.
- (એમ) નોંધ ક્રમાંક ૩.૧૧, બલ્ક વોટર પાર્ષપ લાઈન પ્રોજેક્ટ અંતર્ગત મળેલ અનુદાનમાંથી ઉભી થયેલ રૂ. ૭૬૮.૩૫ કરોડની અસ્કયામતો જે ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ લિ. ને તબદીલ કરવાની હોય છે, તેવી મિલ્કતોની ઓળખ તથા રકમ નક્કી ન થઈ શકવા સંબંધિત છે.
- (એન) નોંધ ક્રમાંક ૩.૧૨ (એ) અપનાવેલી મૂલ્યાંકન પદ્ધતિ અનુસાર અને રેકર્ડ મુજબના માલ સામાનના મૂલ્ય વચ્ચે રૂ. ૮૭૮.૩૬ લાખની (જમા) તફાવતની રકમ જે હિસાબમેળ કરવામાં આવેલ નથી. તે અંગેની છે. નોંધ નં. ૩.૧૨ (સી). હિસાબમેળ બાકી હોવાને કારણે સમાયોજિત કરી શકાઈ નથી તેવી આંતર વિભાગીય સામગ્રી તબદીલીના તફાવતની રકમ રૂ. ૩૧.૩૦ લાખ અંગેની છે. નોંધ ક્રમાંક ૩.૧૨ (ડી), જેની રકમ નક્કી કરવી બાકી છે, તેવી સુધારો ન થઈ શકે તેવા (અન સર્વિસેબલ), જુના પુરાણા, બિન ઉપયોગી અને ભંગાર માલ-સામાન બાબત જોગવાઈ ન કરવા સંબંધિત છે. નોંધ ક્રમાંક ૩.૧૨ (એફ) એક યોજનાના કામના સ્થળેથી બીજી યોજના કામના સ્થળે માલસામાનની તબદીલીના હિસાબ ન રાખવા સંબંધિત છે.
- (ઓ) નોંધ ક્રમાંક ૩.૧૪, સ્થાનિક સરકારી સંસ્થા તથા સરકારી વિભાગો પાસેથી લેણાં વોટર ચાર્જસની રકમ રૂ. ૩૮૦૭૪.૨૬ લાખ માટે ઘાલખાધ તથા શંકાસ્પદ લેણાની જોગવાઈ કરવા સંબંધિત છે.
- (પી) નોંધ ક્રમાંક ૩.૧૫ એપ્રેન્ટીસ એક્ટ ૧૯૬૧ હેઠળ રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર તરફથી ખર્ચ ભરપાઈ પેટે મળવાપાત્ર રૂ. ૨૬૪.૨૨ લાખની હિસાબી નોંધ ન કરવા સંબંધિત છે.
- (ક્યુ) નોંધ ક્રમાંક ૩.૧૬ નિવૃત્તિ સમયે કર્મચારીઓને રજા પગારની રોકડમાં ચૂકવણી કરતા સમયે આવક વેરા કાયદા ૧૯૬૧ અંતર્ગત વેરો કપાત ન કરવા સંબંધિત છે.
- (આર) નોંધ ક્રમાંક ૩.૧૮ (એ) રૂ. ૧૧.૧૮ લાખની ચોખ્ખી રોકડની ઉચાપતને કારણે થયેલ નુકસાનની જોગવાઈ, નોંધ ક્રમાંક ૩.૧૮ (બી) જા.આ.બા. વિભાગ, દાહોદ દ્વારા ઠેકેદારોને કરવામાં આવેલ રૂ. ૭૫.૨૦ લાખના એડવાન્સ ચુકવણાની વસુલાત સંબંધિત, નોંધ ક્રમાંક નં. ૩.૧૮ (સી) જાહેર આરોગ્ય વર્તુળ, અમરેલીની કચેરી દ્વારા કોન્ટ્રાક્ટર તથા સપ્લાયર્સને ચુકવેલ રૂ. ૩૨૧૧.૦૦ લાખના ચૂકવણામાં શંકાસ્પદ છેતરપીંડી ના કેસમાં થયેલ વસૂલાત સંબંધિત, નોંધ ક્રમાંક ૩.૧૮ (ડી) આબીટ્રેટરનો એવોર્ડ બાકી છે તેવી મેં. સાંઘી સિમેન્ટ લિ. પાસેથી રૂ. ૬૦૦.૦૦ લાખની બાકી વસૂલાત બાબતે, નોંધ ક્રમાંક ૩.૧૮ (ઈ) ઉચાપતની રકમ રૂ. ૧૮.૮૨ લાખની વસુલાત ન કરવા બાબત અને નોંધ ક્રમાંક ૩.૧૮ (એચ) જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ, બોટાદ દ્વારા કોન્ટ્રાક્ટરને રૂ. ૪.૦૯ લાખના અધિક ચુકવણા, ગ્રામ પંચાયત માટે રૂ. ૯.૬૫ લાખના ટ્રેક્ટર તથા ટ્રેલરની અનઅધિકૃત



ખરીદી તથા અનઅધિકૃત રીતે આકસ્મિક ભંડોળમાંથી પ્રોજેક્ટ ફંડ ખાતે લઈ જવું વગેરે ધ્યાને આવેલ ગંભીર અનિયમિત બાબતની છે. નોંધ ક્રમાંક ૩.૧૮ (આઈ) એમપીડબલ્યુ હિસાબ ખાતે ઉઘારેલ અને જેનો સમાયોજન જાહેર આરોગ્ય પેટા વિભાગ દ્વારા થયું નથી તેવી રૂ. ૧૨.૩૦ લાખની તસલમાત અંગેની છે.ક્ર. ૩.૨૮ બોર્ડની જુદી જુદી કચેરીઓમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર સંબંધિત મળેલ અરજીઓ/ ફરિયાદોના સંબંધમાં એન્ફોર્સમેન્ટ સેલ દ્વારા હાથ કરવામાં આવેલ તપાસ સંબંધિત છે.

- (એસ) નોંધ ક્રમાંક ૩.૨૦ ઉઘાર /જમા બાકીઓ ના સમર્થન, મેળવણી અને/ અથવા સમાયોજનને આધિન હોવા બાબતની છે.
- (ટી) નોંધ ક્રમાંક ૩.૨૫ ક્ષતિયુક્ત અસ્કયામતોને લગતી માહિતી એકત્ર ન કરવા તથા મિલ્કત ક્ષતિયુક્ત થવાને કારણે થતા નુકસાનની નાણાકીય પત્રકોમાં હિસાબી નોંધ ન કરવા બાબત છે.
- (યુ) નોંધ ક્રમાંક ૩.૨૬ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ સાહસ વિકાસ અધિનિયમ, ૨૦૦૬ હેઠળ વ્યાખ્યાયિત ઉપક્રમો કે જેઓએ ગુ.પા.પુ. અને ગ.વ્ય. બોર્ડને માલસામગ્રી અને સેવાઓ પુરી પાડી છે તેવા ઉપક્રમોની ખોળખ ન થઈ શકવા બદલ તથા સદર કાયદામાં જણાવ્યા મુજબ માહિતી પ્રદર્શિત ન કરવા સંબંધિત છે.
- (વી) નોંધ ક્રમાંક ૩.૨૭, સિલકની પુષ્ટિ અને હિસાબમેળ થતાં સુધી સ્થાનિક સંસ્થાઓને આપેલ લોનની વસુલાતની રકમ પૈકી આવકનું સમાયોજન નહીં કરવા સંબંધિત છે.
- (ડબલ્યુ) ઉપર ૪ (એ)થી ૪ (સી) અને ૪ (ઈ) થી ૪ (વી)ની નોંધોમાં વર્ણવેલ તથા સમજાવેલ બાબતોની સમિક્ષા હેઠળના વર્ષના નાણાકીય પત્રકો ઉપરની એકત્રીત અસર નક્કી કરેલ નથી.

૫. અમે અભિપ્રાય બાંધી શકતા નથી.

- (એ) નાણાકીય રેકર્ડ અનુસાર અને કરવામાં આવેલ ભૌતિક ખરાઈ અનુસાર, માલસામાનના મૂલ્ય વચ્ચે રૂ.૮૭૮.૩૬લાખ (જમા) રૂ. ૬,૬૭૯.૨૨ લાખ (ઉઘાર) ના તફાવતનો હિસાબ-મેળ થતા ઉભી થનાર તડબોડની અસર અંગે (નોંધ નં. ૩.૧૨ (એ) અને ૩.૧૨ (બી))
- (બી) લાંબા સમયથી વસુલાત મળી ન હોવાથી તેમજ પક્ષકારો પાસેથી સિલકોની પુષ્ટિ મેળવવામાં આવેલ નથી તેવા રૂ. ૩૯,૦૭૪.૨૬ લાખના પ્રકીર્ણ દેવાદારોની વિશ્વસનિયતા (નોંધ ક્રમાંક ૩. ૧૪) અને પરચુરણ લેણદારો, લોન એન્ડ એડવાન્સીસ અને કર્મચારીઓને પેશગીનું મેળવણું તથા સંબંધિત પક્ષકાર પાસેથી સંમતિને આધિન છે. (નોંધ ક્રમાંક ૩.૧૯).
- (સી) નખત્રાણા વિભાગ દ્વારા તસલમાતમાંથી કરેલ રૂ. ૮૨.૫૦ લાખના ખર્ચમાં ધ્યાને આવેલ અનિયમિતતાઓ બાબતેની હાથ ધરવામાં આવી રહેલ તપાસ (નોંધ ક્રમાંક ૩.૧૮ (એફ)) અને ક્ષેત્રિય અધિકારીઓ દ્વારા સત્તા સોંપણીથી અપાયેલ સત્તા ઉપરાંતના કરવામાં આવેલ ખર્ચ બાબતે હાથ ધરવામાં આવી રહેલ તપાસ બાબત. (નોંધ ક્રમાંક ૩.૧૮ (જી)) રૂ. ૧.૬૦ લાખના ખોવાયેલ વાઉચરની ગંભીર અનિયમિતતા બાબત નોંધ ૩.૧૮ (એચ).
- (ડી) અનુસૂચિ -૧૬ની નોંધ નં.૩.૨૦ માં આપેલી યાદી પ્રમાણે હિસાબોમાંની સિલકોને હિસાબમેળની જે અસર થાય તે હિસાબમેળ તથા સમાયોજન બાબત.
- (ઈ) રેમીટન્સ ઈન ટ્રાન્ઝીટ (માર્ગસ્થ ભરણાં) હેઠળ રૂ. ૨૪,૧૭૬.૯૦ લાખની તથા તસલમાતના ખાતાની સિલક રૂ. ૧૬.૫૭ લાખની સિલકનો હિસાબમેળ થતા સમાયોજનની જે અસર થાય તે અંગેની અનુસૂચિ-૧૬ની નોંધ નં. ૩.૨૧.

૬. ઉપર ફકરા ૩, ૪ અને ૫ માં જણાવવામાં આવેલી બાબતોની અસ્કયામતો અને જવાબદારીઓ તેમજ બોર્ડની આવક અને ખર્ચ ઉપરની અસર આંકી શકાઈ નથી.
૭. કામગીરીના વિવિધ ક્ષેત્રની આંતરિક નિયંત્રણ પદ્ધતિ પુરતી નથી અને અપુરતા કર્મચારીઓને પરિણામે તે સુદ્રઢ કરવી જરૂરી છે. જેથી તાંબ્રિક કાર્યક્ષમતા તથા અસરકારક રીતે કામ થતું નથી અને વિભાગીય સ્તરે હિસાબોનું સમયાંતરે દેખરેખ-નિયંત્રણ અને સમીક્ષા નહીં કરવાના કારણે તથા આંતરિક ઓડિટરોના ગંભીર પ્રકારના અવલોકનો/ ટિપ્પણીઓનું પાલન નહીં કરવાની સ્થિતિમાં જરૂરી તાલીમ આપવી આવશ્યક છે.
૮. (ક) અમારી શ્રેષ્ઠ જાણકારી અને માન્યતા મુજબ અમારા ઓડિટના હેતુ માટે જરૂરી હતી એવી તમામ માહિતી અને ખુલાસાઓ અમે મેળવ્યા છે.
- (ખ) અમારા મતે હિસાબના યોગ્ય ચોપડા તથા અન્ય રેકર્ડ, હિસાબી નિયમ સંગ્રહમાં સૂચવ્યા પ્રમાણે તથા ત્યાર બાદ બોર્ડે બહાર પાડેલી અને મંજૂર કરેલી માર્ગદર્શક સૂચનાઓ અનુસાર રાખવામાં આવેલ છે.
- (ગ) આ અહેવાલમાં હાથ ધરેલ સરવૈયું તથા આવક અને ખર્ચના હિસાબનો ઉક્ત હિસાબ તથા રોકડ પ્રવાહ પત્રકનો નાણાંકીય પત્રકો સાથે મેળ બેસે છે.
૯. અમારા અભિપ્રાય અને અમારી જાણકારી મુજબ ઉપર ફકરા ૩,૪,૫,૬ અને ૭ માં આપવામાં આવેલી રીમાર્ક્સ તેમજ અમને આપવામાં આવેલા ખુલાસાઓને આધીન રહીને આ હિસાબો ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ધારો, ૧૯૭૮માં માંગ્યા મુજબની માહિતી જે રીતે જરૂરી છે તે રીતે આપેલ છે અને ભારતમાં સામાન્ય રીતે સ્વીકૃત હિસાબોના સિદ્ધાંતોને અનુરૂપ સાચું અને યોગ્ય ચિત્ર રજૂ કરે છે.
- (૧) સરવૈયાની બાબતમાં કામકાજને લગતી બાબતો તા. ૩૧.૦૩.૨૦૨૦ મુજબની છે.
- (૨) આવક અને ખર્ચ ખાતાની બાબતમાં આવક ઉપર ખર્ચનો વધારો (ખાઘ) એ તારીખે પુરા થયેલા વર્ષ માટે છે.
- (૩) કેશફ્લો પત્રકની બાબતમાં તે તારીખે પુરા થયેલા વર્ષ માટે બોર્ડનો કેશફ્લો દર્શાવે છે.

બી. ઉપાધ્યાય એન્ડ કું.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ વતી
ફર્મ રજી. નં. : ૧૧૧૧૬૬ ડબલ્યુ

સહી
(એચ.બી. ઉપાધ્યાય)
ભાગીદાર
મેમ્બરશીપ નં. : ૦૩૮૧૯૮
યુડીઆઈએન નં. ૨૧૦૩૮૧૯૮એએએબી૨૫૭૩૩

સ્થળ : ગાંધીનગર
તારીખ : ૦૮.૦૨.૨૦૨૧



**વાર્ષિક હિસાબો અને
ચોડીરશ્મીનો અહેવાલ ૨૦૧૯-૨૦**

તા. ૩૧મી માર્ચ, ૨૦૨૦ના રોજનું સરવૈયું

(રૂ. લાખમાં)

વિગત	અનુસૂચિ	રકમ	તા. ૩૧-૩-૨૦ ના રોજ	તા. ૩૧-૩-૧૯ ના રોજ
ભંડોળનાં પ્રાપ્તિ સ્થાન :				
બોર્ડનું ભંડોળ				
ગુજરાત સરકારનો ફાળો		૧૨૫.૦૦		૧૨૫.૦૦
અનામત અને પુરાંત	૧	૫,૫૭૪.૬૨	૫,૬૯૯.૬૨	૫,૫૫૪.૬૨
તારણવિનાની લોન	૨		૧૪,૩૭૭.૫૮	૧૪,૩૭૭.૫૮
કામો માટે મળેલ અનામત/અનુદાન (કામ પરનો ચોખ્ખો અર્થ)	૩		૩,૧૬,૬૯૨.૭૭	૨,૮૪,૭૩૮.૬૫
સરવાળો			૩,૩૬,૭૬૯.૯૭	૩,૦૪,૭૯૫.૮૫
ભંડોળનો ઉપયોગ				
સ્થાયી અસ્કયામતો (ઘસારા બાદ)	૪		૫,૦૨૩.૫૭	૫,૦૮૦.૬૬
ચાલુ અસ્કયામતો, લોન અને પેશગીઓ				
માલસામાન	૫	૩૨,૯૯૯.૮૫		૩૦,૨૭૯.૬૨
પ્રકીર્ણ દેવાદારો	૬	૩૯,૦૭૪.૨૬		૩૯,૦૮૨.૪૦
રોકડ અને બેંક સિલક	૭	૮૪,૨૭૩.૩૧		૨,૩૧,૦૧૨.૯૮
લોન અને પેશગીઓ	૮	૧,૮૬,૫૩૪.૮૩		૨૦,૧૩૨.૫૪
અન્ય ચાલુ અસ્કયામતો	૯	૩,૩૬૪.૨૦		૧,૯૬૩.૮૭
		૩,૪૬,૨૪૬.૪૫		૩,૨૨,૪૭૧.૪૧
ચાલુ જવાબદારીઓ અને જોગવાઈઓ				
ચાલુ જવાબદારીઓ		૧,૫૨,૧૨૬.૮૮		૧,૫૯,૩૮૫.૭૪
જોગવાઈઓ		૬,૦૬૧.૦૦		૫,૮૦૫.૮૮
		૧,૫૮,૧૮૭.૮૮		૧,૬૫,૧૯૧.૬૨
ચોખ્ખી ચાલુ અસ્કયામતો			૧,૮૮,૦૫૮.૫૭	૧,૫૭,૨૭૯.૭૯
આવક ઉપર અર્થ નો વધારો			૧,૪૩,૬૮૭.૮૩	૧,૪૨,૪૩૫.૪૦
સરવાળો			૩,૩૬,૭૬૯.૯૭	૩,૦૪,૭૯૫.૮૫
હિસાબો ઉપરની નોંધો	૧૬			

એમ.પી. પુજારા
નાણા નિયંત્રક

મયુર મહેતા, IAS
સભ્ય સચિવ

ધર્મજય દ્વિવેદી, IAS
અધ્યક્ષ

સમાન તારીખના અમારા આ સાથે સામેલ રાખેલ અહેવાલ મુજબ

બી. ઉપાધ્યાય એન્ડ કું.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ

ફર્મ રજી. નં. : ૧૧૧૧૬૬ ડબલ્યુ

સહી

એચ.બી. ઉપાધ્યાય

પાર્ટનર

મેમ્બરશીપ નં. : ૦૩૮૧૯૮

સ્થળ : ગાંધીનગર

તારીખ : ૦૮.૦૨.૨૦૨૧

સ્થળ : ગાંધીનગર

તારીખ : ૦૮.૦૨.૨૦૨૧

તા. ૩૧ માર્ચ, ૨૦૨૦ના રોજ પૂરા થતા વર્ષના આવક અને ખર્ચના હિસાબો

(રૂ. લાખમાં)

વિગત	અનુસુચિ	તા. ૩૧-૩-૨૦ના રોજ પૂરા થતા વર્ષ માટે	તા. ૩૧-૩-૧૯ ના રોજ પૂરા થતા વર્ષ માટે
આવક :			
કામમાંથી આવક	૧૧	૨૭,૪૪૦.૩૮	૩૧,૭૬૬.૩૮
અનુદાન	૧૨	૭૪,૩૮૪.૩૧	૮૦,૮૦૧.૮૬
અન્ય આવક	૧૩	૪,૭૬૧.૨૫	૯,૫૭૪.૮૭
સરવાળો		૧,૦૬,૫૯૫.૯૪	૧,૨૨,૨૪૩.૧૧
ખર્ચ :			
કર્મચારીઓને પગાર ચુકવણી અને જોગવાઈઓ	૧૪	૧૯,૨૯૮.૮૧	૩૦,૩૧૬.૪૦
મોજણી અને શોધ તપાસ અંગે ખર્ચ		૧૪.૨૫	૧૯.૫૩
કાર્ય સંચાલન અને નિભાવ :			
ક) પાણી પુરવઠા ચોજનાઓ		૮૩,૬૭૯.૩૪	૧૧૫,૭૭૪.૦૪
ખ) પ્રયોગશાળા		૩.૯૯	૦.૨૨
વહીવટી અને અન્ય ખર્ચ	૧૫	૪,૭૦૮.૪૪	૫,૨૦૩.૨૮
ઘસારો		૨૨૩.૬૯	૨૩૪.૨૯
સરવાળો		૧,૦૭,૯૨૮.૫૨	૧,૫૧,૫૪૭.૭૬
અગાઉની મુદતના હિસાબમેળ અને કર			
પહેલાં નો વધારો / (ખાધ)		(૧,૩૩૨.૫૮)	(૨૯,૩૦૪.૬૫)
ઓછા :			
આગળના સમયનો હિસાબમેળ (ચોખ્ખી)		૮૦.૧૫	૭૫૮.૧૩
આવકવેરો		-	-
		૮૦.૧૫	૭૫૮.૧૩
ચાલુ વર્ષ માટેનો વધારો/ (ખાધ)		(૧,૨૫૨.૪૩)	(૨૮,૫૪૬.૫૨)
પાછલા વર્ષથી આગળ ખેંચેલો આવક ઉપર ખર્ચનો વધારો		(૧૪૨,૪૩૫.૪૦)	(૧૧૪,૮૨૦.૮૮)
જનરલ રિઝર્વની બાકી આગળ લાવ્યા		--	૯૩૨.૦૦
સરચેયામાં લઈ ગયેલા આવક ઉપર ખર્ચનો વધારો		(૧,૪૩,૬૮૭.૮૩)	(૧,૪૨,૪૩૫.૪૦)
હિસાબો ઉપરની નોંધો	૧૬		

એમ.પી. પુજરા
નાણા નિયંત્રક

મયુર મહેતા, IAS
સભ્ય સચિવ

દર્શનજય દ્વિવેદી, IAS
અધ્યક્ષ

સમાન તારીખના અમારા આ સાથે સામેલ રાખેલ અહેવાલ મુજબ

બી. ઉપાધ્યાય એન્ડ કં.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ

ફર્મ રજી . નં. : ૧૧૧૧૬૬ ડબલ્યુ

સહી

એચ.બી. ઉપાધ્યાય

પાર્ટનર

મેમ્બરશીપ નં. : ૦૩૮૧૯૮

સ્થળ : ગાંધીનગર

તારીખ : ૦૮.૦૨.૨૦૨૧

સ્થળ : ગાંધીનગર

તારીખ : ૦૮.૦૨.૨૦૨૧



**વાર્ષિક હિસાબો અને
ઓડીટરશ્રીનો અહેવાલ ૨૦૧૯-૨૦**

તા. ૩૧ મી માર્ચ, ૨૦૨૦ ના રોજ પૂરા થયેલ વર્ષ માટેનું રોકડ પ્રવાહ પત્રક

(રૂ. લાખમાં)

ક્રમ નં.	વિગત	તા. ૩૧-૩-૨૦ ના રોજ પુરા થતા વર્ષ માટે	તા. ૩૧-૩-૧૯ ના રોજ પુરા થતા વર્ષ માટે
(ક)	કાર્યસંચાલિત પ્રવૃત્તિઓમાંથી રોકડ પ્રવાહ કચ્છેરા અને આગળની મુદતનો હિસાબમેળ પહેલા આવક નો વધારો/ (ખાધ)	(૧,૩૩૨.૫૮)	(૨૯,૩૦૪.૬૫)
(૧)	ઘસારો	૨૨૩.૬૯	૨૩૪.૨૯
(૨)	ગ્રેજ્યુઈટી માટે જોગવાઈ	૨૫૫.૧૨	૫,૭૯૧.૪૯
	કાર્યકારી મુડીમાં ફેરફાર પહેલા સંચાલન નફો	(૮૫૩.૭૭)	(૨૩,૨૭૮.૮૭)
	કાર્યકારી મુડીમાં ફેરફાર :		
(૧)	માલસામાનનો (ઘટાડો)/ વધારો	(૨,૭૨૦.૨૩)	(૩,૦૪૪.૦૩)
(૨)	વેપારી લેણાંમા (ઘટાડો)/ વધારો	૮.૧૪	(૪૬.૧૪)
(૩)	લોન અને પેશગીઓ/ અન્ય ચાલુ અસ્કયામતોમાં (ઘટાડો)/ વધારો	(૧,૬૭,૭૪૬.૭૮)	૧૭,૩૨૮.૪૦
(૪)	વેપારી ચુકવણામાં (ઘટાડો)/ વધારો	(૭,૨૫૮.૮૬)	૨૬,૨૨૩.૬૮
	કામકાજમાંથી ઉપાર્જિત રોકડ પ્રવાહ	(૧૭૮,૫૭૧.૫૦)	૧૭,૧૮૩.૦૪
	સીધા કચ્છેરાનું ચૂકવણું	(૫૫.૮૪)	(૮.૬૧)
	આગળના સમયની સરભર	૮૦.૧૫	૭૫૮.૧૩
	કાર્ય સંચાલિત પ્રવૃત્તિઓમાંથી ચોખ્ખો રોકડ પ્રવાહ (ક)	(૧,૭૮,૫૪૭.૧૯)	૧૭,૯૩૨.૫૬
(ખ)	રોકાણની પ્રવૃત્તિઓમાંથી રોકડ-પ્રવાહ સ્થાયી અસ્કયામતની ખરીદી	(૧૬૬.૬૦)	(૬૨૬.૩૩)
	રોકાણની પ્રવૃત્તિઓમાંથી ચોખ્ખી રોકડ પ્રવાહ (ખ)	(૧૬૬.૬૦)	(૬૨૬.૩૩)
(ગ)	નાણાકીય પ્રવૃત્તિઓમાંથી રોકડ પ્રવાહ		
(૧)	થાપણ વાળા કામોમાંથી આવક	૧,૯૮,૭૪૯.૩૭	૨,૬૨,૪૯૫.૭૫
(૨)	કામો ઉપર ખર્ચ	(૧,૬૬,૭૯૫.૨૫)	(૧૮૨,૫૩૪.૨૫)
(૩)	મળેલું મૂડી અનુદાન	૨૦.૦૦	૧૮.૦૦
	રોકાણની પ્રવૃત્તિઓમાંથી ચોખ્ખો રોકડ પ્રવાહ (ગ)	૩૧,૯૭૪.૧૨	૭૯,૯૭૯.૫૦
	રોકડ અને રોકડ સમકક્ષમાં ચોખ્ખો (ઘટાડો)/ વધારો (ક+ખ+ગ)	(૧,૪૬,૭૩૯.૬૭)	૯૭,૨૮૫.૭૩
	વર્ષની શરૂઆતે રોકડ અને રોકડ સમકક્ષ	૨,૩૧,૦૧૨.૯૮	૧,૩૩,૭૨૭.૨૫
	વર્ષના અંતે રોકડ અને રોકડ સમકક્ષ	૮૪,૨૭૩.૩૧	૨,૩૧,૦૧૨.૯૮

નોંધ : ઉપરોક્ત રોકડ પ્રવાહ પત્રક “પરોક્ષ પદ્ધતિ” પ્રમાણે તૈયાર કરવામાં આવ્યું છે જે ઈન્ડીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા એકાઉન્ટીંગ સ્ટાન્ડર્ડ-૩, “રોકડ પ્રવાહ પત્રક”, હેઠળ બહાર પાડવામાં આવ્યું છે.

એમ.પી. પુજરા
નાણા નિયંત્રક

મચુર મહેતા, IAS
સભ્ય સચિવ

ધનંજય દ્વિવેદી, IAS
અધ્યક્ષ

સમાન તારીખના અમારા આ સાથે સામેલ રાખેલ અહેવાલ મુજબ

બી. ઉપાધ્યાય એન્ડ કું.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ

ફર્મ રજી. નં. : ૧૧૧૧૬૬ ડબલ્યુ

સહી

એચ.બી. ઉપાધ્યાય

પાર્ટનર

મેમ્બરશીપ નં. : ૦૩૮૧૯૮

સ્થળ : ગાંધીનગર

તારીખ : ૦૮.૦૨.૨૦૨૧

સ્થળ : ગાંધીનગર

તારીખ : ૦૮.૦૨.૨૦૨૧

તા. ૩૧ મી માર્ચ, ૨૦૨૦ ના રોજની સરવૈયાની અનુસૂચિઓ

અનુસૂચિ - ૧ : અનામત અને પુરાંત

(રૂા. લાખમાં)

વિગત	રકમ	તા. ૩૧.૦૩.૨૦ ના રોજ	તા. ૩૧.૦૩.૧૯ ના રોજ
(ક) મૂડી અનામત			
(૧) (તા. ૦૧-૦૪-૧૯૮૧ના રોજ બોર્ડને તત્કાલીન જાહેર આરોગ્ય ઈજનેરી વિંગ (પીએચઈડબલ્યુ) માંથી તબદીલ કરેલ અસ્કયામતોની રકમ કરતાં જવાબદારીઓનો વધારો) છેલ્લા સરવૈયા મુજબ સિલક		૧,૬૪૮.૯૭	૧૬૪૮.૯૭
(૨) ગુજરાત સરકાર પાસેથી મળેલ મૂડી-અનુદાન (ક) ઓજારો અને પ્લાન્ટ ખરીદવા માટે છેલ્લા સરવૈયા મુજબ સિલક ઉમેરો : વર્ષ દરમિયાન મળેલ (અનુદાન)	૧,૬૧૬.૩૪ ૨૦.૦૦	૧,૬૩૬.૩૪	૧,૫૯૮.૩૪ ૧૮.૦૦
(ખ) મકાનના બાંધકામ માટે છેલ્લા સરવૈયા મુજબ સિલક		૨,૨૬૨.૧૬	૨,૨૬૨.૧૬
(૩) યુનિસેફ પાસેથી દાન સ્વરૂપે મળેલ મૂડીરૂપ સાધનો - રીંગ, હેન્ડ પંપ, વાહન વગેરેનું મૂલ્ય છેલ્લા સરવૈયા મુજબ સિલક		૨૭.૧૫	૨૭.૧૫
(ખ) સામાન્ય અનામત			
છેલ્લા સરવૈયા મુજબ સિલક		૦.૦૦	૯૩૨.૦૦
બાદ : આવક ખર્ચ ખાતે લઈગયા		૦.૦૦	૯૩૨.૦૦
સરવાળો		૫,૫૭૪.૬૨	૫,૫૫૪.૬૨

અનુસૂચિ - ૨ : તારણ વગરની લોન

(રૂા. લાખમાં)

વિગત	રકમ	તા. ૩૧.૦૩.૨૦ ના રોજ	તા. ૩૧.૦૩.૧૯ ના રોજ
(ક) ભારતીય જીવન વીમા નિગમ દ્વારા સ્થાનિક સંસ્થાઓને આપેલી લોન તથા આવી લોન પરના વ્યાજની પરત ચુકવણી માટે ગુજરાત સરકાર પાસેથી મળેલ ફરતું ભંડોળ (રીવોલ્વીંગ ફંડ)		૧૪,૩૭૭.૫૮	૧૪,૩૭૭.૫૮
સરવાળો		૧૪,૩૭૭.૫૮	૧૪,૩૭૭.૫૮



વાર્ષિક હિસાબો અને
ચોડીટરશીનો અહેવાલ ૨૦૧૯-૨૦

અનુસૂચિ - ૩ : કામો માટે મળેલ અનામતો / અનુદાનો

(રૂ. લાખમાં)

વિગત	રકમ	તા. ૩૧.૦૩.૨૦ ના રોજ	તા. ૩૧.૦૩.૧૯ ના રોજ
(૧) (ક) સરકારી કામો માટે			
છેલ્લા સરવૈયા મુજબ સિલક ઉમેરો : વર્ષ દરમિયાન મળેલ		૨૨,૬૯,૫૧૫.૫૫	૨૦,૮૬,૨૭૬.૭૧
(ક) રાજ્ય સરકાર (૧૦૦% રાજ્ય ફાળો)	૧,૩૧,૮૫૧.૦૦		૨,૦૪,૯૦૯.૮૪
(ખ) રાજ્ય સરકાર (૫૦% રાજ્ય ફાળો)	૩૯,૦૩૦.૮૮		—
(ગ) ગ્રાન્ટ ફંડ પર વ્યાજ	૫,૧૪૪.૮૯		—
(ઘ) જી.ડબલ્યુ.આઈ.એલ તરફથી મળેલ	૫,૩૪૭.૯૫		૧૭,૪૩૬.૫૨
(ચ) વાસ્મો તરફથી મળેલ	૬,૭૯૬.૪૬		૫૪૯.૫૫
(છ) પંચાયત ડીપાર્ટમેન્ટ તરફથી મળેલ	૧૦૦.૦૦		—
ઓછા :-			
૧. આવક અને ખર્ચ ખાતે તબદીલ (અનુસૂચિ -૧૨ મુજબ)	૫૪,૩૭૪.૩૧		૬૩,૩૮૧.૮૬
૨. વાસ્મોને તબદીલ	૯,૦૭૧.૦૨		૧,૯૫૩.૦૧
૩. જી.ડબલ્યુ.આઈ.એલને તબદીલ	૯,૪૭૮.૫૩		—
		૧,૧૫,૩૪૭.૩૨	૧,૫૭,૫૬૧.૦૪
(ખ) કેન્દ્ર સરકાર	૩૯,૦૩૦.૮૮		૨૨,૨૨૭.૦૪
ઉમેરો :			
૧. વાસ્મો તરફથી મળ્યા	૪,૪૭૪.૦૩		૫૪૯.૫૫
૨. ગ્રાન્ટ પર વ્યાજ	૨૨૫.૬૩		—
ઓછા :			
૧. જી.ડબલ્યુ.આઈ.એલ.ને તબદીલ	૯,૪૨૯.૫૩		—
૨. ગુજરાત સરકારને પરત કરેલ અનુદાન	૬૧૨.૪૪		—
૩. વાસ્મો (વોટર અને સેનીટેશન મેનેજમેન્ટ ઓર્ગનાઈઝેશન) ને તબદીલ	૨,૧૪૩.૧૨		૨,૩૬૪.૫૭
		૩૧,૫૪૫.૪૫	૨૦,૪૧૨.૦૨
(ગ) અન્ય કામો માટે અન્ય અનામતો		૩,૬૪૬.૮૮	૫,૨૬૫.૭૮
		૨,૪૨૦,૦૫૫.૨૦	૨૨,૬૯,૫૧૫.૫૫
(૨) સ્થાનિક સંસ્થાઓ અને અન્ય કામો માટે મળેલી રકમ			
છેલ્લા સરવૈયા મુજબ સિલક ઉમેરો : વર્ષ દરમિયાન મળેલ		૫,૧૫,૬૦૪.૦૧ ૪૮,૨૦૯.૭૨	૪,૩૬,૩૪૭.૧૦ ૭૯,૨૫૬.૯૧
સરવાળો		૫,૬૩,૮૧૩.૭૩	૫,૧૫,૬૦૪.૦૧
		૨૯,૮૩,૮૬૮.૯૩	૨૭,૮૫,૧૧૯.૫૬
ઓછા : કામ ઉપર થયેલ ખર્ચ (અનુસૂચિ-૩.૧ માં જણાવ્યા મુજબ)		૨૬,૬૭,૧૭૬.૧૬	૨૫,૦૦,૩૮૦.૯૧
ચોખ્ખી સિલક		૩,૧૬,૬૯૨.૭૭	૨,૮૪,૭૩૮.૬૫

અનુસૂચિ - ૩.૧ : કામો ઉપર સેક્ટરવાર થયેલ ખર્ચનું પત્રક

(રૂ. લાખમાં)

વિગત	તા. ૩૧.૦૩.૧૯ ના રોજ	વર્ષ દરમિયાન	તા. ૩૧.૦૩.૨૦ ના રોજ
ક) રાજ્ય સરકારના અનુદાનમાંથી			
૧) બિન આદિજાતિ			
વ્યુ.જ.કા બિન-ઈડા/ ગ્રામીણ પાણી પુરવઠા યોજના	૨,૬૧,૩૭૭.૬૦	૩૬,૮૫૫.૨૬	૨,૯૮,૩૩૨.૮૬
આઈ.વી.ડબલ્યુ.એસ.એસ. નું નવીનીકરણ/ખાસ મરામત	૧,૫૧,૩૫૮.૧૭	૧૪,૬૨૦.૩૮	૧,૬૫,૯૭૮.૫૫
પાયાની વ્યુનતમ સેવાઓ	૩,૬૯૧.૭૮	૦.૦૦	૩,૬૯૧.૭૮
લોક અદાલતે સુચવેલ નિર્દિષ્ટ કામ (સરકારી)	૨૦૪.૬૧	૦.૦૦	૨૦૪.૬૧
બંધ/ જળાશયના પાણીની ખરીદી	૯૭૦.૬૭	૦.૦૦	૯૭૦.૬૭
નહેર અસ્તર	૪૫૨.૭૨	૦.૦૦	૪૫૨.૭૨
હુડકો પરિયોજના	૭૨,૧૪૮.૩૪	૭.૩૦	૭૨,૧૫૫.૬૪
ધાર્મિક સ્થળોની પા.પુ.યો.	૧,૬૯૦.૦૯	૧૧૪.૮૧	૧,૮૦૪.૯૦
સૂર્ય શક્તિ આધારિત નાની (મીની) યોજનાઓ	૧૩૪.૪૦	૪૦.૦૧	૧૭૪.૪૧
નર્મદા આધારિત મહી પાર્થપલાઈન પાણી પૂરવઠા યોજના	૬૧,૨૩૦.૭૭	૭૭૬.૮૮	૬૨,૦૦૭.૬૫
આઈ.ઈ.સી. પ્રવૃત્તિઓ અને તેને સંલગ્ન ખર્ચાઓ	૪૦૧.૩૯	(૦.૩૪)	૪૦૧.૦૫
એચ.આર.ડી.ગુ.સ. નિધિ	૩૦૫.૫૮	૦.૦૦	૩૦૫.૫૮
સંશોધન અને વિકાસ	૧,૨૧૬.૭૨	૭૩.૫૯	૧,૨૯૦.૩૧
એડવાન્સ ટેકનોલોજી (બિન આદિજાતિ)	૪૯૭.૨૪	૦.૦૦	૪૯૭.૨૪
નાબાર્ડ પરિયોજના	૨૯,૦૫૩.૦૩	(૦.૦૦)	૨૯,૦૫૩.૦૩
જી.એસ.એફ.એસ સહાયક યોજના	૧,૬૧૧.૫૯	૦.૦૦	૧,૬૧૧.૫૯
સરદાર સરોવર નહેર આધારિત પાણી પુરવઠા પરિયોજના	૧,૧૧,૮૩૦.૦૨	૨૧૬.૭૪	૧,૧૨,૦૪૬.૭૬
એ.યુ.ડબલ્યુ.એસ.પી. જી.ઓ.જી ફાળો (બિન આદિજાતિ)	૪,૧૬૦.૨૫	૦.૦૦	૪,૧૬૦.૨૫
અન્ય બિન નિર્દિષ્ટ યોજનાઓ (સ્થાનિક સંસ્થાઓ/સરકાર)	૨૫૬.૭૫	૦.૦૦	૨૫૬.૭૫
૧૦ મું નાણાં પંચની યોજના	૬,૩૦૩.૩૬	૦.૦૦	૬,૩૦૩.૩૬
૧૧ મું નાણાં પંચની યોજના	૬,૫૯૬.૦૫	૦.૦૦	૬,૫૯૬.૦૫
૧૨ મું નાણાં પંચની યોજના	૧૫૬.૫૨	૦.૦૦	૧૫૬.૫૨
વ્યુનતમ્ જરૂરિયાત કાર્યક્રમ ખાસ અંગભુત યોજના	૨૫,૩૧૫.૬૧	૧,૧૬૬.૬૯	૨૬,૪૮૨.૩૦
ફીલ્ડ લેવલનો કોમ્પ્યુટરાઈઝેશન માટેનો પ્રોજેક્ટ	૭૮૭.૬૭	(૦.૩૬)	૭૮૭.૩૧
ગરીબી નિવારણ કાર્યક્રમ (મીઠાના અગરીયા)	૪,૭૧૮.૬૯	૦.૦૦	૪,૭૧૮.૬૯
સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ	૪,૧૬૩.૬૭	૭૯૩.૬૧	૪,૯૫૭.૨૮
ડિફ્લોરીડેશન કાર્યક્રમ (રાજ્ય સરકારનો ફાળો)	૧૯,૦૨૩.૬૦	૨૪.૮૧	૧૯,૦૪૮.૪૧
સુજલામ સુફલામ યોજના	૧,૫૬,૭૩૪.૧૭	૦.૦૦	૧,૫૬,૭૩૪.૧૭
એસ. સી. સબપ્લાન (નોન ડીવીઝનેબલ એસ.એસ.સી.ડી.ડબલ્યુ.એસ)	૨,૧૮૧.૫૮	૦.૦૦	૨,૧૮૧.૫૮
સ્વર્ણિમ ગુજરાત	૩૩૨.૯૭	૦.૦૦	૩૩૨.૯૭
સાગર ખેડુ (એમ.એન.પી.)	૧૪.૧૩	૦.૦૦	૧૪.૧૩
અછત કાર્યક્રમ	૧,૦૨,૬૫૯.૫૬	૪,૯૪૦.૯૨	૧,૦૭,૬૦૦.૪૮
અન્ય કુદરતી આફતો	૨૬,૯૩૧.૭૩	૧,૧૧૯.૬૫	૨૮,૦૫૧.૩૮
બાહ્ય સહાયિત વ્યુ. જ. કા પરિયોજના	૧૦,૩૦૮.૩૧	૦.૦૦	૧૦,૩૦૮.૩૧
વિશ્વબેંક સ્વચ્છતા કાર્યક્રમ	૧૦,૬૪૩.૨૨	૦.૦૦	૧૦,૬૪૩.૨૨
ટેકનોલોજી મિશન	૧,૮૯૫.૫૬	૦.૦૦	૧,૮૯૫.૫૬



**વાર્ષિક હિસાબો અને
ઓડીટરશ્રીનો અહેવાલ ૨૦૧૯-૨૦**

અનુસૂચિ - ૩.૧ : સેક્ટરવાર કામો ઉપર ખર્ચનું પત્રક

(રૂ. લાખમાં)

વિગત	તા. ૩૧.૦૩.૧૯ ના રોજ	વર્ષ દરમિયાન	તા. ૩૧.૦૩.૨૦ ના રોજ
રાષ્ટ્રીય ગ્રામીણ પેયજળ યોજના (આદિજાતી)	૧૮,૫૭૫.૪૭	૧૫,૫૦૭.૭૧	૩૪,૦૮૩.૧૮
સેક્ટર રીફોર્મ યોજના	૩,૫૦૪.૫૧	૦.૦૦	૩,૫૦૪.૫૧
વોટર કવોલિટી મોનીટરીંગ સરવે (રાજ્ય સરકાર)	૧,૪૧૫.૮૮	૩૬૮.૦૯	૧,૭૮૩.૯૭
રણ પ્રદેશ વિકાસ કાર્યક્રમ (રાજ્ય સરકાર)	૧૪,૪૭૪.૫૮	૭૬૮.૧૧	૧૫,૨૪૨.૬૯
રણ પ્રદેશ વિકાસ કાર્યક્રમ આદિજાતી (રાજ્ય સરકાર)	૯૭.૮૫	૦.૦૦	૯૭.૮૫
રણ પ્રદેશ વિકાસ કાર્યક્રમ અનુસૂચિત જાતિ (રાજ્ય સરકાર)	૧૧૯.૩૫	૦.૦૦	૧૧૯.૩૫
સસ્ટેઈનેબીલીટી રીચાર્જિંગ (બિન આદિજાતિ)	૨૭.૮૫	૦.૦૦	૨૭.૮૫
એ.ડી.બી. પરિયોજના	૩૩,૪૬૮.૫૭	૦.૦૦	૩૩,૪૬૮.૫૭
જેમ અને જયાચે શહેરી પા.પુ. યોજના	૪૯,૧૮૮.૪૯	૧૭૭.૬૫	૪૯,૩૬૬.૧૪
રોકડ પતાવટ ઉપલક્ષ	૫,૩૦૮.૩૬	(૨૪૪.૫૦)	૫,૦૬૩.૮૬
એમ.પી.ડબલ્યુ.એ.	૮૧૪.૮૫	૧૬.૩૮	૮૩૧.૨૩
૨) આદિજાતિ			
ન્યુ. જ.કા. નોન આઈડીએ	૧૯૫,૧૩૬.૭૯	૨૦,૧૨૯.૪૦	૨૧૫,૨૬૬.૧૯
એ.યુ.ડબલ્યુ. એસ.પી.(રાજ્ય ફાળો)	૧,૭૬૬.૬૦	૦.૦૦	૧,૭૬૬.૬૦
ડિફલોરિડેશન યોજના (રાજ્ય ફાળો)	૮,૨૮૨.૫૬	૦.૦૦	૮,૨૮૨.૫૬
હેન્ડપંપ ઈન્સ્ટોલેશન	૫૬,૧૫૫.૮૩	૩,૫૫૧.૪૮	૫૯,૭૦૭.૩૧
જુ.પા.પુ. યોજનાની ખાસ મરામત	૪,૯૪૪.૮૨	૭૦૮.૦૩	૫,૬૫૨.૮૫
વ્ય.પા.પુ. યોજના ની ખાસ મરામત	૬,૩૨૩.૫૩	૧,૫૧૫.૨૧	૭,૮૩૮.૭૪
વ્યક્તિગત પાઈપલાઈન પા.પુ. યો. માટે ગ્રાં.પં.ને સહાયક અનુદાન	૭૬૨.૬૯	૦.૦૦	૭૬૨.૬૯
મીની પાઈપલાઈન (રાજ્ય ફાળો)	૧૧,૯૭૯.૫૨	૧,૬૪૧.૯૧	૧૩,૬૨૧.૪૩
ગ્રામ્ય પા. પુ. (એમ.એન.પી.) (અનુ. જાતિ વિસ્તાર સિવાય)	૩૭,૩૧૯.૮૯	૮,૮૧૩.૨૩	૪૬,૧૩૩.૧૨
ઓ.જી. એરીઆ (આઉટ ગ્રોથ એરિયા)	૨,૧૮૯.૩૭	૩.૩૫	૨,૧૯૨.૭૨
સુજલામ સુફલામ યોજના	૪,૬૩૬.૩૬	૪.૧૭	૪,૬૪૦.૫૩
એડવાન્સ ટેકનોલોજી	૬૬.૯૭	૦.૦૦	૬૬.૯૭
ટેન્કરથી પાણી પુરવઠો	૦.૯૭	૦.૦૦	૦.૯૭
સસ્ટેઈનેબીલીટી રીચાર્જિંગ (રાજ્ય ફાળો)	૫૫.૮૩	૦.૦૦	૫૫.૮૩
રૂલ લો કોસ્ટ સેનીટેશન	૩૧.૮૫	૦.૦૦	૩૧.૮૫
	૧૫,૩૮,૦૦૭.૪૫	૧,૧૩,૮૧૦.૧૭	૧૬,૫૧,૮૧૭.૬૨

ખ) ભારત સરકારના અનુદાનમાંથી

રાષ્ટ્રીય ગ્રામીણ પેયજળ યોજના (૧.૪.૨૦૦૯ થી) (અગાઉ એ.આર.ડબલ્યુ.એસ.પી તરીકે ઓળખાતી રાષ્ટ્રીય ગ્રામીણ પેયજળ યોજના)	૩,૧૩,૦૪૮.૪૪	૨૪,૩૩૦.૨૬	૩,૩૭,૩૭૮.૭૦
સસ્ટેઈનેબીલીટી રીચાર્જિંગ	૧૫,૫૭૧.૪૭	૩૧.૯૨	૧૫,૬૦૩.૩૯
મીની પાઈપલાઈન (બિન આદિજાતિ)	૭૧૯.૬૬	૦.૦૦	૭૧૯.૬૬
મીની પાઈપલાઈન (આદિજાતિ) કેન્દ્ર સરકારનો ફાળો	૮,૮૮૮.૫૬	૨૩.૩૩	૮,૯૧૧.૮૯
એચ.આર.ડી.	૩૫.૫૪	૦.૬૫	૩૬.૧૯
એન.આર.ડી.ડબલ્યુ.પી-કવરેજ (વોટર કવોલીટી પ્રોબ્લમ)	૬૮,૫૦૪.૩૮	૨૧.૧૭	૬૮,૫૨૫.૫૫

અનુસૂચિ - ૩.૧ : સેક્ટરવાર કામો ઉપર ખર્ચનું પત્રક

(રૂ. લાખમાં)

વિગત	તા. ૩૧.૦૩.૧૯ ના રોજ	વર્ષ દરમિયાન	તા. ૩૧.૦૩.૨૦ ના રોજ
રણ વિસ્તાર વિકાસ કાર્યક્રમ (ડી.ડી.પી)	૮૨,૯૨૦.૮૯	૩,૯૫૦.૯૭	૮૬,૮૭૧.૮૬
વોટર ક્વોલીટી મોનીટરીંગ એન્ડ સર્વેલન્સ	૫,૫૩૦.૦૪	૪૫૪.૮૮	૫,૯૮૪.૯૨
કોમ્પ્યુટરાઇઝેશન	૯૮૪.૮૬	૦.૦૦	૯૮૪.૮૬
પ્રયોગશાળાની સ્થાપના	૪૮.૩૦	૦.૦૦	૪૮.૩૦
એ.યુ.ડબલ્યુ એસ.પી. (જી.ઓ.આઈ. હિસ્સો)	૪,૨૩૦.૧૦	૦.૦૦	૪,૨૩૦.૧૦
પ્રધાનમંત્રી કાર્યક્રમ	૧,૯૫૦.૮૫	૦.૦૦	૧,૯૫૦.૮૫
એ.આર.પી. (૫ ટકા કેન્દ્રીય વધારાનું અનુદાન)	૨૪૮.૯૮	૦.૦૦	૨૪૮.૯૮
સુધિત ફંડ (કેમીકલ)	૧૫૭.૬૮	૦.૦૦	૧૫૭.૬૮
	૫૦૨,૮૩૯.૭૫	૨૮,૮૧૩.૧૮	૫૩૧,૬૫૨.૯૩
અન્ય પાસેથી ડિપોઝીટો			
શહેરી પાણી પુરવઠા યોજનાના ડિપોઝીટ કામો	૧,૨૮,૯૯૩.૯૧	(૨૬૮.૨૦)	૧,૨૮,૭૨૫.૭૧
પાણી પુરવઠા ડિપોઝીટ કામો	૨,૭૪૯.૧૫	૨૨૫.૨૨	૨,૯૭૪.૩૭
અમૃત યોજના ડિપોઝીટ કામો	૭,૭૪૬.૯૩	૨,૧૦૪.૫૧	૯,૮૫૧.૪૪
અમૃત ગટર યોજનાના ડિપોઝીટ કામો	૧,૭૭૬.૨૫	૩,૯૬૩.૬૯	૫,૭૩૯.૯૪
અમૃત પ્રોજેક્ટ એસ.ટી.પી. (ડિપોઝીટ કામો)	-	૧,૫૧૨.૨૬	૧,૫૧૨.૨૬
ગંદા પાણીના નિકાલ માટેનો પ્લાન્ટ	-	૨.૭૫	૨.૭૫
રૂબરૂ પાણી પુરવઠા યોજના (ડિપોઝીટ કામો)	-	૧૨૯.૪૩	૧૨૯.૪૩
શહેરી ગટર યોજના (ડિપોઝીટ કામો)	૧,૮૯,૩૦૩.૦૫	૫,૪૨૯.૨૦	૧,૯૪,૭૩૨.૨૫
જેમ અને જયાચે શહેરી પાણી પુરવઠા યોજના	૧,૦૪૩.૦૯	૦.૦૦	૧,૦૪૩.૦૯
રૂબરૂ ગટર યોજના	૨૪૬.૭૬	૭૫.૯૭	૩૨૨.૭૩
અછત કાર્યક્રમ	૨,૨૯૯.૬૪	૦.૦૦	૨,૨૯૯.૬૪
તાકીદની પાણી પુરવઠા યોજના	૩,૦૨૫.૯૬	૦.૦૦	૩,૦૨૫.૯૬
ડિપોઝીટ કામો (અર્બન સેલ)	-	૩૭૯૯.૬૬	૩૭૯૯.૬૬
આયોજન મંડળના કામો (ડ્રિસ્ટ્રીક્ટ પ્લાનિંગ-વિવેકાધિન)	૧,૦૧,૪૩૬.૮૭	૫,૯૨૪.૦૮	૧,૦૭,૩૬૦.૯૫
એ.ટી.વી.ટી. યોજના (આપણો તાલુકો વાઈબ્રન્ટ તાલુકો)	૪,૧૫૯.૨૬	૩૯૫.૦૪	૪,૫૫૪.૩૦
સોલર મીની	૯૭૩.૯૦	૨૭૧.૭૭	૧,૨૪૫.૬૭
જેમ અને જયાચે ગ્રામીણ ડ્રેનેજ કાર્યક્રમ	૧૦૧૨૯.૩૭	૬૦૬.૫૨	૧૦,૭૩૫.૮૯
આઈ.ડી.એ શહેરી ડ્રેનેજ	૫,૬૪૯.૫૭	૦.૦૦	૫,૬૪૯.૫૭
	૪,૫૯,૫૩૩.૭૧	૨૪,૧૭૧.૯૦	૪,૮૩,૭૦૫.૬૧
ચાલુ વર્ષનો કુલ સરવાળો	૨૫,૦૦,૩૮૦.૯૧	૧,૬૬,૭૯૫.૨૫	૨૬,૬૭,૧૭૬.૧૬
અગાઉના વર્ષનો કુલ સરવાળો	૨૩,૧૭,૮૪૬.૬૬	૧,૮૨.૫૩૪.૨૫	૨૫,૦૦,૩૮૦.૯૧

ಅನುಬಂಧ - ೪ : ಸ್ಥಾಯಿ ಅಸ್ತಿಯಾಚಾರ

ಅ. ನಂ.	ವಿವರ	ಘಟನೆ ಜಾರಿ ಆಗಿರುವ ಸಾಲಿನ ಸಂಖ್ಯೆ	ವರ್ಷದ ಪ್ರಾರಂಭದಿಂದ ಉಂಟಾದ ಸಮಯ	೨೦೧೬-೨೦೧೭ನೇ ಸಾಲಿನ ಸಂಖ್ಯೆ	ಉಳಿದ ವರ್ಷಗಳಿಂದ ಉಂಟಾದ ಸಮಯ	ಘಟನೆ ಜಾರಿ ಆಗಿರುವ ಸಾಲಿನ ಸಂಖ್ಯೆ	ಘಟನೆ ಜಾರಿ ಆಗಿರುವ ಸಾಲಿನ ಸಂಖ್ಯೆ
೧	ಜಮೀನು	೧,೨೬೬.೨೦	೦.೦೦	೧,೨೬೬.೨೦	೦.೦೦	೧,೨೬೬.೨೦	೧,೨೬೬.೨೦
೨	ಮಳೆನೀರಿನ ಸೌಕರ್ಯ	೨,೨೧೫.೫೦	೩.೬೦	೨,೨೧೬.೩೦	೬೨.೬೦	೨,೨೧೬.೩೦	೨,೨೧೫.೫೦
೩	ವಾಣಿಜ್ಯ ಯಂತ್ರ ಸಾಮಗ್ರಿ	೧೬೫.೦೧	೦.೦೦	೧೬೫.೦೧	೦.೦೦	೧೬೫.೦೧	೧೬೫.೦೧
೪	ಶಿಕ್ಷಣ ಮತ್ತು ಅಧ್ಯಯನ, ಪ್ರಾಂಶುಪಾಲನೆ ಮತ್ತು ಸಾಮಗ್ರಿ	೬.೧೨	೦.೦೦	೬.೧೨	೦.೦೦	೬.೧೨	೬.೧೨
೫	ಫಲಾನುಭವಿ ಮತ್ತು ಉಪಯುಕ್ತ, ಕಚೇರಿ ಮತ್ತು ಅಧ್ಯಯನ ಸಾಮಗ್ರಿ	೧೬೫.೫೦	೧೦.೫೦	೧೬೫.೫೦	೧೦.೫೦	೧೬೫.೫೦	೧೬೫.೫೦
೬	ವಾಣಿಜ್ಯ	೨೧೫.೩೬	೬೩.೨೩	೨೧೬.೦೬	೧೧.೬೩	೨೧೬.೦೬	೨೧೫.೩೬
೭	ಪ್ರಾಂಶುಪಾಲನೆ ಮತ್ತು ಸಾಮಗ್ರಿ	೦.೩೫	೦.೦೦	೦.೩೫	೦.೦೦	೦.೩೫	೦.೩೫
೮	ಕೌನ್ಸಿಲರ್ ಮತ್ತು ಸಾಮಗ್ರಿ	೫೫೦.೦೦	೨೦.೫೫	೫೫೦.೫೫	೨೦.೫೫	೫೫೦.೫೫	೫೫೦.೦೦
೯	ಪ್ರಾಂಶುಪಾಲನೆ ಮತ್ತು ಸಾಮಗ್ರಿ	೨೩.೧೬	೬೨.೬೫	೬೫.೧೬	೦.೦೦	೬೫.೧೬	೨೩.೧೬
	ಅಂಶಗಳ ಸಮಗ್ರ	೫,೦೬೦.೫೬	೧೬೬.೫೬	೫,೦೬೦.೫೬	೧೬೬.೫೬	೫,೦೬೦.೫೬	೫,೦೬೦.೫೬
	ಆಗಲಿನ ವರ್ಷದ ಸಂಖ್ಯೆ	೫,೬೬೬.೬೬	೫೬೬.೬೬	೫,೬೬೬.೬೬	೫೬೬.೬೬	೫,೬೬೬.೬೬	೫,೬೬೬.೬೬

વિગત	૩૧.૦૩.૨૦૨૦ ના રોજ	(રૂ. લાખમાં) ૩૧.૦૩.૨૦૧૯ ના રોજ
અનુસૂચિ - ૫ : માલસામાનની સિલક		
માલસામાનની સિલક (સાઈટ ઉપરના માલસામાન સાથે)	૩૨,૯૯૯.૮૫	૩૦,૨૭૯.૬૨
સરવાળો	૩૨,૯૯૯.૮૫	૩૦,૨૭૯.૬૨
અનુસૂચિ - ૬ : પ્રકીર્ણ દેવાદાર (તારણ વિનાના)		
પાણીના દર માટે પ્રકીર્ણ દેવાદાર (સારા ગણાયેલા)	૩૮,૪૮૧.૯૦	૩૮,૪૮૧.૯૦
પાણી ટેન્કરના ભાડા ખર્ચ માટે પ્રકીર્ણ દેવાદાર શંકાસ્પદ ગણેલા	૫૯૨.૩૬ ૧૫.૦૦	૬૦૭.૩૬ ૬૧૫.૫૦
ઓછા : ડૂબેલા અને શંકાસ્પદ દેવાદારોની જોગવાઈ (પાણી ટેન્કર)	૧૫.૦૦	૧૫.૦૦
સરવાળો	૩૯,૦૯૯.૨૬	૩૯,૦૯૭.૪૦
અનુસૂચિ - ૭ : રોકડ અને બેંક સિલક		
(ક) હાથ પરની રોકડ સિલક	૦.૨૪	૦.૨૪
(ખ) બેંકમાં સિલક		
(૧) બચત/ ચાલુ ખાતામાં (ફ્લેક્સી ડીપોઝીટ સાથે)	૫૩,૦૫૨.૯૯	૧૪૩,૪૭૪.૨૦
(૨) મુદતી થાપણ ખાતામાં	૭,૦૨૬.૬૧	૬૧,૫૬૨.૫૬
(૩) માર્ગસ્થ ભરણા	૨૪,૧૭૬.૯૦	૨૫,૯૧૭.૪૦
(૪) તસલમાત (હંગામી તસલમાત અને પેશગી સહિત)	૧૬.૫૭	૫૮.૫૮
સરવાળો	૮૪,૨૭૩.૩૧	૨,૩૧,૦૧૨.૯૮
અનુસૂચિ - ૮ : લોન અને પેશગીઓ		
(ક) રોકડ કે વસ્તુરૂપે વસૂલાત પાત્ર અથવા મળવાપાત્ર કિંમત સ્વરૂપે પેશગીઓ	૧,૯૪૨.૭૪	૧,૬૬૦.૮૭
(ખ) પ્રતિનિયુક્તિ પરના કર્મચારીઓને કર્ચેલ ચુકવણીઓ અંગે ગુજરાત સરકાર પાસેથી લેણી રકમ	૧૦૩.૦૮	૧૦૩.૦૮
(ગ) નગરપાલિકાઓને લોન (રાજ્ય સરકાર દ્વારા અપાયેલ ગેરંટી સામે)	૨,૯૩૮.૪૧	૨,૯૩૮.૪૧
(ઘ) જીવન વીમા નિગમ અને સરકારી લોનોની ભરપાઈ માટે સ્થાનિક સંસ્થાઓ વતી ચુકવેલ રકમનું લેણું	૧૦,૨૯૧.૨૫	૧૦,૭૨૨.૮૨
(ચ) પડતર કેસો માટે કોર્ટમાં ડિપોઝીટ	૪૮૩.૯૭	૪૪૧.૮૭
(છ) નાણાં સંસ્થાઓમાં મુદતી થાપણ	૧,૭૦,૦૯૨.૬૯	૩,૬૩૯.૧૮
(જ) વસૂલ કરવાપાત્ર મુળ સ્ત્રોત પરનો વેરો	૩૫૦.૪૯	૨૯૪.૬૫
(ઝ) અન્ય	૩૩૨.૨૦	૩૩૧.૬૬
સરવાળો	૧,૮૬,૫૩૪.૮૩	૨૦,૧૩૨.૫૪



વાર્ષિક હિસાબો અને
ચોડીટરશ્રીનો અહેવાલ ૨૦૧૯-૨૦

(રૂા. લાખમાં)

વિગત	૩૧.૦૩.૨૦ ના રોજ	૩૧.૦૩.૧૯ ના રોજ
અનુસૂચિ - ૯ : અન્ય ચાલુ અસ્કયામતો		
(ખ) ઠેક/ નાણાકીય સંસ્થાઓની મુદતી થાપણો પર મળવા પાત્ર વ્યાજ	૩,૩૬૪.૨૦	૧,૯૬૩.૮૭
સરવાળો	૩,૩૬૪.૨૦	૧,૯૬૩.૮૭

અનુસૂચિ - ૧૦ : ચાલુ જવાબદારીઓ અને જોગવાઈઓ

ક. ચાલુ જવાબદારીઓ :

(૧) થયેલ કામો માટેના લેણદારો	૯,૮૪૭.૮૨	૫,૮૭૧.૬૩
(૨) અનામત કામો માટેના લેણદારો	૬૭,૦૫૩.૦૨	૬૫,૬૬૦.૩૧
(૩) ખર્ચ માટેના લેણદારો	૭૨,૭૯૧.૬૨	૮૫,૪૮૨.૭૫
(૪) સરકારના લેણાં (પ્રતિનિયુક્તિ પરના કર્મચારીઓને કરેલ ચુકવણીઓમાંથી કપાત સહિત)	૧,૬૨૦.૫૨	૧,૭૭૦.૫૭
(૫) અન્ય	૮૧૩.૯૦	૬૦૦.૪૮
	૧,૫૨,૧૨૬.૮૮	૧,૫૯,૩૮૫.૭૪

ખ. જોગવાઈઓ :

(૧) ગ્રેજ્યુઈટી	૬,૦૬૧.૦૦	૫,૮૦૫.૮૮
	૬,૦૬૧.૦૦	૫,૮૦૫.૮૮
સરવાળો	૧,૫૮,૧૮૭.૮૮	૧,૬૫,૧૯૧.૬૨

(રૂા. લાખમાં)

વિગત	૩૧.૦૩.૨૦ અંતિત વર્ષ માટે	૩૧.૦૩.૧૯ અંતિત વર્ષ માટે
અનુસૂચિ - ૧૧ : કાર્યસંચાલિત પ્રવૃત્તિઓમાંથી આવક		
(ક) ઈ.ટી.પી. ચાર્જીસની વસુલાત	૧૭,૨૯૭.૪૯	૨૦,૪૧૫.૨૯
(ખ) પાણીનું વેચાણ	૧૦,૧૪૨.૮૯	૧૧,૩૫૧.૦૯
સરવાળો	૨૭,૪૪૦.૩૮	૩૧,૭૬૬.૩૮

અનુસૂચિ - ૧૨ : અનુદાન (ગ્રાન્ટ)

(ક) ગુજરાત સરકાર તરફથી		
(૧) વહીવટી ચાર્જ	૧૦,૦૦૦.૦૦	૭,૫૦૦.૦૦
(૨) મરામત અને નિભાવ ચાર્જ (આ રકમમાં રૂા. ૫૪,૩૭૪.૩૧ લાખ (અગાઉના વર્ષે રૂપિયા ૬૩,૩૮૧.૮૬ લાખ) કે જે કામો માટેની ગ્રાન્ટ/ અનામત માંથી તબદીલ કરેલ હતાં (રા. સ. ગ્રાન્ટ) (જુઓ અનુસૂચિ. ૩) નો સમાવેશ થાય છે.	૬૪,૩૭૪.૩૧	૭૩,૩૮૧.૮૬
(૩) મોજણી સંશોધન ચાર્જ	૨૦.૦૦	૨૦.૦૦
	૭૪,૩૯૪.૩૧	૮૦,૯૦૧.૮૬
(ખ) કેન્દ્ર સરકારની		
(૧) એનઆરડીડબલ્યુપી- મરામત અને નિભાવણી (ભારત સરકારની ગ્રાન્ટમાંથી તબદીલ) (જુઓ અનુસૂચિ નં. ૩)	૦.૦૦	૦.૦૦
સરવાળો	૭૪,૩૯૪.૩૧	૮૦,૯૦૧.૮૬



વિગત	(રૂ. લાખમાં)	
	૩૧.૦૩.૨૦ અંતિત વર્ષ માટે	૩૧.૦૩.૧૯ અંતિત વર્ષ માટે
અનુસૂચિ - ૧૩ : અન્ય આવક		
(ક) ટેન્ડર ફી	૧૯૭.૮૮	૨૧૨.૪૩
(ખ) ભાડું	૭૭.૦૩	૮૧.૨૮
(ગ) વ્યાજ	૩,૦૬૦.૬૮	૬,૮૭૫.૪૩
(ઘ) સ્ટોક સંગ્રહ ચાર્જ	૧૫૩.૬૮	૨૩૨.૭૮
(ચ) પરચુરણ આવક	૧,૨૭૧.૮૮	૨,૧૭૨.૮૫
સરવાળો	૪,૭૬૧.૨૫	૯,૫૦૪.૮૭

અનુસૂચિ - ૧૪ : કર્મચારીઓને પગારની ચુકવણી તથા જોગવાઈ		
(ક) પગાર, વેતન અને ભથ્થાં	૧૪,૦૩૭.૬૯	૧૪,૫૭૬.૭૩
(ખ) રજાપગાર, પેન્શન, ગ્રેજ્યુઈટી અને ભવિષ્ય નિધિ ફાળો	૫,૧૨૨.૬૫	૧૫,૫૮૩.૧૨
(ગ) કર્મચારી કલ્યાણ ખર્ચ	૧૩૮.૪૭	૧૪૬.૫૫
સરવાળો	૧૯,૨૯૮.૮૧	૩૦,૩૦૬.૪૦

અનુસૂચિ - ૧૫ : વહીવટી અને અન્ય ખર્ચ		
(૧) ભાડું, કર અને વેરા	૧૯૫.૮૫	૧૬૮.૧૬
(૨) મુદ્રણ અને લેખન સામગ્રી	૩૧૨.૨૫	૩૦૯.૯૭
(૩) ટપાલ ખર્ચ અને ટેલીફોન	૮૧.૩૭	૯૫.૯૪
(૪) જાહેર ખબર અને પ્રચાર	૧૮૦.૩૦	૨૩૦.૩૨
(૫) વીજળી અને પાણી ખર્ચ	૧૨૦.૭૦	૧૧૩.૭૩
(૬) પુસ્તકો અને સામયિકો	૨.૬૬	૪.૫૬
(૭) પ્રવાસ અને વાહન	૪.૧૭	૩.૧૬
(૮) વૈદ્યાનિક ઓડીટ ફી	૫.૮૨	૫.૮૨
(૯) આંતરિક ઓડીટ ફી અને ખિસ્સા ખર્ચ	૨૦.૪૩	૧૭.૯૯
(૧૦) વ્યવસાયિક ફી	૯૬૬.૧૨	૧,૦૮૯.૪૪
(૧૧) તાલીમ અને સેમિનારનો ખર્ચ	૦.૮૫	૦.૧૮
(૧૨) મનોરંજન ખર્ચ	૨૨.૧૬	૨૧.૨૭
(૧૩) કચેરીના પરચુરણ ખર્ચ	૧૬૩.૧૭	૧૪૮.૦૧
(૧૪) બેંક ચાર્જીસ	૫.૮૬	૬.૮૫
(૧૫) મકાનોની મરામત અને નિભાવ	૬૨૩.૩૭	૭૪૮.૯૯
(૧૬) વાહનોની મરામત, નિભાવ અને વીમા	૧,૬૦૬.૬૬	૧,૭૦૫.૮૭
(૧૭) સ્ટોર્સના ખર્ચ	૩૧૬.૫૩	૩૬૩.૦૫
(૧૮) સામાન્ય ખર્ચ	૮૦.૧૭	૧૬૯.૯૭
સરવાળો	૪,૭૦૮.૪૪	૫,૨૦૩.૨૮

અનુસૂચિ - ૧૬

હિસાબનો ભાગ બનતી નોંધો

૧. પ્રસ્તાવના :

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, ગુજરાત સરકારનું સાહસ છે જે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા સેવાઓના ગટર વ્યવસ્થા ધારો, ૧૯૭૮ (કાયદો) હેઠળ ગુજરાત રાજ્યમાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા સેવાઓના વિકાસ અને યોગ્ય નિયમન માટે સ્થાપવામાં આવ્યું છે.

આ કાયદાની કલમ ૪૨ (૨) માં સુચવ્યા મુજબ ગુ.પા.પુ. અને ગ.વ્ય.બોર્ડ દ્વારા નિયમોમાં સુચવ્યા મુજબની પદ્ધતિ તથા પત્રકોમાં પાકું સરવૈયું તૈયાર કરવાનું રહેશે. કામગીરીના સંચાલન માટે ગુજરાત સરકારની પૂર્વ મંજૂરીથી નિયમો બનાવવાની કાયદાની કલમ ૭૭ હેઠળ બોર્ડને સત્તા સોંપવામાં આવેલ છે. બોર્ડ દ્વારા અત્યાર સુધી કોઈ નિયમો બનાવવામાં આવ્યાં નથી. જો કે, ગુ.પા.પુ. અને ગ.વ્ય.બોર્ડ એ વેપારી હિસાબી પદ્ધતિ માટેનો નિયમસંગ્રહ તૈયાર કરાવેલ છે. આ નિયમસંગ્રહમાં નિયત કરેલી પદ્ધતિ મુજબ મુખ્યત્વે “સામાન્ય રીતે સ્વીકૃત હિસાબી સિદ્ધાંતો” ને લક્ષમાં રાખી, જે હિસાબનો ભાગ બનતી નોંધ દ્વારા અલગથી દર્શાવેલ હોય તેવી બાબતો સિવાય, લાગુ પડતા હિસાબના ધોરણોને અનુલક્ષીને નિયમ સંગ્રહમાં સુચવેલ માળખા મુજબ ગુ.પા.પુ. અને ગ.વ્ય.બોર્ડનું પાકું સરવૈયું તથા આવક અને ખર્ચ ખાતા તૈયાર કરવામાં આવેલ છે.

૨. મહત્વની હિસાબી નીતિઓ :

૨.૧ હિસાબી પ્રણાલી :

હિસાબો પ્રચલિત ખર્ચ પદ્ધતિ હેઠળ તૈયાર કરવામાં આવ્યાં છે. ગુ.પા.પુ. અને ગ.વ્ય.બોર્ડ એ સામાન્ય રીતે, અન્યથા સુચવેલ હોય તે સિવાય, હિસાબોની ઉપાર્જનની પદ્ધતિને અનુસરેલ છે.

૨.૨ અંદાજોનો ઉપયોગ :

નાણાકીય પત્રકો તૈયાર કરતી વખતે નાણાકીય પત્રકોની તારીખે અસ્કયામતો અને જવાબદારીઓની જણાવવામાં આવેલી રકમો તેમજ હિસાબી સમયગાળા દરમિયાનની આવકો અને ખર્ચની રકમો ને અસરકર્તા બાબતો માટે અંદાજો અને પુર્વધારણાઓ કરવી પડે છે, જેથી વાસ્તવિક પરિણામો અને અંદાજો વચ્ચેના તફાવતની જાણ થાય.

૨.૩ મળેલ આવક :

એ. ગુજરાત સરકાર દ્વારા જે તે સમયે બહાર પાડવામાં આવેલા જાહેરનામાં પ્રમાણે અને સંબંધિત એજન્સીઓ, જે પાણી પુરવઠા બોર્ડને ડિપોઝીટ કામો આપવા સહમત થયેલ હોય તે નિશ્ચિત યોજના ઉપર થયેલા ખર્ચના આધારે ઈટીપી (મહેકમ, મશીનરી અને ઓબરો વિગેરે) ચાર્જીસ ને આવક તરીકે ગણેલ છે.

બી. વસુલાતની અનિશ્ચિતતા હોવાથી પાણીના વેચાણની આવક અને તેને લગતી આવક તેના મળવાની અનિશ્ચિતતા ધ્યાનમાં લેતા રોકડના ધોરણે માન્ય રાખવામાં આવે છે.

સી. મોબીલાઈઝેશન એડવાન્સ ઉપરનું વસુલ કરવા પાત્ર વ્યાજ હોય તો તે ખરેખર ઉપાર્જનના આધારે માન્ય રાખવામાં આવે છે.

ડી. બેંકો/નાણાકીય સંસ્થાઓ અથવા નિગમની અન્ય થાપણો ઉપરનું વ્યાજ ઉપાર્જનના ધોરણે માન્ય કરવામાં આવેલ છે.

ઈ. (૧) ભારત સરકારમાંથી મળેલી અનુદાનની રકમો, જ્યાં સુધી તે જે તે હેતુ માટે વપરાશ થાય નહીં ત્યાં સુધી, જે હંગામી રીતે ટુંકી મુદ્દતની બેંક થાપણોમાં (બચત બેંક ખાતાની વ્યાજ સહિત) રોકેલ હોય તેમાંથી મળતું વ્યાજ આવક-જાવક ખાતામાં સમાવવામાં આવે છે અને યોજનાની માર્ગદર્શિકા પ્રમાણે મુડી અનુદાન ખાતે તબદીલ કરવામાં આવે છે. આ રકમ સરવૈયાના અનુસૂચિ- ૩ માં “કામો માટે મળેલ અનામતો/અનુદાનો” શિર્ષક હેઠળ દર્શાવવામાં આવી છે.

- (૨) ગુજરાત સરકાર અને સ્થાનિક સંસ્થાઓ તરફથી મળેલ ડિપોઝીટ વર્ક (બચત બેંક ખાતા સહિત) ના નાણાં કે જે ઉપયોગ ન થાય ત્યાં સુધી ટુંકાગાળા માટે બાંધી મુદતની થાપણોમાં રોકાણ કરેલ હોય તે પરનું વ્યાજ સરકારી માર્ગદર્શિકા મુજબ પ્રાથમિક રીતે આવક અને ખર્ચ ખાતામાં દર્શાવવામાં આવે છે. અને ત્યાર બાદ મુડી ગ્રાન્ટ ખાતે તબ્દીલ કરવામાં આવે છે. તે પાકા સરવૈયામાં અનુદાન/ ડિપોઝીટ વર્ક તરીકે અનુસૂચિ -૩માં દર્શાવવામાં આવે છે.
- (૩) અર્બન, રૂરબન, અમૃત અને અર્બન સ્યુરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની પ્રાયોજનાઓ માટે મળેલ અનામતોના નાણાંના આખરી ઉપયોગ ન થાય ત્યાં સુધી તેને ટુંકાગાળાની બેન્કની થાપણોમાં રોકવાને કારણે બોર્ડને મળતુ વ્યાજ (બચત ખાતાના વ્યાજ સહિત) સંબંધિત અનામત ખાતે જમા આપવામાં આવે છે. જે પાકા સરવૈયામાં ગ્રાન્ટ/ ડિપોઝીટ વર્ક તરીકે અનુ. (૩)માં દર્શાવવામાં આવે છે.

એફ. યુજીવીસીએલ/એમજીવીસીએલ/ડીજીવીસીએલ/પીજીવીસીએલ પાસેથી મળેલ થાપણો ઉપરનું વ્યાજ વિદ્યુત કંપની દ્વારા બોર્ડને મોકલેલા વીજ બીલોની સામે સરભર કરવામાં આવે છે. અને વીજ બીલોની રકમમાંથી વ્યાજની આવક બાદ કરી બાકી રહેતી ચોખ્ખી રકમ વિજળી બીલ તરીકે મરામત અને નિભાવણીના સદરે ખર્ચ ખાતે લેવામાં આવે છે.

જી. અન્ય તમામ આવકો ખરેખર મળેલી રકમના આધારે હિસાબોમાં લેવામાં આવેલ છે.

૨.૪ સ્થાયી અસ્કયામતો :

એ. સ્થાયી અસ્કયામતો ઘસારા બાદની કીંમતે દર્શાવવામાં આવી છે. વેચેલ/નિકાલ કરેલ સ્થાયી અસ્કયામતો માટે જ્યાં તેમની મૂળ કિંમત અથવા ઘસારા બાદની કિંમત ઉપલબ્ધ નથી ત્યાં તેમની વેચાણ કિંમતને સ્થાયી અસ્કયામતો ખાતે જમા કરેલ છે.

બી. સ્થાયી અસ્કયામતોની કિંમતમાં ખરીદ કિંમત અને તેની પ્રાપ્તિ માટે થયેલ ખર્ચ ઉપરાંત તેના બાંધકામ/ સ્થાપનને લગતા અને અન્ય આનુષંગિક ખર્ચોનો સમાવેશ થાય છે.

સી. ક્ષતિગ્રસ્ત અસ્કયામતો :

જ્યારે કોઈ અસ્કયામતની રકમ તેની ઉપજ કીંમત કરતાં વધી જાય છે ત્યારે તેને ક્ષતિગ્રસ્ત અસ્કયામત તરીકે ગણવામાં આવે છે. આવી ક્ષતિગ્રસ્ત મિલ્કતનું નુકશાન જે વર્ષમાં આવી ક્ષતિ ધ્યાનમાં આવે તે વર્ષમાં આવક અને ખર્ચ ખાતે ઉદારવામાં આવે છે. જે ક્ષતિગ્રસ્ત અસ્કયામતની ઉપજની રકમના અંદાજમાં ફેરફાર હોય તો અગાઉના હિસાબી સમયગાળામાં ધ્યાને આવેલ ક્ષતિને કારણે થયેલ નુકશાનની નોંધને ઉલટાવી દેવામાં આવે છે.

૨.૫ ઘસારો :

એ. અનુદાનપાત્ર અસ્કયામતો સહિતની સ્થાયી અસ્કયામતો ઉપર ઘસારાની જોગવાઈઓ તા. ૦૧.૦૪.૧૯૮૧ થી અમલી આવકવેરાના નિયમો હેઠળ નિયત થયેલા દરો પ્રમાણે ઘટતી જતી બાકીની પદ્ધતિએ કરવામાં આવી છે. ઘસારાના હેતુ માટે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા આ દરોને પર્યાપ્ત ગણવામાં આવેલ છે.

બી. કોઈપણ એકમ/ સંસ્થા તરફથી દાન તરીકે પ્રાપ્ત થયેલ અસ્કયામતો ઉપર ઘસારાની કોઈ જોગવાઈ કરવામાં આવી નથી.

સી. વર્ષ દરમ્યાન ઉમેરાયેલી અને વેચવામાં આવેલી અસ્કયામતો માટે આખા વર્ષ માટે ઘસારા ની જોગવાઈ કરવામાં આવી છે.

૨.૬ માલસામાન :

એ. સ્ટોરમાં અને કામના સ્થળે પડેલા માલસામાનની કીંમત પડતર કિંમતે ગણવામાં આવી છે. આ હેતુ માટે પડતર કીંમતમાં ખરીદ કીંમત, સંગ્રહખર્ચ અને લાગુ પડતા અન્ય આનુષંગિક ખર્ચનો સમાવેશ થાય છે.

બી. ચોકકસ કામો (યોજનાઓ) માટે ખરીદવામાં આવેલા માલસામાનનો ખર્ચ ખરીદી સમયે જ કામો ઉપરના ખર્ચ (યોજનાઓ) ખાતે પાડવામાં આવે છે.



૨.૭ નાણા ઉછીના લેવાનો ખર્ચ :

અસ્કયામતોની પ્રાપ્તિ અને તેના બાંધકામ માટે લીધેલ ધીરાણનો ખર્ચ આવી અસ્કયામતો તેના નિર્ધારિત ઉપયોગ માટે તૈયાર થઈ જાય તે તારીખ સુધી મૂડીકૃત કરવામાં આવે છે. નાણાં ધીરાણ લેવા માટે થયેલા અન્ય ખર્ચાઓ મહેસુલી ખર્ચ ગણવામાં આવે છે.

૨.૮ કામો ઉપર કરેલ ખર્ચ :

ચોક્કસ યોજનાઓ/પ્રાયોજનાઓ માટે કરવામાં આવેલ ખર્ચ (લાગુ પડતા ઈટીપી ચાર્જ સહિત) જે તે યોજનાઓ / પ્રયોજનાઓ ખાતે ઉઠાવવામાં આવે છે.

૨.૯ કર્મચારીઓને લાભ :

- એ. ભવિષ્ય નિધિ અને પેન્શન ફંડ માટેનો ફાળો આવક અને ખર્ચ ખાતે ઉઠાવવામાં આવે છે.
- બી. સંબંધિત કર્મચારીઓને નિવૃત્તિ સમયે ચુકવવાપાત્ર રજાના રોકડમાં રૂપાંતરના લાભના ચૂકવણી જોગવાઈ નાણાંકિય વર્ષના અંત સુધી સંચિત રજાની સિલક પ્રમાણે વર્તમાન પગાર, મોંઘવારી ભથ્થા અને સીએલએ સહિત ના દરે કરવામાં આવેલ છે.
- સી. ગુ.પા.પુ. અને ગ.વ્ય.બોર્ડ એ એમ્પ્લોયીઝ ગ્રુપ ગ્રેજ્યુઈટી ટ્રસ્ટની રચના કરી છે જેણે ભારતીય જીવન વીમા નિગમ પાસેથી “ગ્રુપ ગ્રેજ્યુઈટી જીવન વીમા પોલીસી” લીધી છે. જીવન વીમા નિગમે આપેલા મુલ્યાંકન પ્રમાણપત્રના આધારે ગ્રેજ્યુઈટીની બાકી જવાબદારીઓ માટે જોગવાઈઓ કરવામાં આવી છે.

૨.૧૦ આવક ઉપરનો વેરો :

- એ. પ્રવર્તમાન આવકવેરા ઘારા, ૧૯૬૧ મુજબ આવક વેરાની ચુકવવા પાત્ર રકમ ગણવામાં આવી છે.
- બી. બુક પ્રોફીટ અને કરવેરાપાત્ર પ્રોફીટ વચ્ચેના “સમયના તફાવત” ના કારણે ચુકવવાનો બાકી કરવેરો સરવૈયાની તારીખે પ્રચલિત દરો અને ઘડવામાં આવેલા કાયદાઓ અથવા કાયમી કાયદાઓને ધ્યાને લઈને ગણવામાં આવ્યા છે. બાકી કરવેરાની મિલકતો ભવિષ્યમાં મિલકતની વ્યાજબી ચોક્કસ મળશે તેની ખાતરી થાય ત્યાં સુધી દર્શાવવામાં આવે છે અને આગળ ખેંચવામાં આવે છે.

૨.૧૧ જોગવાઈઓ, સંભવિત જવાબદારીઓ અને સંભવિત અસ્કયામતો :

- એ. પૂર્ણ થયેલ કામોના સક્ષમ અધિકારીએ આપેલ પ્રમાણપત્રોના આધારે હિસાબી વર્ષના અંત સુધી પ્રાપ્ત થયેલ માલસામાન / મેળવેલી સેવાઓને લગતા ખર્ચ માટે જોગવાઈ કરવામાં આવી છે.
- બી. ભૂતકાળની ઘટનાઓના પરિણામ સ્વરૂપ ઉપસ્થિત થતી જવાબદારી જે ભવિષ્યમાં આવકના સ્ત્રોતનું કારણ બનશે તે ધારણાએ આવી જવાબદારીઓની જોગવાઈઓ કરવામાં આવી છે. આકસ્મિક જવાબદારીઓ નિશ્ચિત કરાઈ નથી પણ નોંધમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પણ આકસ્મિક અસ્કયામતો ન તો નિર્ધારિત થયેલી છે ન તો નાણાકીય પત્રકોમાં તેમનો ઉલ્લેખ થયેલો છે.

૨.૧૨ સ્થાનિક સંસ્થાઓ તરફથી અનુદાનો અને ફાળા :

- એ. ગુજરાત સરકાર તરફથી આયોજન અને આયોજન બહારના સદરો હેઠળ મળતી યોજનાઓની (પાણી અને વિજળી ચાર્જીસ સહીત) નિભાવ માટેના અને વહીવટી ખર્ચ માટેના અનુદાનની રકમો મહેસુલી ખર્ચ માટે અનુદાન તરીકે ગણવામાં આવે છે. અને ઉપાર્જનના ધોરણે હિસાબમાં લેવામાં આવે છે અને તે “આવક અને ખર્ચ” ખાતે જમા કરવામાં આવે છે.
- બી. જુદી જુદી યોજનાઓ માટેના મૂડી અનુદાનો સરકારી ઠરાવોના આધારે ઉપાર્જનના ધોરણે હિસાબોમાં લેવામાં આવે છે.
- સી. જુદી જુદી યોજનાઓ માટે સ્થાનિક સંસ્થાઓ પાસેથી મળતા ફાળાની રકમ વાસ્તવમાં મળેલ રકમના ધોરણે હિસાબોમાં લેવામાં આવે છે.

૨.૧૩ અગાઉના સમયની આવક/ ખર્ચ :

અગાઉના સમયને લગતી આવક અને ખર્ચની નિર્ધારિત કરી શકાય તેવી આઈટમોની ચોખ્ખી રકમ (નેટ) અગાઉના સમયની આવક/ખર્ચ ખાતે હિસાબમાં નોંધવામાં આવે છે.

૨.૧૪ સામાન્ય :

સ્પષ્ટ રીતે જેનો ઉલ્લેખ કરેલ નથી તેવી હિસાબી નીતિઓ સર્વસ્વીકૃત હિસાબી પદ્ધતિ સાથે સુસંગત છે.

૩. હિસાબો ઉપરની નોંધો :

૩.૧ ગુ.પા.પુ. અને ગ.વ્ય.બોર્ડનું કુલ નાણાકીય મુલ્ય નોંધ પાત્ર રીતે ઘટી ગયું છે તેમ છતાં રાજ્ય સરકારની અંદાજપત્રીય સહાયને ધ્યાનમાં લઈને હિસાબો “ચાલુ ઉપક્રમ” ના આધારે તૈયાર કરવામાં આવ્યાં છે.

૩.૨ આકસ્મિક જવાબદારીઓ :

વિગત	૨૦૧૯-૨૦	૨૦૧૮-૧૯
૧) બાંધકામના મુડી કરારોની અંદાજીત જવાબદારી	નક્કી નથી	નક્કી નથી
૨) વળતરના ચુકવણા પેટે અંદાજીત રકમ		
ક. કર્મચારીઓ માટે	નક્કી નથી	નક્કી નથી
ખ. કર્મચારીઓ સિવાય અન્ય માટે	રૂ. ૪૧,૦૨૮.૧૩ લાખ	રૂ. ૨૧,૭૩૭.૦૨ લાખ

ઈન્કમટેક્સના સંદર્ભમાં આકસ્મિક જવાબદારીઓ

(રૂ. લાખમાં)

આકારણી વર્ષ	કલમ ૧૪૩ (૩) અન્વયે આકારેલ ચુકવવા પાત્ર ટેક્સ	ચુકવેલ ટેક્સ	નોંધ
૨૦૧૦-૧૧	રૂ. ૧૭૦૫.૨૧	—	કમિશ્નર ઓફ ઈન્કમટેક્સ (એ) દ્વારા તમામ વધારા તથા તેના અધારે ઉભી થતી માંગણી શુન્ય કરેલ છે. આઈટીએટી (ઈન્કમટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલ) અમદાવાદ દ્વારા કમિશ્નર ઓફ ઈન્કમટેક્સ (એ) નો હુકમ બહાલ રાખેલ છે તેથી ઈન્કમટેક્સના પોર્ટલ મુજબ માંગણું શુન્ય છે. જે કે આવકવેરા વિભાગે ઈન્કમટેક્સ ટ્રીબ્યુનલ (આઈટીએટી) અમદાવાદના હુકમ સામે નામ. વડી અદાલતમાં અપીલ કરેલ છે.
૨૦૧૨-૧૩	રૂ. ૧.૨૬	—	કલમ ૧૪૩ (ક) હેઠળના હુકમથી રૂ.૧.૨૬ લાખની માંગણા નોટીસ મળેલ છે. આવક વેરા અધિનિયમ ૧૯૬૧ની કલમ ૧૫૪ હેઠળ બોર્ડ દ્વારા સુધારણા અરજી નાચળ કમિશ્નર ઈન્કમટેક્સ, ગાંધીનગર સમક્ષ દાખલ કરેલ છે. જે આખરી નિકાલ બાકી છે.
૨૦૧૩-૧૪	રૂ. ૯૭૬.૫૬	—	કમિશ્નર ઓફ ઈન્કમટેક્સ (એ) દ્વારા તમામ વધારા તથા તેના અધારે ઉભી થતી માંગણી શુન્ય કરેલ છે. આઈટીએટી (ઈન્કમટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલ) અમદાવાદ દ્વારા કમિશ્નર ઓફ ઈન્કમટેક્સ (એ) નો હુકમ બહાલ રાખેલ છે તેથી ઈન્કમટેક્સના પોર્ટલ મુજબ માંગણું શુન્ય છે. જે કે આવકવેરા વિભાગે ઈન્કમટેક્સ ટ્રીબ્યુનલ (આઈટીએટી) અમદાવાદના હુકમ સામે નામ. વડી અદાલતમાં અપીલ કરેલ છે.
૨૦૧૯-૨૦	રૂ. ૩.૬૭	—	કર કપાતમાં ક્ષતિઓ વગેરે



૩.૩ હિસાબી નીતિમાં બદલાવ

- (એ) અર્બન, રૂરબન, અમૃત અને અર્બનસ્યુરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી) ની પ્રાયોજનાઓ માટે મળેલ અનામતોના નાણાંના આપરી ઉપયોગ ન થાય ત્યાં સુધી તેને ટુંકાગાળાની બેન્કની થાપણોમાં રોકવાને કારણે બોર્ડને મળતુ વ્યાજ (બચત ખાતાના વ્યાજ સહિત) નાણાંકીય પત્રકોમાં આવક અર્ચ ખાતે જમા કરવામાં આવે છે. બોર્ડ દ્વારા વર્ષ દરમ્યાન હિસાબીનીતિ બદલી છે અને તે અનુસાર અર્બન, રૂરબન, અમૃત અને અર્બન સ્યુરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી) ની પ્રાયોજનાઓ માટે મળેલ અનામતોના નાણાંનો આપરી ઉપયોગ ન થાય ત્યાં સુધી તેને ટુંકાગાળાની બેન્કની થાપણોમાં રોકવાને કારણે બોર્ડને મળતુ વ્યાજ (બચત ખાતાના વ્યાજ સહિત) રૂ.૧૧૧૩.૯૧ લાખ સંબંધિત અનામત ખાતે જમા લેવામાં આવેલ છે.
- (બી) મશીનરી પરનો ઘસારો જે ગુજરાત સરકાર પાસેથી મળેલ ગ્રાન્ટમાંથી ખરીદેલ છે તે વર્ષ ૨૦૧૯-૨૦થી આવક અને અર્ચ ખાતે ઉધારેલ છે. (રકમ નક્કી થઈ શકતી નથી)
- (સી) ગુ.પા.પુ. અને ગ.વ્ય. બોર્ડને અગાઉના વર્ષોમાં મકાનના બાંધકામ માટે રૂ. ૨,૨૬૨.૧૬ લાખ (અગાઉના વર્ષે રૂ. ૨,૨૬૨.૧૬ લાખ) મળેલ હતા. આ અનુદાનમાંથી બાંધેલ મકાનો ઉપરનો ઘસારો આવક અર્ચ ખાતે ઉધારેલ છે (રકમ નક્કી કરી શકાય નથી).

- ૩.૪ (એ) “કેશ સેટલમેન્ટ સસ્ટેન્સ એકાઉન્ટ” હેઠળની ‘સેક્ટરવાર અર્ચ’ (અનુસૂચિ-૩.૧) ના પત્રકમાં સામેલ કરવામાં આવેલ રકમ રૂ. ૫,૦૬૩.૮૬ લાખ (અગાઉના વર્ષની રૂ. ૫,૩૦૮.૩૬ લાખ) જુદી જુદી યોજનાઓ પાછળ સેવાઓ આપવા/ એક ડીવીઝન દ્વારા બીજા ડીવીઝનને માલસામાન પુરો પાડવા માટે કરવામાં આવેલા અર્ચને દર્શાવે છે જેના માટે ડીવીઝનોએ તેમના હિસાબોમાં જરૂરી નોંધ કરી નથી. આ રકમ ગુ.પા.પુ. અને ગ.વ્ય.બોર્ડના આંતર-વિભાગીય હિસાબોના મેળવણા પછી સમાયોજીત કરવાની રહેશે. ઉપર જણાવેલી વિગતે બોર્ડ ના આંતર-વિભાગીય હિસાબોના મેળવણા દ્વારા યોજનાઓની સ્પષ્ટઓળખ થવાની બાકી હોવાના કારણે ઈટીપી ચાર્જની રકમ અર્ચ તરીકે હિસાબી ચોપડાઓમાં લેવામાં આવી નથી.
- (બી) સેક્ટરવાર અર્ચ (અનુ. ૩.૧) ના પત્રકમાં દર્શાવેલ રકમ રૂ.૮૩૧.૨૩ લાખ (ગત વર્ષના રૂ.૮૩૧.૨૩ લાખ) એમપીડબલ્યુ એડવાન્સની છે. જે હિસાબમેળ તથા સમાયોજનની શરતે દર્શાવેલ છે.
- (સી) કામ માટેની ગ્રાન્ટ/ડિપોઝીટ (અનુ. ૩)માં અગાઉના વર્ષોમાં ગુજરાત સરકારે આપેલી રૂ.૫૯૪૪.૬૦ લાખની લોન તથા રૂ.૪૧૨૧.૧૩ લાખની અછતની લોનનો સમાવેશ થાય છે.

- ૩.૫ ગુ.પા.પુ. અને ગ.વ્ય.બોર્ડ ની વિવિધ કચેરીના ઓડિટ વખતે તા.૩૧.૩.૨૦૨૦ સુધી ઉભા કરવામાં આવેલા ૯૧૬ ફકરાઓ (ટીપ્પણીઓ) (ગતવર્ષે ૯૧૬ ફકરાઓ હતા) ની પુર્તતા પરત્વે સીએન્ડએજી ઓફિસ તરફ થી પુર્તતાની સ્વીકૃતિના અને/અથવા આપરી અહેવાલ મેળવવાના બાકી હોવાથી તે ફકરાઓ બાબતે એમના માટે હિસાબી નોંધોનો સ્વીકાર થયેથી હિસાબી ચોપડાઓમાં હિસાબી નોંધો કરવામાં આવશે.

- ૩.૬ ૧.૧૦.૮૮ અથવા ત્યાર બાદ કામે રાખેલા ૭૧૪ રોજમદાર કર્મચારીઓના કિસ્સામાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા પગાર પંચની ભલામણો પ્રમાણે પગાર સુધારણાને રાજ્ય સરકારના નાણાં વિભાગની મંજૂરી ન મળવાને કારણે આ કર્મચારીઓના પગાર તફાવતના ચૂકવણા માટે તા.૧.૧.૨૦૦૬ થી તા.૩૧.૩.૨૦૨૦ સુધીના સમયગાળા માટે કોઈ જોગવાઈ કરેલ નથી.

- ૩.૭ વર્ષ ૨૦૧૯-૨૦માં (નીચેની બાબતે) કોઈ જોગવાઈ કરવામાં આવેલ નથી.

- (એ) સરકારી ઠરાવની શરતો અને બોલીઓમાં સુચવવામાં આવેલ ન હોઈ ગુજરાત સરકાર તરફથી મળેલ લોન પરના વ્યાજની રકમ.
- (બી) આવક વેરા/ જીએસટી સત્તાધિકારીને ઓછી ચુકવણી/ મુળ સ્થાનેથી કપાત કરેલ આવક વેરાની વિલંબીત ચુકવણી, આવક વેરા/ જીએસટીના નિયત પત્રકો સમયસર ન ભરવાના કારણે આવક વેરા/ જીએસટી સત્તા અધિકારીને ચુકવવા પાત્ર દંડ/ વ્યાજ અને વિજળી બીલોના વિલંબીત ચૂકવણા બદલ દંડની જોગવાઈ - કારણ કે આ ચુકવણા માંગણી ઉભી થયેથી કરવાના છે.

- (સી) ગુજરાત સરકારની મંજૂરી બાકી હોઈ કર્મચારીઓને ચુકવવા પાત્ર ૭ મા પગાર પંચના પગાર તફાવતની રકમ.
- (ડી) વાસ્મો તથા જીડબલ્યુઆઈએલમાં પ્રતિનિયુક્ત કર્મચારીઓના રજાના રોકડમાં રૂપાંતરની જવાબદારી.
- ૩.૮** નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦માં ગુ.પા.પુ. અને ગ. વ્ય. બોર્ડને પાણીના ચાર્જની રોકડના ધોરણે મળેલી આવક રૂ. ૧૦૧૪૨.૮૯ લાખ (જે આગળના વર્ષે રૂ. ૧૧૩૫૧.૦૯ લાખ હતી). પાણી ચાર્જની સને ૨૦૧૯-૨૦માં મળવાપાત્ર આવક રૂ. ૨૦૫૬૨.૦૬ લાખ (ગત વર્ષે આ રકમ રૂ. ૧૦૬૩૦.૧૧ લાખ) મળેલ ન હતી. તે મળવાની અચોક્કસતાને કારણે આવક અને ખર્ચ ખાતે દર્શાવેલ નથી.
- ૩.૯** રૂ. ૧૪,૩૭૭.૫૮ લાખ (ગત વર્ષના રૂ. ૧૪,૩૭૭.૫૮ લાખ) સ્થાનિક સંસ્થાઓને, જીવન વીમા નિગમ દ્વારા મંજૂર કરવામાં આવેલી લોનની રકમ તથા તેના વ્યાજની પરત ચુકવણી માટે ગુ.પા.પુ. અને ગ.વ્ય.બોર્ડને ગુજરાત સરકાર તરફથી “ફરતું ભંડોળ” (રિવોલ્વીંગ ફંડ) તરીકે મળેલ લોન નાણાંકીય પત્રકોમાં “અનુસૂચિ-૨” નીચે “તારણ વગરની લોન” તરીકે દર્શાવેલ છે. ગુ.પા.પુ. અને ગ.વ્ય.બોર્ડ દ્વારા આ લોનની પરત ચુકવણીની બાંહેધરી આપવામાં આવેલ છે.
- ૩.૧૦** એ. ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ. એ વર્ષ ૨૦૧૯-૨૦ સુધી તેમજ અગાઉના વર્ષોમાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડને પૂરા પાડેલ પાણી માટે રૂ. ૫૭,૨૪૧.૧૭ લાખ (ગત વર્ષના રૂ. ૬૬,૨૧૬.૮૦ લાખ) નું બીલ આકારેલ છે. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના અભિપ્રાય મુજબ બીલની રકમ મેળવણા અને સમર્થનની શરતે ચૂકવવા પાત્ર છે. તેમ છતાં ગુ.પા.પુ. અને ગ.વ્ય.બોર્ડ દ્વારા પાણી ચાર્જની તમામ બાકી માંગણી માટે નાણાકીય પત્રકોમાં જોગવાઈ કરેલ છે.
- બી. ગુજરાત સરકારના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા ગુ.પા.પુ. અને ગ.વ્ય. બોર્ડને તા.૩૧.૦૩.૨૦૨૦ સુધી પાણી પુરવઠો પુરો પાડવા બદલ પાણી ચાર્જસના રૂ. ૬૬,૮૦૯.૯૧ લાખ (રૂ. ૨૦,૪૫૭.૦૨ લાખની પેનલ્ટી અને રૂ. ૩૬,૫૯૮.૮૫ લાખના વ્યાજ સહિત) (ગત વર્ષના રૂ. ૬૬,૩૧૮.૩૨ લાખ (રૂ. ૧૯,૬૪૨.૬૭ લાખ પેનલ્ટી અને રૂ. ૩૬,૪૧૬.૭૭ લાખ વ્યાજ સહિત)) આકારવામાં આવેલ છે. જે કે ન.જ.સં.પા.પુ. અને કલ્પસર વિભાગ દ્વારા આકારવામાં આવેલ બિલોમાં (વિલંબીત ચૂકવણી ઉપરની પેનલ્ટી અને વિલંબીત ચુકવણી પરના વ્યાજની રકમ માટે) વિવાદ છે. વિવાદનું આખરીકરણ બાકી હોઈ, પાણી પુરવઠા બોર્ડ દ્વારા ચુકવવા પાત્ર રકમ નક્કી થઈ શકે તેમ ન હોઈ તેની જોગવાઈ કરવામાં આવેલ નથી.
- ૩.૧૧** રાજ્ય સરકારના આદેશ મુજબ નીચે જણાવેલ બલ્ક વોટર ટ્રાન્સમીશન પાઈપલાઈન પ્રોજેક્ટ માટે મળેલી ગ્રાન્ટ માથી ગુ.પા.પુ. અને ગ.વ્ય.બોર્ડ દ્વારા ઉભી કરવામાં આવેલી અસ્ક્યામતો ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ. (જી.ડબલ્યુ.આઈ.એલ) ને તબદીલ કરવાની હતી.

(રૂ. કરોડમાં)

ક્રમાંક	યોજના	રકમ રૂ.	ક્રમાંક	યોજના	રકમ રૂ.
૧.	એન.સી.- ૬ (માલિયા થી મોરબી)	૧૦૦.૮૬	૫.	એસપીપી-૧ (પરીએજ થી પીપલી)	૮૯.૦૪
૨.	એન.સી.- ૭ (મોરબી થી ટંકારા)	૧૨૦.૨૯	૬.	એસપીપી-૨ (પીપલી થી નાવડા)	૮૯.૦૪
૩.	એન.સી.- ૯ (માળીયા થી ભચાઉ)	૧૫૫.૬૫	૭.	એસપીપી-૩ (નાવડા - બોટાદ- ગઢડા)	૫૭.૦૦
૪.	એન.સી.- ૧૨ (ટંકારા થી રતન)	૧૦૪.૪૭	૮.	એસપીપી-૪ (નાવડા - વલ્લભીપુર)	૫૨.૦૦
				કુલ	૭૬૮.૩૫

જો કે તા. ૩૧-૩-૨૦૨૦ ની સ્થિતિએ અવેજની રકમ નક્કી ન થવાથી તથા બીજી વિધિઓ પૂરી ન થવાથી હિસાબી હવાલાઓની અસર અનિર્ણિત છે, તેથી નાણાંકીય પત્રકોમાં તેની અસર દર્શાવવામાં આવી નથી. જરૂરી વિધિઓ પૂર્ણ થયેથી તેમજ અવેજની રકમ નક્કી થયેથી જરૂરી હિસાબી હવાલાઓની નોંધ કરવામાં આવશે.

- ૩.૧૨** એ. સરવૈયામાં માલસામાનની કિંમત પડતર કિંમતે દર્શાવવામાં આવી છે. આવી રીતે મેળવવામાં આવેલી કિંમત અને નાણાકીય રેકર્ડ પ્રમાણેની કિંમતનો તફાવત રૂ. ૮૭૮.૩૬ લાખ જમા (ગત વર્ષની રૂ. ૮૭૮.૩૬ લાખ જમા) મેળવણું બાકી હોઈ નાણાકીય પત્રકોમાં સરભર કરવામાં આવેલ નથી અને તે “માલ-સામાન” માં સ્ટોર હવાલા ખાતે દર્શાવેલ છે. (અનુસૂચિ-૫)
- બી. “કોવીડ” રોગચાળાની પરિસ્થિતિમાં આંતરિક ઓડિટર્સ (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની પેઠી) દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦ અંતિત સ્ટોકની અંશતઃ ચકાસણી હાથ ધરેલ છે અને હાથ ધરેલ ભૌતિક ચકાસણી પ્રમાણે માલસામાન (ઈન્વેન્ટરી)ની કિંમત રૂ. ૨૭,૧૯૮.૯૯ લાખ (ગત વર્ષે તે રૂ. ૨૪,૦૧૦.૦૪ લાખ હતી) છે અને નાણાકીય દફતર પ્રમાણે માલ-સામાનની કિંમત રૂ. ૩૩,૮૭૮.૨૧ લાખ (ગત વર્ષે રૂ. ૩૧,૧૫૭.૯૮ લાખ હતી) છે. (ઉપરની નોંધ નં. ૩.૧૨(એ)માં દર્શાવેલ રૂ. ૮૭૮.૩૬ લાખ સિવાયના) ભૌતિક ચકાસણી અને હિસાબી ચોપડા પ્રમાણેના રૂ.૬,૬૭૯.૨૨ લાખ (ગત વર્ષે રૂ.૭૧૪૭.૯૪લાખ ઉધાર) નો તફાવત આવે છે. નાણાકીય પત્રક મુજબ તેમનું મેળવણું બાકી હોઈ હિસાબી સમાયોજન બાકી છે.
- સી. ચાંપ્રિક સ્ટોર વિભાગ, ગાંધીનગર ગુ.પા.પુ. અને ગ.વ્ય.બોર્ડ ની વિવિધ વિભાગીય કચેરીઓને જરૂરી સ્ટોર/માલસામાન પૂરો પાડે છે અને માલ સામાન મેળવતી વિભાગીય કચેરીઓ તેમના હિસાબોમાં જરૂરી હિસાબી નોંધ કરે છે. તા.૩૧.૦૩.૨૦૨૦ની સ્થિતિએ ચાંપ્રિક સ્ટોર વિભાગ દ્વારા મોકલેલ રૂ. ૩૧.૩૦ લાખના (ગત વર્ષે રૂ. ૩૧.૩૦ લાખ) ના માલ સામાનની મેળવણી તથા સ્વિકૃતિ બાકી હોઈ તેની સંબંધિત હિસાબી દફતરે અસરો આપવામાં આવી નથી.
- ડી. માલસામાનમાં અમુક રીપેર ન થઈ શકે તેવી બિન ઉપયોગી, નકામી બની ગયેલી અને ભંગાર વસ્તુઓ છે જેનો નિકાલ કરવાનો બાકી છે તેનો સમાવેશ થાય છે. આવી વસ્તુઓની બાબતમાં કોઈ જોગવાઈ કરવામાં આવી નથી.
- ઈ. સ્ટોર વિભાગ દ્વારા અન્ય વિભાગોને પૂરા પાડવામાં આવેલ માલ સામાન પર અગાઉથી નક્કી કરેલ દરે સ્ટોક સ્ટોરેજ ચાર્જ રૂ. ૧૫૩.૬૭ લાખ (ગત વર્ષમાં રૂ. ૨૩૨.૭૭ લાખ) આકારેલ છે. જે આવક અને ખર્ચના પત્રકમાં હેન્ડલીંગ ચાર્જ તરીકે જમા કરવામાં આવેલ છે.
- એફ. પૂર્ણ થયેલી યોજનાના કામના સ્થળ ઉપર પડેલો સામાન (એમએએસ) વિવિધ યોજનાઓ પૂરી થયા બાદ બીજી ચાલુ યોજનાના સ્થળોએ તબદીલ કરવામાં આવે છે. જે કે હિસાબી ચોપડાઓમાં આવા તબદીલ કરવામાં આવેલા સામાનની કોઈ નોંધ કરવામાં આવતી નથી. જેના પરિણામે પૂર્ણ થયેલી યોજનાઓનો ખર્ચ એટલા પ્રમાણમાં વધુ દર્શાવાય છે અને જે યોજનાઓને માલસામાન તબદીલ કરવામાં આવે છે. તે (યોજનાઓનો) નો ખર્ચ ઓછો દર્શાવાય છે. આ રકમ નક્કી થઈ શકી નથી.
- ૩.૧૩** વર્ષ ૨૦૧૮-૧૯ સુધી હિસાબમાં નહીં આવરી લેવાયેલી ગ્રેજ્યુઈટની જવાબદારી જીવનવીમા નિગમે આપેલા મૂલ્યાંકન પ્રમાણપત્રના આધારે (૩૧ જુલાઈની સ્થિતિએ) ગણવામાં આવેલ હતી. પરંતુ વર્ષ ૨૦૧૯-૨૦થી જીવન વીમા નિગમે પ્રથમવાર ગ્રેજ્યુઈટની જવાબદારી તા.૩૧.૩.૨૦૨૦ની સ્થિતિએ એક્યુરીયલ વેલ્યુએશન, એ.એસ.-૧૫ની શરત પરિપૂર્ણ કરતું, આપેલ તદ્દઅનુસાર ૨૦૧૯-૨૦ થી ૬,૦૬૧.૦૦ લાખની ગ્રેજ્યુઈટની જવાબદારીની જોગવાઈ નાણાકીય પત્રકોમાં એક્યુરીયલ વેલ્યુએશન ઓફ ગ્રેજ્યુઈટની જવાબદારીને આધારે કરવામાં આવેલ છે.
- ૩.૧૪** પરચુરણ દેવાદારોની દર્શાવેલ રકમ રૂ. ૩૯,૦૭૪.૨૬ લાખ (ગત વર્ષના રૂ. ૩૯,૦૮૨.૨૬ લાખ) (આ રકમ હિસાબમેળ આદીન છે.)માં તા. ૩૧.૦૩.૨૦ સુધીના સરકારી સ્થાનિક સંસ્થાઓ તથા સરકારી વિભાગો પાસેથી બાકી લેણા પાણી ચાર્જ, પાણીના ટૅક્સનું ભાડું તથા આકારેલ પરચુરણ ભાડા/ ચાર્જ પેટેની વસુલાતો છે અને તે મેળવણાને આદીન છે. નિયત તારીખે આ વસુલાતો આવતી નથી. તેમ છતાં

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ને સ્થાનિક સંસ્થાઓ અને સરકારી ખાતાઓ પાસેથી લેણી રકમ વસૂલાત થઈ આવવાની આશા છે તેથી તેવી રકમ સામે ઘાલખાઘ કે શંકાસ્પદ લ્હેણાની કોઈ ખોગવાઈ (અગાઉના વર્ષોના પાણીના ટેન્કરના રૂ. ૧૫.૦૦ લાખના દેવાદારો સિવાય) નાણાંકીય પત્રકોમાં કરવામાં આવી નથી.

- ૩.૧૫** એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ હેઠળ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા એપ્રેન્ટીસ રોકવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય એપ્રેન્ટીસ પ્રમોશન યોજના અને રાજ્ય સરકારની મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના હેઠળ આ ખર્ચની ભરપાઈ (રીએમ્બર્સમેન્ટ) મળવાપાત્ર છે. બોર્ડ દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સમક્ષ અનુક્રમે રૂ.૪૧.૩૫ લાખ તથા રૂ. ૨૦૪.૮૭ લાખની તા.૩૧.૦૩.૨૦૨૦ સુધી ખર્ચ ભરપાઈ માટેની માંગણી રજૂ કરેલ છે. જો કે આ રકમ (રૂ. ૨૪૬.૨૨ લાખ) નાણાંકીય પત્રકોમાં “મળવાપાત્ર” તરીકે દર્શાવાઈ નથી. કારણ કે તે રકમો, દાવાની રકમ, ખરેખર મળેથી હિસાબમાં લેવાની થાય છે.
- ૩.૧૬** ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના તમામ કર્મચારીઓ રાજ્ય સરકારના કર્મચારી છે. તેમગણી, આ બાબતને રાજ્ય સરકારનું સમર્થન મળવું બાકી છે, નિવૃત્તિ સમયે રજા પગારના રોકડમાં રૂપાંતરની ચુકવણી કરતી વખતે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા આવક વેરા કાયદા અંતર્ગત મુળ સ્થાનેથી કર કપાત કરવામાં આવતી નથી.
- ૩.૧૭** એ. આવકવેરા ધારા, ૧૯૬૧ ની ખોગવાઈઓ મુજબ ગુજરાત પાણી પુરવઠા બોર્ડ સંચિત નુકશાન હોવાને કારણે વેરો ચૂકવવાની જરૂરીયાત રહેતી નથી. પાણી પુરવઠા બોર્ડ કંપની ધારા ૧૯૫૬ અંતર્ગત નોંધાયેલ કંપની ન હોઈ ઈન્કમેટેક્સ એક્ટ ૧૯૬૧ મુજબની બુક પ્રોફિટ પર મીનીમમ ઓલ્ટરનેટીવ ટેક્સની ખોગવાઈ કરેલ નથી.
બી. વિચારણા બાદ એકત્રિત થયેલી ખોટને ખોતાં નહીં ચુકવાયેલા કરવેરા અસ્કયામતો નક્કી કરવામાં આવેલ નથી.
- ૩.૧૮** એ. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ઉચાપતના ૬ કિસ્સાઓમાં રોકડ ઉચાપતની રકમ રૂ. ૨૯.૫૯ લાખ (અગાઉના વર્ષના રૂ. ૨૯.૫૯ લાખ) ની નક્કી કરેલ. જેની સામે ૨૦૧૯-૨૦ સુધીમાં રૂ. ૧૮.૪૧ લાખ (ગત વર્ષે રૂ. ૧૬.૮૪ લાખ) વસુલ કરવામાં આવેલ છે. આ બાબતમાં વ્યવસ્થાપક મંડળ દ્વારા વહીવટી પગલાં લેવામાં આવી રહ્યાં છે. આ બાબત કાનૂની કાર્યવાહી હેઠળ હોઈ નાણાંકીય પત્રકોમાં નુકસાન માટે કોઈ ખોગવાઈ કરવામાં આવી નથી.
બી. જા.આ.બાં. વિભાગ, દાહોદના કાર્યપાલક ઈજનેરની બદલી અન્ય વિભાગીય કચેરીમાં કરવામાં આવેલ હતી. તેમ છતાં, તેઓએ ઠેકેદારોને રૂ. ૪૦૨.૫૫ લાખની પેશગી ચૂકવી હતી અને (લોક ફાળો) જે ઠેકેદારો દ્વારા લોકો પાસેથી વસુલ કરવાનો હતો તેવા પોપ્યુલર કોન્ટ્રીબ્યુશન (લોકફાળા)ની રકમ રૂ.૮૩.૩૫ લાખની ચૂકવણી કરેલ હતી. જે રકમ સામે ઠેકેદારો પાસેથી તા.૩૧.૩.૨૦૨૦ સુધી અનુક્રમે રૂ.૩૪૯.૬૫ લાખ (ગત વર્ષના રૂ. ૩૪૯.૬૫ લાખ) અને રૂ. ૬૧.૦૫ લાખ (ગત વર્ષના રૂ. ૬૧.૦૫ લાખ) ની વસૂલાત થયેલ છે. આ બાબતે બોર્ડ દ્વારા જરૂરી વહીવટી પગલાં લેવામાં આવી રહેલ છે.
- સી. અમરેલી ખાતેના જાહેર આરોગ્ય વર્તુળના વર્ષ ૨૦૦૮-૦૯ દરમ્યાન કોન્ટ્રાક્ટર અને સપ્લાયરોને કરેલ ચુકવણીના સંદર્ભમાં મળેલ અહેવાલ આધારીત રૂ. ૩,૨૧૧.૦૦ લાખ (ગત વર્ષે રૂ. ૩૨૧૧.૦૦ લાખ) ની શંકાસ્પદ છેતરપિંડી ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા નિર્ધારીત કરવામાં આવેલ છે. ગુ.પા.પુ. અને ગ.વ્ય. બોર્ડ દ્વારા છ કર્મચારીઓ સામે જરૂરી વહીવટી પગલાં લેવા સહિત મુખ્ય જિલ્લા અને સેશન્સ કોર્ટ, અમરેલીમાં ફોજદારી દાવો માંડવા અને ૭ કોન્ટ્રાક્ટરો સામે રૂ.૩૨૧૧.૦૦ લાખની વસૂલાત માટે દાવા દાખલ કરેલ છે. મામલો ન્યાયાધીન હોય આ કિસ્સામાં કોઈ હિસાબી નોંધો કરવામાં આવી નથી. નામ. વરિષ્ઠ ન્યાયાધિશ (સિવિલ) દ્વારા તા.૪.૦૩.૨૦૨૦ના રોજ દાવો કાઠી નાખેલ છે. જો કે, બોર્ડ દ્વારા નામ. કોર્ટમાં દાવો દાખલ કરવા પગલા લેવાઈ રહ્યા છે.



વાર્ષિક હિસાબો અને ઓડિટરશીનો અહેવાલ ૨૦૧૯-૨૦

- ડી. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ મે. સાંઘી સિમેન્ટને કેટલાક ગામોમાં પાણી પુરૂ પાડવા માટે રૂ. ૧,૫૦૦.૦૦ લાખની પેશગી આપેલ છે. તે પૈકી રૂ. ૬૦૦.૦૦ લાખ (ગત વર્ષના રૂ. ૬૦૦.૦૦ લાખ) વસુલ કરવાના બાકી છે. વસુલાતની બાબત વિવાદમાં છે. આ બાબત લવાદને સોંપેલ છે. લવાદના ચુકાદાની રાહ જોવાઈ રહી છે.
- ઈ. વર્ષ ૨૦૧૪-૧૫ દરમ્યાન ધ્યાને આવેલ કે વપરાશકારો પાસેથી મળેલ પાણી ચાર્જિસ અને ડ્રેનેજ કનેક્શનની ડિપોઝીટના રૂ. ૧૮.૮૨ લાખની જા.આ.સુબાકારી પેટા વિભાગ, આહવા-ડાંગ કચેરીમાં ઉચાપત થયેલ છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા સંબંધિત અધિકારી/ કર્મચારીઓ સામે વહીવટી કાર્યવાહી શરૂ કરેલ છે. જો કે, ઉચાપત થયેલ રકમની હજુ સુધી વસૂલાત બાકી છે.
- એફ.આંતરિક ઓડિટર દ્વારા જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ, નખત્રાણાએ પેટા વિભાગોને આપેલ રૂ.૧૨૪.૯૮ લાખની તસલમાત માંથી કરવામાં આવેલ રૂ.૮૨.૫૦ લાખના ખર્ચમાં ગંભીર અનિયમિતતા શોધી કાઢી છે અને તેઓએ વિગતવાર તપાસ કરવા અભિપ્રાય આપેલ છે. આંતરિક ઓડિટરના અહેવાલના આધારે ગુ.પા.પુ. અને ગ. વ્ય.બોર્ડ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરી છે. જેના અહેવાલની રાહ જોવાઈ રહી છે.
- જી. આંતરિક ઓડિટરના અહેવાલ મુજબ જા.આ.બાં. વિભાગ, દેવભૂમિ દ્વારકાની પેટા વિભાગીય કચેરીઓ દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯ દરમ્યાન સંબંધિત અધિકારીને મળેલ સત્તાધિકાર ઉપરાંતની રકમનો (ખર્ચના ભાગલા પાડીને) મરામત અને નિભાવનો ખર્ચ કરેલ છે. આંતરિક ઓડિટર દ્વારા ખાતાકીય તપાસ માટે અભિપ્રાય આપેલ છે. તે મુજબ ગુ.પા.પુ. બોર્ડ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરી છે. વર્ષ ૨૦૧૯-૨૦ના આંતરિક ઓડિટ દરમ્યાન ધ્યાને આવેલ છે કે પેટા વિભાગ કચેરીઓ દ્વારા સમાન પ્રકારની સત્તા ન હોવા છતાં ખર્ચ કરવાની પ્રણાલી ચાલુ રાખેલ છે. તેજ રીતે આંતરિક ઓડિટર્સ જાં.આ.બા.વિ. રાજપિપળા દ્વારા અવલોકનમાં લીધા મુજબ પુરુશી ખરીદવા માટે કાર્યપાલક ઈજનેર દ્વારા તેઓને મળેલ અધિકાર થી વિશેષ ખર્ચ કરવાની બાબત ધ્યાને આવેલ છે. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરાઈ છે. જેના અહેવાલની રાહ જોવાઈ રહી છે.
- એચ. જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ, બોટાદના આંતરિક ઓડિટરને ૨૦૧૯-૨૦ના વર્ષમાં ઓડિટ દરમ્યાન કોન્ટ્રાક્ટરને વધુ ચૂકવણું (રૂ. ૪.૦૯ લાખ), ગ્રામ પંચાયત માટે ટ્રેક્ટર તથા ટ્રેલરની અનઅધિકૃત ખરીદી (રૂ. ૯.૬૫ લાખ) કરવી, કોન્ટ્રાક્ટરના વાઉચર ગુમ થઈ જવા (રૂ.૧.૬૦ લાખ) અને કન્ટીનન્સી ફંડમાંથી પ્રોજેક્ટ ફંડ ખાતે નાણાંની તબદીલી જેવી ગંભીર અનિયમિતતાઓ ધ્યાને આવેલ છે. આ બાબતે આંતરિક ઓડિટરના અહેવાલના આધારે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા પ્રાથમિક તપાસ શરૂ કરેલ છે. અહેવાલની રાહ જોવાઈ રહી છે.
- આઈ. જાહેર આરોગ્ય પેટા વિભાગ, દયાપર (જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ નખત્રાણાની નીચે કામ કરતા) અગાઉના વર્ષોમાં આપેલ ઈમ્પ્રેસ્ટ રૂ.૧૨.૩૦ લાખ જેનું મેળવણું કરવાની બાકી હતી તે વર્ષ ૨૦૧૯-૨૦માં એમપીડબલ્યુ એકાઉન્ટ ખાતે ઉધારવામાં આવેલ છે.
- ૩.૧૯** પરચુરણ દેવાદારો, પરચુરણ લેણદારો, તેમ જ કર્મચારીઓને લોન અને પેશગીઓની સિલકો જે તે પક્ષકારો સાથે મેળવણા બાદ સમર્થન મળવાની તેમજ હિસાબમેળની શરતે દર્શાવવામાં આવી છે.
- ૩.૨૦** નીચેના ખાતાઓમાં ૩૧મી માર્ચ ૨૦૧૯ ની બાકી સિલકો (ઉધાર/જમા) મેળવણાં કરી સમર્થન મેળવવાની શરતે અને હિસાબમેળ (જો હોય તો), ની શરતે દર્શાવાઈ છે.
- ૩.૨૦.૧** અછત માટેનું ફંડ (જમા) રૂ. ૩૮૭૧૯.૪૫ લાખ (ગત વર્ષે (જમા) રૂ. ૩૫૭૧૯.૪૫ લાખ)

- ૩.૨૦.૨ અન્ય મુડીની આવક (જમા) રૂ. ૮.૪૫ લાખ (ગત વર્ષે (જમા) રૂ. ૮.૪૫ લાખ)
- ૩.૨૦.૩ સપ્લાયરો પાસેથી મળેલી અનામતોની રકમ (જમા) રૂ. ૫૩૮૯.૮૪ લાખ (ગત વર્ષે (જમા) રૂ. ૫૪૮૮.૪૦ લાખ)
- ૩.૨૦.૪ વર્કર્સ કોન્ટ્રાક્ટ પેટેની અનામતો (જમા) રૂ. ૩૦૦૭૩.૮૧ લાખ (ગત વર્ષે (જમા) રૂ. ૩૭૨૫૮.૫૩ લાખ)
- ૩.૨૦.૫ અન્ય પાસેથી મળેલી અનામતો (જમા) રૂ. ૧૯૪૭૭.૬૪ લાખ (ગત વર્ષે (જમા) રૂ. ૧૯૩૦૩.૯૯ લાખ)
- ૩.૨૦.૬ કિર્લોસ્કર (જમા) રૂ. ૫૦૫૧.૧૪ લાખ (ગત વર્ષે (જમા) રૂ. ૫૦૫૧.૧૪ લાખ)
- ૩.૨૦.૭ કિર્લોસ્કર કોન્સ્ટન્ટ ફીગર (ઉદ્યોગ) રૂ. ૨૬૩૦.૫૧ લાખ (ગત વર્ષે (ઉદ્યોગ) રૂ. ૨૬૩૦.૫૧ લાખ)
- ૩.૨૦.૮ ખરીદીને કારણે ઉભા થયેલા પરચૂરણ લેણદારો (ઉદ્યોગ) રૂ. ૧૩૩.૩૩ લાખ (ગત વર્ષે (ઉદ્યોગ) રૂ. ૧૩૩.૩૩ લાખ)
- ૩.૨૦.૯ જેનો પ્રતિભાવ મળેલ છે તેવા વર્તુળ બહારના સી.એસ.એસ. (જમા) રૂ. ૧૧૦૮.૦૧ લાખ (ગત વર્ષે (જમા) રૂ. ૧૧૦૮.૦૧ લાખ)
- ૩.૨૦.૧૦ જેનો પ્રતિભાવ મળેલ છે તેવા વર્તુળ અંદરના જવાબી સી.એસ.એસ. (જમા) રૂ. ૧૬૧.૮૧ લાખ (ગત વર્ષે (જમા) રૂ. ૧૬૧.૮૧ લાખ)
- ૩.૨૦.૧૧ સ્થાનિક સંસ્થાઓ પાસેથી થાપણો (ગ્રાન્ટ ઈન એઈડનો ભાગ) (જમા) રૂ. ૨૧૭૫.૯૩ લાખ (ગત વર્ષે (જમા) રૂ. ૨૧૭૨.૩૪ લાખ)
- ૩.૨૦.૧૨ થાપણો પૈકી લોન ની રકમ ભાગ (જમા) રૂ. ૩૭૫૦.૩૧ લાખ (ગત વર્ષે (જમા) રૂ. ૩૭૫૦.૩૧ લાખ)
- ૩.૨૦.૧૩ સ્થાનિક સંસ્થાઓને સહાયક અનુદાન (જમા) રૂ. ૧૫૯૬.૪૯ લાખ (ગત વર્ષે (જમા) રૂ. ૧૫૯૬.૪૯ લાખ)
- ૩.૨૦.૧૪ તસલમાત થાપણો (જમા) રૂ. ૪૦.૬૧ લાખ (ગત વર્ષે (જમા) રૂ. ૫૨.૭૧ લાખ)
- ૩.૨૦.૧૫ ભવિષ્યનિધિ ભંડોળમાં કર્મચારીઓનો ફાળો (ઉદ્યોગ) રૂ. ૦.૦૮ લાખ (ગત વર્ષે (ઉદ્યોગ) રૂ. ૦.૦૮ લાખ)
- ૩.૨૦.૧૬ કર્મચારીઓ પાસેથી ભ.નિ.માંથી આપેલ લોનની વસૂલાત (જમા) રૂ. ૩૭.૪૧ લાખ (ગત વર્ષે (જમા) રૂ. ૩૭.૪૧ લાખ)
- ૩.૨૦.૧૭ સ્થાનિક સંસ્થાઓના સત્તાઓવાળાઓ પાસેથી વસૂલ કરેલી રકમ (જમા) રૂ. ૨૦૯૯૨૦.૯૭ લાખ (ગત વર્ષે (જમા) રૂ. ૨૦૫૩૨૭.૧૭ લાખ)
- ૩.૨૦.૧૮ સ્થાનિક સંસ્થાઓને લોન (ઉદ્યોગ) રૂ. ૨૯૩૮.૪૧ લાખ (ગત વર્ષે (ઉદ્યોગ) રૂ. ૨૯૩૮.૪૧ લાખ)
- ૩.૨૦.૧૯ જીવન વીમા નિગમ લોન (ઉદ્યોગ) રૂ. ૨૦૧૩.૪૪ લાખ (ગત વર્ષે (ઉદ્યોગ) રૂ. ૨૦૧૩.૪૪ લાખ)
- ૩.૨૦.૨૦ રાજ્ય સરકારની લોન (ઉદ્યોગ) રૂ. ૯૮૧.૨૬ લાખ (ગત વર્ષે (ઉદ્યોગ) રૂ. ૯૮૧.૨૬ લાખ)
- ૩.૨૦.૨૧ આઈ.ડી.એ. પ્રોજેક્ટો (ઉદ્યોગ) રૂ. ૧૦૦.૫૨ લાખ (ગત વર્ષે (ઉદ્યોગ) રૂ. ૧૦૦.૫૨ લાખ)
- ૩.૨૦.૨૨ સ્થાનિક સંસ્થાઓને સહાયક અનુદાન (ઉદ્યોગ) રૂ. ૧૦૧૧.૦૨ લાખ (ગત વર્ષે (ઉદ્યોગ) રૂ. ૧૦૧૧.૦૨ લાખ)
- ૩.૨૦.૨૩ મકાન બાંધકામ પેશગી-મુદ્દલ (બોર્ડ) (ઉદ્યોગ) રૂ. ૩.૪૪ લાખ (ગત વર્ષે (ઉદ્યોગ) રૂ. ૩.૪૯ લાખ)
- ૩.૨૦.૨૪ મકાન બાંધકામ પેશગી (જમા) રૂ. ૭.૪૯ લાખ (ગત વર્ષે (જમા) રૂ. ૭.૪૯ લાખ)
- ૩.૨૦.૨૫ વાહન પેશગી (જમા) રૂ. ૯૦.૩૮ લાખ (ગત વર્ષે (જમા) રૂ. ૮૯.૮૫ લાખ)
- ૩.૨૦.૨૬ તહેવાર પેશગી (જમા) રૂ. ૫૧.૨૯ લાખ (ગત વર્ષે (જમા) રૂ. ૫૦.૭૧ લાખ)
- ૩.૨૦.૨૭ અનાજ પેશગી (જમા) રૂ. ૭૭.૬૦ લાખ (ગત વર્ષે (જમા) રૂ. ૭૭.૨૯ લાખ)
- ૩.૨૦.૨૮ અન્ય પેશગી (જમા) રૂ. ૧.૫૪ લાખ (ગત વર્ષે (જમા) રૂ. ૧.૫૪ લાખ)
- ૩.૨૦.૨૯ ખાતાના કર્મચારીઓને લોન/પેશગીઓ (ઉદ્યોગ) રૂ. ૭.૫૭ લાખ (ગત વર્ષે (ઉદ્યોગ) રૂ. ૭.૫૭ લાખ)
- ૩.૨૦.૩૦ અન્ય પાસેથી વસૂલાતપાત્ર દાવા (ઉદ્યોગ) રૂ. ૪૬.૩૪ લાખ (ગત વર્ષે (ઉદ્યોગ) રૂ. ૪૫.૮૫ લાખ)
- ૩.૨૦.૩૧ સપ્લાયરો અને કોન્ટ્રાક્ટરો પાસેથી વસૂલાતપાત્ર દાવા (ઉદ્યોગ) રૂ. ૧૯૮.૦૭ લાખ (ગત વર્ષે (ઉદ્યોગ) રૂ. ૨૦૩.૯૯ લાખ)



વાર્ષિક હિસાબો અને ઓડીટરશ્રીનો અહેવાલ ૨૦૧૯-૨૦

- ૩.૨૦.૩૨ વસુલાત પાત્ર દાવા (ઉદ્યોગ) રૂ. ૨૬૪.૯૩ લાખ (ગત વર્ષે (ઉદ્યોગ) રૂ. ૬૦.૦૬ લાખ)
- ૩.૨૦.૩૩ વસુલાત પાત્ર ગુજરાત સરકાર પાસેથી (ઉદ્યોગ) રૂ. ૫૦.૭૪ લાખ (ગત વર્ષે (ઉદ્યોગ) રૂ. ૫૦.૭૪ લાખ)
- ૩.૨૦.૩૪ ગુજરાત સરકાર પાસેથી વસુલાત પાત્ર સ્થાનિક સંસ્થાઓની થાપણો (ઉદ્યોગ) રૂ. ૧૩૫.૩૦ લાખ (ગત વર્ષે (ઉદ્યોગ) રૂ. ૧૩૫.૩૦ લાખ)
- ૩.૨૦.૩૫ સમાયોજન કચેરી બીજી આઈટમો (ઉદ્યોગ) રૂ. ૦.૪૩ લાખ (ગત વર્ષે (ઉદ્યોગ) રૂ. ૦.૪૩ લાખ)
- ૩.૨૦.૩૬ જુથ વીમા યોજના (ઉદ્યોગ) રૂ. ૧૦૪.૫૭ લાખ (ગત વર્ષે (ઉદ્યોગ) રૂ. ૫૮.૩૭ લાખ)
- ૩.૨૧ માર્ગસ્થ ભરણા (ટેમીટન્સ) સદર નીચેની બાકી રૂ. ૨૪,૧૭૬.૯૦ લાખ (ગત વર્ષે ની રૂ. ૨૫,૯૧૭.૪૦ લાખ) અને તસલમાત હિસાબની રૂ. ૧૬.૫૭ લાખ (ગત વર્ષે રૂ. ૫૮.૫૮ લાખ) જે રોકડ અને બેંકની સિલકો તરીકે (અનુસૂચિ-૭માં) મેળવણાની અને સમાયોજનની શરતે દર્શાવવામાં આવી છે.
- ૩.૨૨ ગુ. પા. પુ. અને ગ. વ્ય. બોર્ડ સરકારી ઉપક્રમ હોવાથી રાજ્ય દ્વારા નિયંત્રિત સાહસ છે. એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ (એએસ) ૧૮ ના ફક્ત ૯ પ્રમાણે રાજ્ય સંચાલીત અન્ય સાહસ અને તેની સાથેના વ્યવહારોના સંદર્ભમાં (રીલેટેડ પાર્ટી ડિસ્ક્લોઝર) કોઈ વિગતો જાહેરાત કરવાની રહેતી નથી. મુખ્ય વહીવટી સંચાલકો સાથે કોઈ વ્યવહારો થયેલ નથી અને તેથી તે માટે કોઈ વિગતો જાહેર કરવામાં આવેલ નથી.
- ૩.૨૩ ગુ.પા.પુ. અને ગ.વ્ય.બોર્ડ, ગુ.પા.પુ. અને ગ.વ્ય.બોર્ડ અધિનિયમ -૧૯૭૮ નીચે સ્થપાયેલ સરકારી સાહસ હોવાથી તેની કોઈ શેરમૂડી નથી. તેથી, શેરદીઠ કમાણીની ગણતરી કરવામાં આવી નથી.
- ૩.૨૪ ગુ.પા.પુ. અને ગ.વ્ય.બોર્ડ એક એકમ તરીકે પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાના વ્યવસ્થાપન ક્ષેત્રમાં કામગીરી કરે છે અને તેના વિગતો દર્શાવવી પડે તેવા અલગ કોઈ વિભાગો (સેગમેન્ટ) નથી.
- ૩.૨૫ ગુ.પા.પુ અને ગ.વ્ય.બોર્ડ ઈમ્પ્રોવમેન્ટ ઓફ એસેટ્સની (અસ્કયામતોને નુકસાન) જરૂરી માહિતી એકત્રિત કરેલ નથી અને તેથી તેની હિસાબોમાં કોઈ અસર આપવામાં આવેલ નથી.
- ૩.૨૬ જેમણે ગુ.પા.પુ.અને ગ.વ્ય.બોર્ડને માલ સામાન અને સેવાઓ પૂરી પાડી છે અને જે ખૂબ જ નાનાં (માઈક્રો) અને નાના સાહસો જેની માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટર પ્રાઈસીઝ એક્ટ, ૨૦૦૬ નીચે વર્ગીકૃત થાય તેવા એકમો શોધી કાઢવાનું બાકી છે. આ માટે જરૂરી માહિતીના અભાવે નાણાકીય પત્રકોમાં જરૂરી વિગતો જાહેર કરવામાં આવેલ નથી.
- ૩.૨૭ અગાઉના વર્ષોમાં ગુ.પા.પુ. અને ગ.વ્ય.બોર્ડ દ્વારા ભારતીય જીવન વીમા નિગમ પાસેથી જુદી જુદી સ્થાનિક સંસ્થાઓ માટે અને તેમના વતી એકંદર કુલ રૂ. ૧૭,૬૯૪.૨૭ લાખ (અગાઉના વર્ષે રૂ. ૧૭,૬૯૪.૨૭ લાખ) ની લોન લીધી છે. સ્થાનિક સંસ્થાઓ દ્વારા લોન તથા વ્યાજની શુન્ય/ ઓછી પરત ચુકવણી કરવા છતાં ગુ.પા.પુ. અને ગ.વ્ય.બોર્ડ દ્વારા વ્યાજ સહીત લોન જીવન વીમા નિગમને પરત ચુકવી દીધી છે. સ્થાનિક સંસ્થાઓ પાસેથી બાકી રહેલી નીકળતી રકમ(મેળવણાને આધીન)નો લોન અને પેશગીઓ હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે. (મૂળ રકમ, વ્યાજ અને વિલંબિત ચુકવણી ના ચાર્જ પેટે વસુલ કરવામાં આવેલી રકમ આ ખાતે જમા કરવામાં આવે છે.) જરૂરી વિગતોના અભાવે વસુલાતની રકમમાંથી ગુ.પા.પુ. અને ગ.વ્ય.બોર્ડ ની આવકના સમાયોજનની નોંધ કરવામાં આવી નથી.
- ૩.૨૮ ૯.૫.૧૯૯૭ થી ગુ.પા.પુ. અને ગ.વ્ય.બોર્ડ ની મુખ્ય કચેરીમાં એન્ફોર્સમેન્ટ સેલ સ્થાપવામાં આવ્યું છે જે મુખ્ય વહીવટી અધિકારી વીજીલન્સ સેલ, ગાંધીનગરનાં હાથ નીચે કામ કરે છે. ગુ.પા.પુ. અને ગ.વ્ય.બોર્ડ ની જુદી જુદી કચેરીઓની ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારને લગતી અરજીઓ / ફરિયાદો ગુ.પા.પુ. અને ગ.વ્ય.બોર્ડ માં સતત મળતી રહે છે જે અન્વયે વીજીલન્સ સેલ તપાસ કરે છે અને તપાસ અહેવાલ તૈયાર કરવાનું કામ એન્ફોર્સમેન્ટ સેલને

સોંપવામાં આવેલું છે. નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ અને અગાઉના વર્ષોમાં ગુ.પા.પુ. અને ગ.વ્ય.બોર્ડ ની વીજીલન્સ સેલની વિવિધ કચેરીઓમાં થયેલી તપાસોના સંદર્ભમાં આખરી અહેવાલ/ છેલ્લા પરિણામો મળવાના બાકી છે. જ્યાં જરૂરી લાગે, તેમ નાણાકીય પત્રકોમાં તેના માટેની હિસાબી નોંધો કરવામાં આવી નથી. આ ઓફિસમાંથી જે વર્ષમાં આખરી અહેવાલ/ આખરી તારણ મળશે તે વર્ષમાં જરૂર જણાયે હિસાબી અસરો/નોંધો કરવામાં આવશે.

૩.૨૯ અગાઉના સમયગાળાના હવાલામાં નીચેનો સમાવેશ થાય છે.

(રૂ. લાખમાં)

વિગતો	૨૦૧૯-૨૦	૨૦૧૮-૧૯
અગાઉના વર્ષના વ્યવહારો (ચોખ્ખી રકમ- નેટ)	૮૦.૧૫	૭૫૮.૧૩

૩.૩૦ ગતવર્ષના આંકડાઓમાં જરૂર જણાય ત્યાં જૂથોનું પૂનર્ગઠન / પુનઃ ગોઠવણી કરવામાં આવી છે. કોંસમાં દર્શાવેલી રકમો ગત વર્ષના આંકડા દર્શાવે છે.

અનુસૂચિ ૧ થી ૧૬ ઉપર સહી

એમ.પી. પુજરા
નાણા નિયંત્રક

મયુર મહેતા, IAS
સભ્ય સચિવ

ઘનંજય દિવેદી, IAS
અધ્યક્ષ

સમાન તારીખના અમારા આ સાથે સામેલ રાખેલ અહેવાલ મુજબ

બી. ઉપાધ્યાય એન્ડ કું.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ

ફર્મ રજી . નં. : ૧૧૧૧૬૬ ડબલ્યુ

સહી

એચ.બી. ઉપાધ્યાય

પાર્ટનર

મેમ્બરશીપ નં. : ૦૩૮૧૯૮

સ્થળ : ગાંધીનગર

તારીખ : ૦૮.૦૨.૨૦૨૧

સ્થળ : ગાંધીનગર

તારીખ : ૦૮.૦૨.૨૦૨૧